

શ્રી જોટવા પાર્શ્વનાથાય નમઃ
શ્રી સિદ્ધિ-મેઘ-મનોહર-ભદ્રકંઈ-રવિપ્રભ સદ્ગુરુભ્યો નમઃ

સુખની સીડી

આશીર્વાદ : પ્રભાવક પ્રવચનકાર પૂજ્ય આચાર્ય
શ્રીમદ્ વિજય નરરત્નસૂરીશ્વરજી મહારાજા

સંપાદક : શ્રી જૈન વિશા શ્રીમાણી ૧૦૮ ના ગોળનું યુવક મંડળ, અમદાવાદ

સુખની સીડી

પ્રકાશક : આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ, અમદાવાદ.

આવૃત્તિ : પ્રથમ, નકલ : ૧૦૦૦, ઈ.સ. ૨૦૧૩, મૂલ્ય : રૂ. ૨૦.૦૦

પ્રાપ્તિ સ્થાન :

(૧) આચાર્ય શ્રી ભદ્રકરસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ

વાસણા બેરેજ રોડ, અમદાવાદ-૭.

ફોન : (નીલેશભાઈ) ૦૮૪૨૭૧ ૦૬૦૨૦

(૨) શ્રી જોટવા પાર્શ્વનાથ તીર્થ –

મુ. પો. ધીણોજ, તા. ચાણસમા, જિલ્લો-પાટણ.

ફોન : (૦૨૭૩૪) ૨૬૩૬૭૪.

પ્રાસ્તાવિકક્રિયિત

સદ્ગુરીચારથી માંગીને નિર્વાણપદની પ્રાપ્તિસુધી ઉંચે પહોંચવા પૂર્વ-મહર્ષિઓએ વીતરાગના વચનોના વિસ્તારરૂપે અઠળક શાસ્ત્રો રચ્યા છે, તેને જીવનમાં વણ્ણાં છે, પ્રચાર્યાં છે અને આપજાં સુધી પહોંચાડ્યાં છે, તે ઉપકારનું અગણિત ઋષ માનવજીતને માથે છે.

છતાં, આજે માણસ એ શાસ્ત્રોથી વિમુખ બની ભૌતિક સુખની પાછળ ઘસડાઈ રહ્યો છે. ભૌતિક અને આધ્યાત્મિક સુખમાં ઉત્તર-દક્ષિણ જેટલો ભેદ છે. ભૌતિક દણ્ણ મૂળ તત્ત્વ આત્માને ભૂલીને ઈન્દ્રિયોના સ્વતંત્ર ભોગને જંખે છે, તેથી ઉલટ આધ્યાત્મ દણ્ણ ઈન્દ્રિયોના વિષયથી મુક્ત-આત્મ સામ્રાજ્યને ઈચ્છે છે, એમ બન્નેમાં મૌલિક મોટે ભેદ છે.

ભૌતિક સુખોથી આત્મા કદાપિ સુખી થાય નહિ, એમ છતાં વધી રહેલા ભૌતિકવાદને નાથવા આજે માણસ નિર્બળ બની રહ્યો છે, એટલું જ નહિ, જગતને ક્યારેય કોઈ પણ સુધ્દારી શક્યું નથી. માણસે સ્વયં સુધરવાનું છે એ માર્ગ જ આપણું અને જગતનું પણ હિત થઈ શકે !

માણસ આજે શાસ્ત્રાભ્યાસ માટે કે શ્રવણ માટે સમય મેળવી શકતો નથી. સદ્ગુરુનો યોગ સાધી શકતો નથી, ત્યારે પણ સદ્ગુરુના અનુકૂળ સમયે કરી શકે એ કારણે સન્માર્ગ પોષક સાહિત્યની આજે ઉપાદેયતા વધી રહી છે.

જ્યારે મન ભૌતિક સુખની લાલચ કરે છે ત્યારે પરમાત્માની તાત્ત્વિક ભક્તિ થઈ શકતી નથી, કારણકે પ્રભુ ભક્તિમાં અધ્યાત્મ દણ્ણની મુખ્યતા છે, તેને બદલે ભૌતિક સ્વાર્થનો પ્રવેશ થતાં ભક્તિ દૂષિત બની જાય છે.

પ્રભુ ભક્તિ વિના પ્રભુતા નથી અને પ્રભુતા વિના સાચી શાન્તિ નથી, તો ભક્તે ભૌતિક સુખના ત્યાગ દ્વારા અનાદિ વાસનાઓનું ઝેર ઉત્તારવું જોઈએ. વાસનાઓ એ જ મોટું બંધન છે, તેથી જ્ઞાનીઓ પોકારીને કહે છે કે માનવે જુગ જૂની, વાસનાઓના બંધન તોડીને ભવનાશક વૈરાગ્ય ભાવને અંકુરિત કરવો જોઈએ.

આજે ધર્મની પ્રવૃત્તિ અને સાધન સામગ્રી વધી રહી છે પરંતુ તત્ત્વનું ઉંડાણ છીએલું બની રહ્યું છે, તેનું કારણ ધર્મપ્રવૃત્તિમાં ભૌતિક કામનાઓની હવા પ્રવેશ કરી રહી છે.

થોડો પણ વિચાર કરો તો જણાય કે માણસને મળેલું શરીર મુક્તિની મુસાફરી માટેનું અલૌકિક યાંત્રિક વાહન છે, તેમાં રહેલો આત્મા મુસાફર છે, મન દ્રાઈવર છે અને હાથ-પગ-ઈન્ડ્રિયો વગેરે તેનાં ચકો છે. પણ શોચનીય છે કે દ્રાઈવર મન આત્માની ઈચ્છા વિરુદ્ધ વાહનને ઉલ્ટે માર્ગ વાળી આત્માને ફસાવી રહ્યો છે. આ પરિસ્થિતિમાં આત્મા સજાગ ન બને તો તેની શું દશા થાય એ સમજાવું કઠીન નથી.

માટે આપણે મન ઉપર કાબૂ મેળવવો જરૂરી છે – મનની વિચારની અસર આચાર ઉપર થાય છે અને જેવા આચાર તેવું ભાવિ ફળ સર્જાય છે. માટે મનને સ્વસ્થ (સ્વાધીન) કરવા સંદ્રભાંયનનો આશ્રય જરૂરી છે.

મન અને ઈન્ડ્રિયોના સમુહરૂપ આ દેહથી આત્મહિત કરવા માટે પાયાના ધર્મની જરૂર છે. આજનો ધર્મ બહુધા પાયા વિનાના મહેલ જેવો કે મૂળ વિનાના વૃક્ષ જેવો છે. તેમાં પાયાની ખામી દૂર કરવા શાનીઓએ ધર્મના પાયારૂપ જીવનના પાંત્રીસ ગુણોને જણાવ્યા છે.

અતે તે ઉપ ગુણોનું જ આંશિક વિવરણ આલેખાયેલ છે. જે વિવરણ જૈન-જૈનેતર, આસ્તિક-નાસ્તિક તમામ પ્રજાના સ્તરને ધ્યાનમાં રાખીને લખાયેલ હોવાથી વાચક વર્ગ સ્વ-યોગ્ય ગુણોનું ગ્રહણ કરે તેવી સૂચના.

આશા છે ધર્મના પાયારૂપ આ લેખ સંગ્રહ જીવોને અતિ ઉપકારક બની રહેશે. વાંચક મહાશય તેમાંથી થોડું પણ ગ્રહણ કરેશે તો પ્રયત્ન સફળ થશે એવી શુભ અભિલાષા


- આ.શ્રી નરરત્નસૂરીશ્વરજી મ.સા.

અનુક્રમણિકા

ક્રમ	નામ	પાના નં
૧	પોસ્ટમોર્ટમ-૧	૬
૨	પોસ્ટમોર્ટમ-૨	૮
૩	ન્યાય સમ્પત્તિ વૈભવ	૧૨
૪	શિષ્ટાચારની પ્રશંસા	૧૫
૫	કુલ-શીલથી સમાન એવા તિનિ ગોત્રીય સાથે વિવાહ	૧૮
૬	પાપ ભીરૂતા	૨૧
૭	પ્રસિદ્ધ દેશાચારીનું પાલન	૨૪
૮	નિંદાનો ત્યાગ	૨૮
૯	સુયોગ્ય ઘરમાં વસવું	૩૧
૧૦	સદાચારીઓની સંગત કરવી	૩૪
૧૧	કૃતજ્ઞતાને ધારણ કરવી	૩૭
૧૨	ઉપદ્રવવાળા સ્થાનને તજવું	૪૦
૧૩	લોક ગર્હિત કાર્યોનો ત્યાગ	૪૩
૧૪	આવક પ્રમાણે ખર્ચ	૪૬
૧૫	સંપત્તિને છાજે તેવો વેશ પહેરવો	૪૮
૧૬	બુદ્ધિના આઈ ગુણવાળા થવું	૫૨
૧૭	નિત્ય ધર્મનું શ્રવણ કરવું	૫૫
૧૮	અજિર્ણો ભોજન ન કરવું	૫૮
૧૯	યોગ્ય કાળે પથ્ય જમવું	૬૧
૨૦	ધર્મ, અર્થ, કામ ને પરસ્પર બાધા ન પહોંચે તેમ વર્તવું	૬૪
૨૧	અતિથિ, સાધુ અને દીન-દુઃખીની સેવા કરવી	૬૬
૨૨	અસદુ આગ્રહને સદૈવ તજવો	૬૮
૨૩	ગુણોમાં પક્ષપાત્ર કરવો	૭૨

૨૪	દેશ-કાળને વિરુદ્ધ પ્રવૃત્તિ તજવી	૭૫
૨૫	બળાબળનો વિચાર કરવો	૭૮
૨૬	સંદાચારી એવા જ્ઞાનવૃષ્ટોને પૂજવા	૮૧
૨૭	આશ્રિતોને પાળવા પોખવા	૮૪
૨૮	દીર્ઘદ્ધા થવું	૮૭
૨૯	વસ્તુના તારતમ્યને જાણવું	૯૦
૩૦	કૃતજ્ઞતા સંપરી રહેવું	૯૩
૩૧	લોકપ્રિય થવું	૯૫
૩૨	લજજણું થવું	૯૮
૩૩	દ્યાળુપણું પ્રગટાવવું	૧૦૨
૩૪	સૌભ્ય પ્રકૃતિવાળા થવું	૧૦૪
૩૫	પરોપકાર પરાયણ થવું	૧૦૮
૩૬	હ અંતરંગ શત્રુને તજવામાં તત્પરતા રાખવી	૧૧૧
૩૭	જિતેન્દ્રિય બનવું	૧૧૫





પોસ્ટમોર્ટમ-૧

oo

પુરોપ, અમેરિકા, કુવૈત જેવા ધન-સંપત્તિમાં આળોટતા દેશોથી માંડીને આફિકાના જંગલોમાં કારમી ગરીબીમાં જીવતી તમામ પ્રજાની ઉપર નજર નાખતા એક સામ્ય તરી આવે છે. એ સામ્ય એટલે “દરેક જીવ સ્વયં સુખી થવાનો પ્રયત્ન કરે છે.” પ્રાણીઓ પર કુર બનીને અત્યાચાર ગુજારીને મારી નાખતા કસાઈઓ પણ તેના દ્વારા પૈસા કમાઈને સુખી થવા જ પ્રયત્ન કરે છે તો જાનની પરવા કર્યા વિના ઘાતકી કસાઈ સાથે ઝગડીને પણ ટ્રકોમાં પૂરાયેલ પશુઓને બચાવતા ઝીંદાદિલ યુવા-આલમ પણ જીવદ્યાના પુણ્ય પ્રતાપે સુખી થવા જ ઈચ્છે છે. આમ, સુખી થવાના એક માત્ર લક્ષ હોવા છતાં વિપરીત દિશામાં ચાલતા પ્રયત્નો દેખીને વ્યક્તિત્વે સ્વયં વિચારવું જોઈએ કે મેં સુખી થવા જે માર્ગ પકડ્યો છે તે સાચો છે કે ખોટો ???

ઓલો, તમે સુખી થવા કયો માર્ગ પકડ્યો છે ? પૈસા કમાવવાનો ને ? ખૂબ જ
..... અગણિત અધધધ રૂપિયા જ સુખી કરશે એવી માન્યતા
તમારી જ નહીં સમગ્ર સૂચિની છે. ઓ ... કે ... ચાલો, આજે એ માન્યતાનું

તમે ખૂબ ધન કમાવવા યુવાનીના ૨૦-૨૫ વર્ષ (ઓછામાં ઓછા) ખૂબ મહેનત કરો છો. શું ત્યારે સુખી છો? હા, આ એ વખતની વાત છે જ્યારે તમે ઘરાક સાચવવા ભૂખ લાગવા છતાં પણ કામ કરે રાખો છો. કાળજાળ ગરમીમાં પણ ઉઘરાણી માટે ધક્કા ખાઓ છો કે સારી ડીગ્રીની આશાએ રાતોની રાત થોથા જેવા ચોપડામાં મોહુ ઘાલીને વાંચ્યા કરો છો. આ સમયે તો તમે સુખની આશામાં દુઃખ જ વેઠો છો.

હા, ચાલો એ સમય પૂરો થયો. (આમ તો આવો સમય (દુઃખ ભર્યો) મોટા ભાગનાને પૂરો જ નથી થતો છતાં પણ ... તમારા માટે પૂરો થયો તો ...) સુખી જ ને

??? હવે ધનના ઠગલા, મહેલ જેવો બંગલો, એ.સી.ગાડીઓ, આટલુ મળ્યું સુખી થઈ ગયા ?

જો તમે ‘હા’ કહેતા હો તો જવાબ આપો.

- (૧) ટેન્શનમાં ને ટેન્શનમાં હાટફિઝલ થવાના કિસ્સા જથ્થાબંધમાં કર્યાં બને ?
- (૨) ગુંડાઓ દ્વારા અપહરણના કુકૂત્યોનું હોલસેલ માર્કેટ કર્યાં છે ?
- (૩) ડાયાબિટીસ, B.P., એટેક, બ્રેઇનહેચ્રેજના ઈવેન્ટ્સ (બજાવો) કર્યા વિસ્તારમાં વધુ હોય છે ??? અરે ! આ બધા જ પ્રકારના કિસ્સાઓમાં કરોડપતિઓની જ મોનોપોલી હોય છે.

આવી વિપત્તિમાં પડ્યા પછી કો‘ક દિવસ વિચાર પણ આવે છે કે આના કરતા શાંતિથી જીવ્યા હોત તો સારુ હતું. પણ હવે વૈભવનું વસન થઈ ગયું હોય છે. બિચ્ચારા કરોડપતિઓ !!! વૈભવના ગુલામ થઈ ગયા હોય છે. એટલે છોડી શકતા નથી.

હમણાંની જ એક વાત છે.

૧૮ વર્ષના દિકરાએ તેના કરોડપતિ બાપ પાસે (બાઈક બગડેલું હોવાના કારણે) ગાડીની ચાવી માંગી. એના બાપે બચપણથી તેને ચાલતા જવાની ટેવ જ નહોતી પાડી. પણ આજે તેમને ગાડીની જરૂર હોવાને કારણે ના પાડી. દિકરાને બસ કે રીકામાં જવાની પણ શરમ આવતી હતી માટે ગાડીની જીદ પકડી. બાપ પણ પકડું આવી ગયો. આખરે ગુસ્સો-કકળાટ (હા ! ! ! આ બધુ કરોડપતિના ઘરમાંય થાય) આસમાને પહોંચ્યો. પોતાને ગાડી ન મળવાના દુઃખના દુંગરાથી બચવા તેણે આત્મહત્યા કરી.

‘આજે એક ના એક દિકરાને ગુમાવવા બદલ આખુ કુટુંબ દુઃખી દુઃખી થઈ ગયું છે’ બિચ્ચારો દિકરો !!! આટલા નાના દુઃખને પણ સહન ન કરી શક્યો. એક દિવસ શું ? જુંદગીભર પગે ચાલીને રખડનારા લાખો લોકો આ ભારતમાં મજેથી જીવે છે. એટલે ખૂબ પૈસા કમાવાની દો'ડમાં દોડવાના બદલે એકવાર જરા’ક શાંતિથી વિચારી લેજો ‘આવા પ્રસંગો આપણા ઘરના મહેમાન તો નહીં બને ને ?

આ વાત પૈસો કમાવવાનું છોડી દે'વા નથી. પરંતુ પૈસા પાછળની ગાડી-આંધળી દોડ અટકાવવા માટે છે. સુખ નામની પ્રોડક્ટનું મેન્યુફેલ્ચરીંગ પૈસા નામની ચીજ પર આધારિત નથી. પૈસો તો સુખના મેન્યુફેલ્ચરીંગનો એક નાનકડો પાર્ટ છે. પૈસા નામના પદાર્થ વિના પણ સુખ નામની પ્રોડક્ટ બની શકે છે. હા ! આ અધ્યાત્મના અનંત સુખની વાત નથી. તમારા જેવા દુઃખીઓ તો એની કલ્પના જ ન કરી શકે. આ તો માત્ર સંસારના સુખની જ વાત છે. હા ! એ પણ પૈસા વગર મળી શકે છે.

ના, આ એકસકલ્યૂઝીવ શો-રૂમની આકર્ષક જાહેરાત જેવી બનાવટી વાતો નથી. સાવ સાચી વાત છે.

તો પૈસાદાર થયા વિના સુખી કેવી રીતે થવાય ?

એ વાત ફરી મળીશું ત્યારે





પોસ્ટમોર્ટમ-૨

અમદાવાદમાં એક શ્રીમંત વિસ્તારમાં વિશાળ બંગલામાં એક ઉઘોગપતિ માંડા પડ્યા. તેમના ૨-૨ યુવાન દિકરાઓ ધંધામાં અને પુત્રવધુઓ કીટીપાર્ટીઓમાં વ્યસ્ત હતા. પૌત્ર પરિવાર પણ સ્કૂલ-ટ્યુશન-ફેન્ડસ્ અને પીકનિકમાં મસ્ત હતો. અને એક નોકર અને નર્સની હાજરીમાં પુત્રોને યાદ કરતા-કરતા તે શ્રેષ્ઠીવર્યનું મૃત્યુ થયું.

હાલના સમયમાં ટેક-ટેકાણે થતી દુર્ઘટનાઓનો આ એક સત્ય નમૂનો છે. બીજું બાજુ, અમારા જૈન સાધુ તરીકે કાયમ પગ-પાળા જ વિહાર કરવાના નિયમાનુસાર એક ગામડામાં અમે રોકાયેલ ત્યાં હર્ષદાયક દશ્ય જોવા મળેલ.

એક વિશાળ પણ સાંદ્રા મકાનમાં એક વૃદ્ધ પુરુષનો ખાટલો હતો. તે માંદા પડ્યા ત્યારથી તેમના દિકરાઓ વારાફરતી તેમની સેવામાં હાજર રહેતા. ઘરનો સ્ત્રીવર્ગ પણ તેમની દવા-આહાર આદિની કાળજીમાં જ હતો. નાના ભૂલકાઓ પણ જાત-ભાતની વાતો કરવા દ્વારા દાદાના મનને પ્રસન્ન કરવા યત્ન કરતા હતા. અને આ દુઃખભરી સ્થિતિમાં પણ પારિવારિક ગ્રેમના કારણે તે માંદા વડીલ મુરબ્બી પ્રસન્નતાનો અનુભવ કરતા હતા. પૈસાથી જ સુખ મળશે. એવી ભ્રમણામાં રાચનારા ઉપરની ઘટનાઓ ફરી એકવાર વાંચે. હવે આ વાતનું (ઘટનાઓનું) **પોસ્ટમોર્ટમ** કરીએ.

શ્રીમંત શ્રેષ્ઠિવર્યશ્રી પોતાની યુવાનીમાં ૧૦ વાગે ઓફિસ જતા ત્યારે બાળકો શાળાએ ગયા હોય. રાત્રે ૮:૦૦ વાગે આવે ત્યારે થાક્યા-પાક્યા વાત કરવાનો પણ હોંશ ન હોય. બાળકોને પૈસાનો છૂટો દોર આપીને એ પોતાની ફરજ બજ્યાનો સંતોષ અનુભવતા હતા. સામે છેડે પેલા ગામડાના મુરબ્બી રોજ શાળાએ ડિકરાઓને જતે લેવા-મુકવા જતા. સાંજે ખેતરથી પાછા ફરીને ખાટલે બેઠા-બેઠા વાર્તા-ભજન આદિના

માધ્યમે બાળકોમાં સંસ્કારની રંગોળી પૂરતા. આ સંસ્કારની રંગોળી પૂરવા સમય-ધનનો જ ખર્ચ કરવો પડે. સ્થૂળ દ્રવ્ય (પૈસા) થી ન થાય.

પરિણામ શું આવ્યું? તે આપણે જોઈ ગયા.

આના પરથી એટલું શીખો કે ઘડપણને સુખમય બનાવવા બાળકની પાછળ યુવાનીમાં ભોગ આપવો જોઈએ.

(હા !!! પૈસાનો મોહ છોડીને) જો બાળક ઉ વર્ષનો હશે ત્યારથી જ તમે તેની સાથે તેના મિત્રો, અત્યાસ, ઈચ્છા આદિ વિષે રોજ (હા !!! રોજ) ૦॥ કલાક પણ પ્રેમથી (બળજબરી થી નહીં ...) પ્રેમથી વાતો કરી હશે તો ૧૭ કે ૨૭ વર્ષનો યુવાન થશે. ત્યારે પણ તમારી સાથે વાત કરશે. ત્યારે તમને શાંતિ, સુખ મળશે. એ જ રીતે તમે તમારા મા બાપની સાથે પા-અડધો કલાક ફાળવો. તેમને કંઈક લાવી આપો. રાજી રાખો. દિકરો તમારું સાંભળતો નથી એ તમારી ફરિયાદ છે. પણ દિકરો તમને જુવે તો છે જ. એ તમને મા-બાપની સેવા કરતા જોશે તો શીખશે. જો તમને મા-બાપની સામુ બોલતા જોશે તો એવું શીખશે. હા, તમારા આ ભવના જ સુખની વાત છે. આવી ઘણી બાબતો છે.

તમે સવારે વહેલા ઊઠો ઘરના કામમાં થોડીક મદદ કરો. (કંઈક કચરા-પોતા કરવાની વાત નથી.) કંઈપણ જે તમને ગમે તેવું ગૃહકાર્ય શીખો. (હા ... શીખો) ઘરમાં થતા કકળાટ-જગડામાં ૫૦% થી વધુ કાપ આવી જશે. આનાથી રીપ્રેશનના ભોગ નહીં જ બનો. છતાં માનો કે તમે કયારેક રિપ્રેશનમાં ખૂબ ટેન્શનમાં આવી ગયાં તો શું કરશો? અરે યાર !!! એકા'દ મજાનું ભક્તિગીત (ભજન) ગાઈ લો. કેટલીય સુંદર ભગવાનના ભજનોની C.D. ઓ મળે છે. એમાંથી સાંભળીને એક-બે ગીતો શીખી લો. અને કયાંક મંદિરમાં કે બીજે એકાંત સ્થળમાં એકલા જઈને જાતે ગાઈ જાઓ. શાંતિથી ગાજો. લીટીઓ ફરી-ફરી ધૂંટજો. તમારા પરમાત્માને નજર સામે લાવીને ગાજો. આ ભજન આત્માની શુદ્ધિ માટે અને પરલોકને સુધારવા માટે પણ સક્ષમ છે. છતાં તમે માનતા છો તો તમે જાણો. આ ભજન ગાવાથી તમારા દિલમાં આનંદ તો થશે ને ??? મનના ટેન્શનમાંથી મુક્તિ થાય છે ને ??? તમે એના ખાતર તો ભજન ગાઓ. તમને

આશ્વર્ય થશે પણ રોજ ૧૦ મિનિટ પણ જો આ ભજન-ભક્તિ કરશો તો હાઈએટેક જેવી બીમારી આવતી જ નથી. અર્થતુ બાયપાસનો રૂ. ૨ લાખથી વધુ ખર્ચ અને શારીરીક વેદના છોડવવાની કોઈ ચીજમાં શક્તિ હોય તો તે માત્ર ભજન ભક્તિમાં જ છે. તમે રસ્તામાં કોઈપણ ચીજ મળે તો જથ્થાબંધ ખરીદો છો. આ કાયમ માટે સુખી રાખે તેવી સલાહ ખાલી આંખ ઢારા જ શા માટે વાંચો છો ! તમારું જીવન પરિવર્તન કરો. આ દવાઓ (સલાહો) તમારા દુઃખ નામના રોગને નાચ કરનારી છે. શું તમે દુઃખમાંથી છૂટવા નથી ઈચ્છતા ! તો પછી કરોને કાંઈ ? !! આ બાબતો વાગોળજો. જીવનમાં ઉતારજો. ૨૪ માં જૈન તિર્થીકર શ્રમણ ભગવાન મહાવીરે સુખી રહેવા માટે (પ્રાથમિક કક્ષાના જીવો માટે) નાના-નાના પણ ખૂબ જરૂરી ઉપ ગુણો બતાવ્યા છે. જીવનને ખુશીઓથી હરિયાળું બનાવવા માટે આ ઉપ ગુણો ખૂબ જરૂરી છે.



Make me free of
Stress to avoid
Heart Attack





ન્યાય સમ્પત્તિ વૈભવ

oooooooooooooooooooooooooooooooooooo

જ્યારે ગ્રાહક માલ લેવા જાય છે ત્યારે ઓછા પૈસામાં વધુ અને સારો માલ મળે ? તેવી દાનત ધરાવતો હોય છે. જ્યારે માલ વેચનાર ગ્રાહક પાસેથી વધુ નફો કેમ મળે ? તેવી જ વિચારધારામાં રમતો હોય છે. પરિણામે પ્રગટે છે છેતરપિંડી, હલકી ગુણવત્તાનો માલ, ઠગાઈ જેવા અમાનુષી દુર્ગુણો. આના બદલે ગ્રાહક વિચારે કે સામેવાળી વક્તિ પણ ઘર લઈને બેઠી છે. તેને કમાવાનું હોય ને ??? જ્યારે વેપારી વિચારે કે ગ્રાહકને નાનકડી આવકમાંથી આખા ઘરનું ગુજરાન ચલાવવાનું હોય છે તો આપણે યોગ્ય જ રકમ લેવી જોઈએ. તો એક પોઝીટીવ ઉજ્જ પેદા થશે. જે સમગ્ર વિશ્વને શુદ્ધ વિચારોનો જથ્થો પૂરો પાડશે. અને આવા જ કો'ક ઉદેશથી શ્રમણ ભગવાન મહાવીરે ગૃહસ્થ જીવનમાં સુખી થવાના ઉપ ગુણો પૈકી પ્રથમ ગુણ બતાવ્યો. ન્યાય સમ્પત્તિ વૈભવ. તમે ઘર સંસાર લઈને બેઠા છો. તમારે પણ પૈસા જોઈએ. ગુજરાન ચલાવવા જ નહી પરંતુ દુનિયામાં સ્થાન ટકાવવા માટે શ્રીમંતાઈ પણ જોઈએ. ભગવાન મહાવીરે પ્રારંભિક કક્ષાના જીવને આ બધુ એક સાથે છોડાવવાનો ઉપદેશ નથી આપ્યો. માત્ર એટલું કહ્યુ 'તું નીતિથી વૈભવને ઉપાઈ' અર્થાત્ કોઈના પેટને પાઢુ મારીને, કોઈને દુઃખી કરીને, કોઈને ઠગીને, કોઈને ચગદીને પૈસો કમાવાનું બંધ કર. આ વાત જરા વિસ્તારથી સમજીએ. તમારે ત્યાં કોઈ ગરીબ આવ્યો. તમે તેના દેદાર પરથી જ સમજ ગયા તે નાજુક પરિસ્થિતિમાં જીવે છે. તો તેની પાસેથી તગડો નફો ન જ લેવો. કોઈ શ્રીમંત પાસેથી પણ દુનિયામાં જેને અયોગ્ય કહેવાય તે હદે નફો ન જ રળવો. એવી જ રીતે નોકર-ચાકરની રજાનો યોગ્ય કારણ હોય તો પગાર ન કાપવો, તેમ તેનું ગુજરાન ચાલે તેટલો તો પગાર આપવો જ. ઘરમાં પત્ની-પુત્રો વિગેરે તમે ખૂબ મોડા ઘરે જાઓ અને તેમની સાથે પા-અડધો કલાક બેસી પણ ન શકો, જેમણે જનમ આપ્યો, મોટા કર્યા તે મા-બાપ સાથે વાત પણ ન કરી શકો તેથી તેઓ દુઃખી થાય. આવું જો બનતું હોય તો


એ હદે પૈસાનો લોભ ન કરવો. ચોક્કસ, આવી કાળી મજૂરી કર્યા વિના પેટ ભરવા પૂરતું પણ ન મળતું હોય તો બધુ જ ભૂલીને પૈસા પાછળ દોડો. પણ પેટ માટે રોટલો મળી રહે છે તો પટારો ભરવા માટે તો ગાંડાની જેમ ન જ દોડો. (..... અને પુષ્ય હશે એટલું જ મળશે ...)


એટલે પુષ્ય વધારવા થોડા સારા કામો પણ કરો. ભગવાનનું નામ પણ જપો. દુધમાં સાકર હોય એટલું જ ગળ્યું થાય. જીવનમાં પુષ્ય હોય એટલી જ સફળતા મળે. ચોક્કસ, ચમચી હલાવવાની મહેનત કરવી પડે. પણ તે મહેનતની મર્યાદા હોય ૨૦ મિનિટ સુધી દુધ હલાયા ન કરાય તેમ ૧૨-૧૪ કલાક ગધ્યા-મજૂરી ન કરાય. પટારા ભરવા ગાંડાની જેમ પૈસા પાછળ દોડવું એ ન્યાય સમ્પર્ણ વૈભવ ગુણનો નાશ કરે છે. આ ગુણ માત્ર સદાચારી બનવા કે પાપ ન થાય માટે વિકસાવવાનો નથી. આ ગુણ તમારા ધંધા-રોજગારને પણ વધુ ધીકતો બનાવશે. જ્યારે કોઈ ગરીબ પાસેથી મામૂલી નફો લઈને માલ તેને આપો છો તો તે તમારો કાયમી ગ્રાહક બની રહેશે. તેના તરફથી સામાન્ય નફો તમે કાયમ રળતા જ રહેશો. એ ગરીબ પોતાની આજુબાજુ વાળાને પણ તમારા કાયમી ગ્રાહક બનાવશે. તેથી તમારો ધંધો જામે જ ને ???

યાદ રાખો, આજના કાળમાં નીતિથી કમાવા જઈએ તો કમાઈ જ ન શકાય આવી વાતો દુનિયાભરમાં ચાલે છે. જે સરિયામ જૂઠ છે. તમે કાંટા વાવો તો કાંટા જ મળે આંબો વાવો તો કેરી મળે. આ ભવમાં કે પરભવમાં તેવું જ ફળ મળશે. તમે છેતરપણી કરો છો તેની સામે અન્ય વ્યક્તિ તમને છેતરે છે. આમાં બીજો તમને છેતરે છે તેનું નુકશાન ધંધામાં પડે છે. જો સાવધ રહીને, ચોકસાઈ રાખીને કોઈની લોભામડી ઓફરમાં ધનની લાલચમાં લલચાઈ ના જાઓ તો તમે હાલ કમાઓ છો. તેથી વધુ પૈસા મળી શકે, નીતિમત્તાથી, હલકો માલ આપીને વધુ પૈસા કમાવાની ખેવના ન કરો તો ગ્રાહક પણ તમને સારી નજરે જોશે. તમારે ત્યાંથી જ કાયમ માલ ખરીદશો. જો નોકર વર્ગને યોગ્ય પગાર આપશો તો તેને બીજે રસ્તેથી પૈસા કમાવાના વિચારો અટકશો. અને તમારી નોકરી પર વધુ ધ્યાન આપશે. તેની સાથે સારો વ્યવહાર પણ રાખો તો તે તમારી દુકાનને પોતાની માનશે. અને જો તમે સત્કાર્યમાં ૫૦૦૦ રૂ. વાપરી શકો છો તો તો નોકરને દર મહિને એક કિલો મીઠાઈ કેમ ન આપી શકો? પૈસાની લ્હાયમાં ઘરને ભૂલો

નહીં. આખરે તમે પૈસો કમાઓ છો તે ઘર-પરિવારને સુખી કરવા માટે જ. અને કરોડો રૂપિયા થયા પણ તમારો પરિવાર તમારાથી નારાજ હશે. તો તમે ક્યાંથી સુખ પામશો?

આમ ન્યાયપૂર્વક જ વૈભવને ઉપાર્જન કરો. એ આ લોક અને પરલોક બધુ જ સુધારશે. જેમ પૈસો નીતિથી કમાવવો જોઈએ તેમ પ્રતિજ્ઞા-યશ પણ નીતિનો જ મેળવવો. જે કાંઈ સમાજનું-ઘરનું-દેશનું કાર્ય આપશે નથી કર્યું. અન્યએ કર્યું છે તેનો જશ ખાટવાની ખેવના ન રાખવી જોઈએ. યાદ રહે, આ બધુ તમને આ ભવમાં જ સુખી કરશે. પરભવ પણ સુધારશે. આ ન્યાય સમૃદ્ધ વૈભવ નામના ગુણને આત્મસાત્ત્વ કરી સુખી થાઓ.





શિષ્ટાચારની પ્રશંસા

આપણે સવારથી ઉઠીને આપણા સ્વયંના જીવનમાં જ એવા ખોવાઈ જઈએ છીએ કે આપણી આસપાસ બીજા જીવે છે તેવી આપણને જાગૃતિપૂર્વકની યાદ પણ નથી હોતી. બોલો, તમારી શાળામાં કચરો વાળનારનું નામ શું હતું? રોજ સવારે છાપુ આપવા આવનારનું નામ શું છે? રોજ સાંજે સમયસર આપણા શહેરની જહેર માર્ગો પરની લાઈટો ચાલુ કોણ કરે છે? આ બધા જ પૈસા લઈને જ કામ કરે છે. છતાં એમના વિના આપણું જીવન અટવાઈ જવાની પૂરી શક્યતા છે. અર્થાતું તે લોકો પૈસા લઈને પણ કામ કરે છે. એમાં આપણા પર ઉપકાર કરે છે. (આજના કાળમાં પૈસા લઈને કે વોટ લઈને કામ કરનારા ‘ય (સમજો !!!) ઘટતા જાય છે) આ બધાના કાર્યની આપણે કદર કયારેય કરી? શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવા માટે જરૂરી બીજો ગુણ બતાવ્યો છે. શિષ્ટાચારની પ્રશંસા. કોઈના સારા કામની પ્રશંસા કરો. (ભલે તમે આખા દા’ડામાં એકે સારુ કામ ન કરતા હો તો ‘ય) કોઈના કામની કદર કરવી એ માનવતા છે. કોઈએ તમને મદદ કરી તો શુદ્ધ ગુજરાતીમાં બોલો “તમારો આભાર !!!” કોઈએ સંસ્થાને દાન આપ્યું તરત કહો “ધન્યવાદ !!!” કોઈ નાના માણસે ખાલી કોઈ અંધને રસ્તો પાર કરાવ્યો તો ‘ય કહો “ખૂબ સરસ !!!” આમાં તમારે ખીસામાંથી પાંચ રૂપિયા ‘ય કાઢવાના નથી. ભૂખ્યા રહેવાનું નથી. તડકે તપવાનું નથી તો પછી ખાલી મોઢામાંથી બે સારા શાખ્યો ઉચ્ચારવામાં કંજૂસાઈ શું કામ કરો છો !!! તમે જરા સમજો કે આજે સત્કાર્યની કે સામાન્ય સજજનતાની ઉણાપ શા માટે વર્તાય છે? આજે માનવતાના કાર્યો જરૂર થાય છે. પણ માણસાઈના કાર્યો કરનાર પોતાની દુકાનમાં બેસે ત્યારે આખો બદલાઈ જાય છે. ગરીબોને ધાબળાઓ ઓફાડવા ૫૦,૦૦૦ રૂ. ખર્ચનારો વ્યક્તિ એ જ ગરીબ દુકાને આવે તો સાવ વ્યવહાર બદલી કાઢે છે. યાદ રાખો! ધાબળો ઓફાડવો એ તમારી ઉદારતા છે. ગરીબને ચુસવો નહીં એ તો માનવતા છે. આપણી

ઉદારતાની પ્રશંસા થાય છે. પણ સજજનતાની પ્રશંસા નથી થતી. બસ, આ જ સજજનતાની દુકાળ વર્તાવાનું કારણ છે. તમે કોઈ વ્યક્તિની સજજનતાની પ્રશંસા કરો એ ફરીથી સજજનતા દાખવશે. દાન આપનારાની પ્રશંસા કરો તો ફરી દાન નથી આપતા ? બસ, એવું જ છે. આપણે હવે આ શિષ્ટાચારોની પ્રશંસા પુનર્જિવિત કરવાની છે.

(૧) તમે આપો તેવું તમને મળે તેમ કો'કની પ્રશંસા કરશો તો કો'ક તમારી પ્રશંસા કરશે. (૨) તમે કોઈનું ખરાબ બોલશો તો કોઈ તમારું બૂરુજ બોલશો.

હવે જરા, એ સમજુએ કે શિષ્ટાચાર કોને કહેવાય ! એની સાવ સાદી વ્યાખ્યા એ છે કે દરેક વ્યક્તિ પોતાની કક્ષા અનુસાર જે લોકથી અવિરુદ્ધ કાર્યો કરે છે. તે તેનો શિષ્ટાચાર છે. દા.ત. નોકર પાસે કોઈ'ક સામાન ઉપાડવીને જાય છે. શેઠને એમ ને એમ ચાલતા જોઈને આપણને એમ થાય કે શેઠ જાતે ઉપાડતા હોય તો ? પણ જાતે માલ ઉપાડવો તે વાસ્તવિકતામાં શિષ્ટાચાર નથી. રેલ્વેસ્ટેશન પર દરેક જણ જાતે જ સામાન હેર-ફેર કરશે તો ભારતના સેંકડો રેલ્વે-સ્ટેશન પરના લાખોની સંખ્યામાં કૂલી પ્રજા (ભાર વાહકો) બેકાર થશે. ઘરમાં નોકર ન રાખીએ તો કેટલા નબળા લોકોની રોજગારી જતી રહે. (મતલબ શ્રીમંત વ્યક્તિ શ્રીમંત તરીકે છુંદગી જીવે એટલે તેને ગરીબો માટે પડી જ નથી એમ ન કહેવાય. શ્રીમંત તરીકે છુંદગી જીવવાથી ગરીબોને પણ આર્થિક લાભ થાય છે. હા, તે આર્થિક નબળાઓ માટે મનમાં દ્વેષ ન હોવો જોઈએ અને તેમની લાચારીનો લાભ લઈને ચૂસવા ન જોઈએ.) આપણને તેટલા રૂપિયા ખરચવા ભારે પણ નહીં પડે. અને તેટલા સમયમાં આપણે અન્ય ઘણું કામ કરી શકવાના છીએ. વળી, કામ કરાવવું એ શિષ્ટાચાર નથી કામ કરાવી (વધુ પણ નહીં, અને ઓછું પણ નહીં) એવું યોગ્ય વળતર આપવું એ શિષ્ટાચાર પાલન છે. આવા શિષ્ટાચારની પણ પ્રશંસા કરવી. કોઈ વ્યક્તિ મજૂરને યોગ્ય મજૂરી આપે તે તેનો શિષ્ટાચાર છે. સામે પક્ષે કોઈ રીક્ષાવાળો આપણને સમયસર યોગ્ય સ્થળે પહોંચાડે છે. તે તેનો પણ શિષ્ટાચાર છે. તેને પણ કહી શકાય દોસ્ત !!! ધન્યવાદ ! તેં સારી રીક્ષા ચલાવી અમને સમયસર ઠેકાડો પહોંચાડ્યા. તે રાજ થશે. બીજા મુસાફરને પણ સારી રીતે ઠેકાડો પહોંચાડશે. કોઈ ખેડુત મિત્ર તમને બસમાં કે અન્ય સ્થાને મળે તો તેને કહો 'દોસ્ત ! ધન્યવાદ છે તમને કારણ કે આ દેશમાં

અનાજ પકાવવાનું ખૂબ જ અનિવાર્ય કાર્ય તમે કરો છો. અને કેટલું સારુ લાગશે. ફરીવાર, યાદ કરાવું આ તમામ ચુણો તમારો પરલોક સુધારવા તો જરૂરી છે જ. આ લોકમાં સુખી બનવા પણ જરૂરી છે. તમે કોઈની પ્રશંસા કરો છો. મતલબ તેના શિષ્ટાચારની પ્રશંસા કરો છો. તો તે વ્યક્તિને તમારા માટે માન જાગશે જ અને તમારા માટે તેને માન જાગશે તો ક્યારેક ને ક્યારેક કોઈ પણ રીતે મદદરૂપ થશે. કેટલાક માણસો મોટા લોકોના જ શિષ્ટાચારની (આમ તો, સારા-નરસા દરેક આચારોની !!!) પ્રશંસા કરે છે, પણ યાદ રાખો, નાના માણસો જ આપણને જીવનમાં વધુ કામ લાગે છે. સિંહ આખા જંગલમાં રખે છે. શિકાર કરીને ગુજરાન ચલાવે છે. પણ જ્યારે શિકારી આવીને જાળ પાથરે છે, અને સિંહ તેમા ફસાય છે, ત્યારે ઉંડરડા જ જાળ કાપીને સિંહનો જીવ બચાવવાનું મહાન કાર્ય કરી શકે છે. ત્યારે મોટા પણ તો દૂર જ રહે છે. તેમ રાત્રિના સમયે તમારે હોસ્પિટલ જવાની પરિસ્થિતિ ઉભી થઈ તો પાડોશી જ પહેલો કામ લાગે. તો તેની સાથે મીઠા પ્રેમભર્યા સંબંધો રાખવામાં કચાશ શા માટે ? આ શિષ્ટાચારની પ્રશંસા માત્ર મોઢેથી સારુ બોલીને અટકવા પૂરતી મર્યાદિત ન રાખતા સહાયક પણાની વૃત્તિ પણ દાખવવી જોઈએ. કેટલાકની માન્યતા જ એવી હોય છે. એ અમને સહાય કરે તો અમે તેમને મદદ કરીએ. એ ગાંડાલાલોને કહીએ, શરૂઆત તમે કરશો તેમાં શું નાના થઈ જવાના ? ખાલી ખોટુ આખા ભારતના વડાપ્રધાન જેટલો વટ મારતા ફરવું નહીં. કોઈને કામમાં ન આવે એવી વસ્તુ દુનિયા ફેંકી દે છે એ યાદ રાખવું અને બધાની સાથે હળી-મળીને રહેવું. દરેકને આપણે મદદ કરવી. ઘસાઈ છૂટનારાના હાથ ઘસાય છે અને ક્યારેક તેમાથી ‘ધનરેખા’ અંદર સંતાઈ ગઈ હોય તો બહાર ઉપસી આવે છે. મતલબ, લોકોને નિઃખ્યાંથ્રભાવે મદદ કરવાથી પુણ્ય વધે છે અને પુણ્ય વધવાથી જીવનના તમામ કેતે સફળતા મળે છે. માટે શિષ્ટાચાર પ્રશંસા કરવાપૂર્વક તમારા જીવનને સુખી બનાવો એ જ .





કુલ-શીલથી સમાન એવા
ત્રિજ્ઞ ગોત્રીય સાથે વિવાહ



oo

એક કીડીઓ જ્ઞાતિ બહાર લગ્ન કર્યા મણ્ણર સાથે. અને ફરવા માટે દાર્જિલીંગ ગઈ. (ગુજરાતીઓને ફરવા માટે સિમલા-ગોવા-દાર્જિલીંગ-કાશ્મીર સિવાયની જગ્યા ખબર જ કયાં છે !!!) બીજા દિવસે છાપામાં ‘બેસણું’ જાહેરાત આવી ‘મણ્ણર ભાઈનું બેસણું’ કીડીઓ પેલી કીડીને પૂછે “કેમ કરતા મરી ગયા ???” કીડી રડતાં-રડતાં કહે : શું કહું આખો દિવસ ફર્યા, ખાંસું, પીંધું, મજા કરી રાત્રે રૂમ પર લાઈટ બંધ કરતા લૂલથી ઓલ આઉટ ની સ્વીચ મેં દબાવી દીધી !!! આ વાત હસવા જેવી જરૂર છે પણ હસી કાઢવા જેવી જરા'ય નથી. ભગવાન મહાવીરે સુખી થવા માટે જરૂરી ત્રીજો ગુણ કહ્યો છે.

કુલ-શીલથી સમાન એવા બિન ગોત્રીય સાથે વિવાહ. યુવાન છો. ગૃહસ્થ છો. તો જુંદગીમાં જીવનસાથી માટેનો વિચાર કરવાના જ છો. પણ તે વિચાર યોગ્ય રીતે થાય તો ધર્મ સ્વરૂપ બને છે. લગ્ન એ ધર્મ જ છે. હા !!! લગ્ન એક ધર્મ જ છે. પણ તેને જૂદ્દી રીતે મૂલવીએ તો. આજે આપણે એક નારી સાથે મનમાની રીતે વ્યવહાર કરવાની કાયદેસર છૂટ તેને લગ્ન કહીએ છીએ. પણ હકીકતમાં એક નારી સિવાય જગતની સર્વ સ્ત્રીઓ પ્રત્યે મા-બહેનની પવિત્ર નજર રાખીશ એવી પ્રતિજ્ઞાનું નામ છે લગ્ન. આવી વિચારધારા એ લગ્ન ને પણ ધર્મ સ્વરૂપ બનાવે છે. આ વિવાહના સમયે યોગ્ય પસંદગી કરવી જરૂરી છે. અને તે પસંદગી માટેનું અમૂલ્ય માર્ગદર્શન ધર્મગ્રંથો આપે છે. ધર્મગ્રંથો એ આપણા સંસારને પણ સુખમય બનાવવાની કળા શીખવે છે. (પણ !! તમે વાંચો તો ને ????) લગ્ન વખતે પાત્રની પસંદગી કુળ અને શીલ સમાન હોય તેમાંથી કરવી. અહીં, સમાન કહું છે અર્થાત્ આપણા કુળ અને શીલની સમાન

પિતાના પક્ષે જે મળ્યુ તે કુળ છે એ કુળની જ નારીની પસંદગી એ સુખી કરનારી બને છે અને શીલ એટલે સંયમ આપણી મર્યાદાઓ મુજબની જ મર્યાદા (આપણી મર્યાદાથી વધુ પણ નહી ઓછી'ય નહી) જ્યાં પળાતી હોય તેવા પરિવારની કંચા સાથે જ વિવાહ કરવો.

(This is not a **RELIGION RULE** friends ! This is an idea of the **HAPPY LIFE.**)

આ સુખી જીવન માટે જરૂરી ઉપાયો છે. માત્ર ધર્મના નિયમો નથી. સમાન કુળવાળી નારી હશે તો તમારા અને તેના વિચારોમાં પણ સાચ્ય રહેશે. પૂર્વકાળમાં છૂટાછેડાના કિસ્સા અત્યારની સરખામણીમાં ૧૦% પણ ન હતા. તેમાં મહાત્વનું કારણ આ હતું. જ્યારે તમે દોસ્તી કરો છો ત્યારે પણ સરખે-સરખાની કરો છો ! મતલબ જ્ઞાન-પૈસા-શોખ સરખા ના હોય તો દોસ્તી પણ ટકી શકતી નથી. તો જેના વિચારોમાં મેળ ન જામે તેવા જીવનસાથી સાથે કેવી રીતે રહેવાય ? અને વિચારો મગજમાંથી પેદા થાય છે. મગજની રચના માનવીય શક્તિથી નહી પણ કર્મની અર્થર્ત તમારા પુષ્ય-પાપના પ્રમાણે થયેલી હોય છે. સમાન કુળવાળાના અમૂક પ્રકારના પુષ્ય સરખા હોય છે. અગર તમે એમ કહો કે મનુષ્ય માત્રને સરખા જ મગજ હોય છે. તો સરિયામ જૂઠ બોલો છો. અગર તમામ જીવોમાં અમુકને મનુષ્ય લોકમાં અમુકને પણ જગતમાં જન્મ મળે છે. ત્યારે તમે એમ નથી કહી શકતા કે તમામ જીવો સરખા જ મગજના હોય છે. (નહીતર તો હાથી કે વાંદરો પણ ડેક્ટરની લાઈન લઈને ભણી શકે !!!) તો માનવમાં તમામને સરખુ મગજ કેવી રીતે માની શકાય ? અને માટે જ જેમ આપણને એક પરિવાર મળ્યો છે. તેમ એક કુળ પણ મળ્યુ જ છે. અને એ કુળમાં જન્મેલી વ્યક્તિઓ એક-બીજાની ભાવના-લાગણીઓ જલ્દી સમજ શકે છે. આજે લાંબાગાળે નહી નાનકડા સમયના લગ્નજીવનમાં પણ અકલ્ય ભંગાણ પડે છે. ત્યારે તે યુવા-યુવતિ, તેનું ભાવિ (બાળક), તેનો પરિવાર અત્યંત ગમગીની-દુઃખ-ગ્રાસ-ટેન્શનનો અનુભવ કરે છે. આ પીડા આખી જિંદગીના સુખની શિલાને કકડભૂસ કરે છે માટે એનાથી બચવા માટે કુળથી સરખી વ્યક્તિ સાથે જ લગ્ન કરવા હિતાવહ છે. એમ શીલ અર્થર્ત મર્યાદાથી (મતલબ, મર્યાદા જેવું જિંદગીમાં રાખવાનું ... બેફામ નહી જીવવાનું ...) પણ સમાન વ્યક્તિ સાથે લગ્ન

કરવા. આવી કુળ-શીલની સમાન વ્યક્તિનું પણ જો ગોત્ર એક હોય તો લગ્ન ન કરાય. (તમારું ગોત્ર કયું ??? તમારા વડીલને પૂછી જોજો !!!) કારણ કે એક જ પરિવારની પ્રજાનું ગોત્ર એક હોય છે. અને એક પરિવારના હોવું એટલે ભાઈ-બહેન સ્વરૂપે હોવું. ભાઈ-બહેનના પવિત્ર સંબંધો તે રૂપે રહે તો જ દીપે. તે બાબતે ઘણું ઊંડાણભર્યું રહેસ્ય જાણવા જેવું છે. પણ સામાન્ય બુદ્ધિથી સમજવું શક્ય નથી. એક ગોત્રમાં થતા વિવાહ પુત્ર પરિવારનું સુખ આપી શકવાની શક્યતા ધરાવતા નથી. માટે આપણા પૂર્વ પુરુષોની આજ્ઞા-સલાહને અનુસારે ચાલવું ખૂબ હિતાવહ છે. જે લોકો એમ કહે છે કે જ્ઞાતિ બહાર લગ્ન કરીને સુખી થનારા દાખલા સમાજમાં મળે છે જ. તો અમે તે વાતમાં સંમત છીએ પણ જ્ઞાતિ બહાર લગ્ન કરીને પસ્તાતા (આમ તો, ગમે ત્યાં લગ્ન કરીને આખી દુનિયા પસ્તાય જ છે. દા.ત. તમે) યુગલોની વિશાળ સંખ્યાની સામે જ્ઞાતિ બહારના સર્જણ દાંપત્યની સંખ્યા ઘણા ઓછા પ્રમાણમાં હોય છે. વળી આજે સમાજ-દેશ-વિશ્વના ઉધ્યારના કાર્યો કરવા માટે ઘણા સંગઠનો કાર્યરત છે. પણ પૂર્વ કાલિન જ્ઞાતિ-સમાજો પોતાના સમાજના નબળા વર્ગને જેટલો સાચવતો તેટલું ભાગ્યે કોઈ સંસ્થાને સાચવી શક્યા હશે. કારણ કે માણસની વાસ્તવિક પરિસ્થિતિ કેટલી કફોડી છે. એ બાબતે તમે જ્યાં સુધી યોગ્ય અંદાજ ન લગાવી શકો. ત્યાં સુધી યોગ્ય સહાય ન કરી શકો અને બેફામ રીતે સેવાના કાર્યો કરવાથી ગરીબોની સંખ્યા ઘટી ના શકે. આજે મોટા પાયે ગરીબ કલ્યાણ મેળા ભરાય છે પણ ગરીબી ઘટે છે ??? સમાજની વ્યક્તિ પોતાના સમાજનાની પરિસ્થિતિ વાસ્તવિક રીતે સમજ શકે અને તેને જરૂરિયાત કઈ છે. તેને વિષે ધ્યાન રાખી તે મદદ કરી શકે. આ પરંપરા જો ટકાવવી હોય તો પૂર્વકાલીન કુળ-શીલથી સમાનની સાથે જ વિવાહનો કમ જાળવી રાખવો જ રહ્યો. આમાં તમારું, સામેવાળાનું બધાનું હિત છે. તમે સમાજ બહાર લગ્ન કરશો. મતલબ સામેવાળા પાત્રએ પણ સમાજ બહાર લગ્ન કર્યા. આમ, તમે એક વિશાળ પરિવારમાંથી છૂટા પડી ગયા. આવી સમજશ વૃધ્ઘત્વમાં કોઈ સહારો ના રહે ત્યારે જ પ્રગટે છે. જ્યારે બહુ મોહુ થઈ ગયું હોય છે. વૃધ્ઘોના સંગઠન તમને મદદ કરી શકે પણ પોતાના પણ દાખવી ના શકે. એટલે આવી દુઃખિયારી પરિસ્થિતિનો ભોગ ન બનવા માટે સમાજ બહાર વિવાહની પ્રથાને દેશવટો આપવો જ રહ્યો. આ ગુણની પ્રાપ્તિ કરી સહુ સુખી બનો.



પાપ ભીરતા

oo

પરમાત્મા શ્રી મહાવીર સ્વામીએ સુખી થવા માટે જરૂરી ચોથો

ગુજરાતી જીણાવ્યો છે “પાપ ભીરુતા”. આજના જમાનામાં આમ તો વ્યક્તિ પોતે કોઈનાથી”એ ના ડરતો હોય તેવી બડાઈ હંકતો જોવા મળે છે અને સરકારીખાતા વાળા પાછળ પડે ત્યારે હિંમતથી લડવાને બદલે પાછલા રસ્તે પૈસા આપીને વાત પૂરી કરી નાખે છે. અરે ! વગર મફતના ફૂતરા પાછળ પડે તો જાતે જ પ્રતિકાર કરવાની હિંમત દાખવનારા’ય ઘટે છે અને ફૂતરો હડકાયો છે એમ કહીને સરકારના માણસો બોલાવી દે છે. વાત તો ત્યાં સુધી વાણસી છે કે ઘરમાં ગરોળી કે ઉંદરડી નીકળે તો’ય સાપ નીકળ્યા જેટલી કે વાધ આવ્યા જેટલી બૂમરાડ મચાવે છે પહેલાના કાળમાં લોકો બેતરમાં પડ્યા રહેતા ત્યારે જંગલી જાનવરો આવે તો’ય એકલા પહોંચી વળતા. આવી શૂરવીરતા સમૃદ્ધ પ્રજા પણ સુખી અને શાંતિ પામેલી જ હતી. કારણ ? શૂરવીર, નિર્ઝર, નિર્ભય, કદાવર, તાકાત ધરાવનારી પણ એ પ્રજા ‘પાપ ભીરુતા’ નામનો ગુજરાતી ધરાવતી હતી. આ ગુજરાત આપણા આ ભવને, પરભવને સુધારનાર જ છે સાથે ... સાથે સમાજમાંના ભાષાચાર, દુષ્ટાચાર, ગુંડાગિરિ જેવા દુષ્ટત્વોનો નાશ કરનારો છે. જો આપણામાં પાપભીરુતા હશે. તો કોઈ ખોટુ કામ કરતા અટકશું. આપણને પાપ કરતી વખતે વિચાર આવશે કે આવું ન કરાય. આ અયોગ્ય છે. પાપ કરવાથી દુઃખ પ્રાપ્ત થાય છે. આ સત્ય વાત પર શ્રદ્ધા બેસી જાય અને એ વાત સતત સ્મરણમાં રહે તો પાપ કરવાનું મન જ ન થાય. પાપ-પુણ્ય તત્વ પરની શ્રદ્ધા એ અંધશ્રદ્ધા નથી. એક સનાતન પદાર્થ પરનો વિશ્વાસ છે. આજની આધુનિક પ્રજા તે તત્વને સમજવાની તૈયારી જ નથી દાખવતી એટલા માત્રથી તે હંબક નથી બનતું. આજના આધુનિક વિજ્ઞાન-વિજ્ઞાનીઓ પાસે સાધનો અને સંપત્તિની વિપુલતા જરૂર છે પણ પૂર્વકાલીન ઋષિ-મુનિઓ અને તેની પૂર્વે જન્મ પામેલ પરમાત્મા જેટલું જ નહીં તેના કરતા ૧૦૦૦૦૦૦૦ (એક કરોડ !) માં ભાગનું’ય જ્ઞાન નથી. વિશ્વર્દ્ધનની શક્તિ નથી, ભૌતિકતાથી ઉપરની ચીજને સમજવા

બુદ્ધિની કુટપણી બહુ નાની પડે. કુટપણીથી દરિયો માપવાની મૂખ્યાઈ ન કરાય. તેમ પરમાત્મકથિત વાતો જે આધ્યાત્મિક છે તેને બુદ્ધિની સપાઠીથી સમજવાની મૂખ્યાઈ પણ ન કરવી જોઈએ. પાપ-પુણ્ય તત્ત્વ એક શ્રદ્ધાગમ્ય, અનુભવ ગમ્ય ચીજ છે. સાથે ... સાથે ... તર્કથી સિદ્ધ પણ થાય જ છે.

અમદાવાદની શુલબાઈ ટેકરા પાસેની ઝૂપડપણીમાં એક બાળકનો જન્મ થયો. એ જ દિવસે એ જ સમયે મુંબઈમાં એક શ્રીમંતના ત્યાં પુત્ર જન્મ થયો. બસેની જન્મ કુંડળીના ગ્રહો લગભગ સરખા જ હશે. એક જ દિવસે જન્મેલા બસે બાળકો આજે તો મોટા થઈ ગયા. એક બાળક જન્મથી વૈભવમાં આળોટે છે. અને બીજો બાળક જન્મથી કારમી ગરીબીની થાપટો ખાધા કરે છે. આ બસે બાળકનો જન્મ ગરીબ અને શ્રીમંત ઘરમાં શા માટે થયો? આ એક પ્રશ્ન આપણાને જન્મની પૂર્વની દુનિયા તરફ દોરી જાય છે. જન્મ પૂર્વની દુનિયામાં અર્થાત્ પૂર્વજન્મમાં કરેલ દુષ્કર્મોના ફળ રૂપે જે ‘પાપ’ નામનું અતીન્દ્રિય તત્ત્વ આત્માને લાગેલ તેના ફળરૂપે ગરીબ ઘરમાં જન્મ થાય છે. અને પૂર્વભવમાં કરેલ સત્કાર્યના ફળરૂપે જે ‘પુણ્ય’ નામનું અતીન્દ્રિય તત્ત્વ આત્માને લાગેલ છે તેના ફળરૂપે શ્રીમંત ઘરમાં જન્મ થાય છે.

આપણાને સુખ મળ્યું તેનું કારણ શું? આપણે કોઈને સુખ આપેલ તે. વળી આપણે કોઈને સુખ કયારે આપેલું? ગયા ભવમાં કે આ ભવમાં પણ ઘણા વખત પૂર્વે તો તે વર્ષો - સૈકાઓ પહેલા આપણે કોઈને આપેલા સુખ દ્વારા અત્યારે આપણાને જ સુખ મળ્યુ કારણ કે આપણે કરેલ સુખના દાનથી બીજી વ્યક્તિ ને નહીં પણ આપણાને જ તે વખતે પુણ્ય નામનું અગોચર તત્ત્વ બંધાય છે. માટે હાલ તેના દ્વારા આપણાને સુખ મળ્યુ. આ જ રીતે કોઈને દુઃખ આપવાથી બંધાયેલ પાપ કર્મ આપણાને દુઃખ આપે છે. હા, આ પુણ્ય-પાપ નરી આંખે દેખાતા નથી એ વાત સાચી પણ હવા પણ ક્યાં દેખાય છે? બુદ્ધિ પણ ક્યાં દેખાય છે? પેટમાં થતી વેદના’ય ક્યાં દેખાય છે? આ તમામ વસ્તુ ન દેખાતી હોવા છતાં’ય આપણી માનીએ છીએ કારણ કે તે અનુભવાય છે તેમ પાપ-પુણ્ય અનુભવ સિદ્ધ છે. સંતોના સાચિધમાં (ટીવી પર નહીં !!!) તેમની વાણી દ્વારા પ્રતીતિ થાય છે જ. અને આવા પાપ પ્રત્યે બીક રાખવી અર્થાત્ પાપભિરૂતા નો ગુણ (આ ગુણ છે !!!) પ્રગટાવવો. હા, કેટલીક ચીજની બીક પણ ગુણ કહેવાય. મા-બાપ, વડીલો,

ગુરુજન, પરમાત્મા આદિનો ડર હોય તો આપણે વંડી ના જઈએ. આજે આજની પ્રજા (આમાં તમે'ય આવી ગયા !!!) આ બધાથી બીતી નથી માટે બેફામ રીતે જુંદગી જીવે છે. આજે સમાજમાં ચાલતા તમામ દૂષણોનું મૂળ છે પાપ ભીરતાનો અભાવ. લાંચ લેનાર નેતાજી અને લાંચ આપનાર શ્રીમાનમાં જો પાપભીરતા હોય તો સ્વાભાવિક રીતે આવું કામ ન કરે. દર્દીના ખોટા ઓપરેશનો કરનાર ડેક્ટરમાં પાપભીરતા પ્રગટે તો દર્દીને દુઃખી કરવાનું દુઃસાહસ ન જ કરે. ફિલ્મજગત દ્વારા આજની યુવા પેઢીને ગુમરાહ કરનાર વ્યભિચારના માર્ગ દોરનાર ફિલ્મ નિર્દેશકોમાં પાપભીરતા હોત તો ભારતનું વર્તમાન સાચા અર્થમાં સ્વર્ણિમ હોત. અને આમ, તમામ ક્ષેત્રની વ્યક્તિ પાપભીર બને તો વેપારી, શિક્ષક, નોકર, કારીગર આદિ તમામ યોગ્ય કામ કરે જ. આનાથી જગત આખાની સાથે તમને પોતાને પણ ફાયદો થાય. પાપ પ્રત્યેનો ડર ભૂલવાથી આપણે બેફામ પાપાચારો સેવીએ છીએ. એ ભયંકર દુઃખોના ઉત્પાદક છે. આજે ભૂક્ંપ, પૂર, સરકારી કનંડગાતો, મૌંઘવારી, ગ્રાસવાદ આદિ (ગાટર ઉભરાય તેમ) અમાપ હઢે વધ્યા છે. કારણ કે આપણા પાપો પણ અમાપ માત્રામાં વધી રહ્યા છે. પાપોની આ શુંખલાને ઘટાડવામાં આવે તો વિશ્વમાં કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર સુખ-શાંતિ વધવા માંડે. આ કુદરતની સહજ અનાદિકાલીન વ્યવસ્થા છે. જેને નષ્ટ કરવાની તાકાત કોઈ પણ વ્યક્તિ, રાષ્ટ્ર કે વિશ્વની નથી. સમગ્ર વિશ્વમાં વ્યાપક રીતે પાપ ઘટે તો વિશ્વ આખુ'ય સુખ-શાંતિ પામે અને તમે વ્યક્તિગત પાપો ઘટાડો તો વ્યક્તિગત તમને સુખ-શાંતિ મળે. કોઈપણ ખોટુ કામ કરતા કે કોઈને દુઃખી કરતા પૂર્વે માત્ર એટલુ વિચારો કે આનાથી બંધાતુ પાપ મને ભવિષ્યમાં દુઃખી કરશે. આટલો વિચાર કરવાથી તમારા ઘણા પાપો ઘટી જશે. માટે સુખ-શાંતિ પામવાના રાજમાર્ગ સમાન પાપભીરતા ગુણને પ્રગટાવી સુખી થાઓ.




પ્રસિદ્ધ દેશાચારીનું પાલન

જાણીતા લોકસાહિત્ય અને હાસ્યના સદાબહાર કલાકાર સાંઈરામ દવે એ ગુજરાતીની એક રમ્ભૂજ વ્યાખ્યા આપી છે. ‘નો પાર્કિંગ’ ના બોર્ડ પાસે વાહન પાર્ક કરનારા અને ‘કચરો અહીં ન નાખવો’ લખ્યું હોય ત્યાં જ ઉકરડો કરનારા આપણે ગુજરાતીઓ’ વાસ્તવિકતા પણ ખરેખર એવી જ છે. નિયમ ભંગ કરવાની આપણી કુટેવની લંબાઈ કિલોમીટરમાં નહીં પણ મ્રકાશવર્ષમાં માપવી પડે. શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવા જરૂરી પાંચમો ગુણ કહ્યો છે “પ્રસિદ્ધ દેશાચારીનું પાલન”. આપણી કલ્યનામાં ભગવાન એટલે ધર્મની બાબતો અને કિયાકાંડોથી જ જીવન વિતાવવાનો ઉપદેશ આપનાર વ્યક્તિ છે. પણ વાસ્તવિકતામાં આપણી પ્રત્યેક પળને સુખ-શાંતિથી ખુશનુમાં રાખવાનો ઉપદેશ આપે તેનું નામ પરમાત્મા છે. અને તે વ્યાખ્યા ભગવાન મહાવીરે આપેલ સુખી થવાના ઉપ ગુણોના ઉપદેશ દ્વારા ચરિતાર્થ થાય છે. આપણા દેશના કાયદાનું ગ્રાણ પ્રકારે વર્ગીકરણ કરીએ. આપણા દેશના ઢગલાબંધ કાયદાઓ આપણે પાળીએ છીએ, ઢગલાબંધ કાયદા તોડીએ છીએ, અને ઢગલાબંધ કાયદાઓ મજબૂરીથી તોડવા પડે છે. પણ અહીં સરકારે સ્વાર્થ પોષવા નાખેલા ગજ બહારના કાયદા કે નિયમોની વાત નથી કરવી. તમારા પગ નીચે પાણીનો રેલો નાખવો છે. આપણે સરકારના માટે તેની કાર્યપદ્ધતિ અને ભ્રષ્ટાચાર માટે તો ખુલ્લેઆમ બોલીએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ પણ કો'ક દિ ખુદની બાબતમાં તો વિચારો, જે બાબતમાં આપણે કાંઈ કરવાનું છે



તેમાં ઉણા કેમ ઉત્તરીએ છીએ. યાદ રહે, સરકાર પાસે હક માંગવાનો તેને જ અધિકાર છે જે દેશ પ્રત્યેની પોતાની ફરજો બજાવે છે. દેશના લોકતંત્રની ખરાબીઓ માટે બેફામ બોલનારા અને તેની પાસે જાત-જાતના હકોની માંગણી કરનારા બિરાદરોને મારે પૂછું છે કે દેશ પ્રત્યેની તમારી ફરજો તમે કોઈ દિવસ ચૂક્યા તો નથી ને ???

તમને દેશની ફરજો ચૂક્યા
નથી ને ? એમ પૂછતા'ય શરમાવા
જેવું છે ખરેખર તો આજે એમ
પૂછું પડે તેવી હાલત છે કે તમે
કોઈ દા'ડો દેશ માટે ફરજ બજાવી
છે ??? આપણી પોઇન્ટેડ ફીંગર
કરતા બીગ ફીંગર (પહેલી કરતાં
બીજી આંગળી) હુમેશા મોટી જ
હોય છે. તેમ કોઈની ફરજો કરતા
આપણી ફરજો વધુ હોય છે. જો તમે તમારી ફરજ બજાવતા નથી. તો દેશના
રાજકારણીઓને ફરજ બજાવવાનું કહેવાનો અધિકાર શું છે ? આપણા દેશમાં તો બાપ !
કેટલી ગંદકી ? જ્યાં ને ત્યાં કચરાના ઢગલા હોય. અમેરિકામાં તો કયાંચ રોડ પર
કાગળિયુ'ય ના દેખાય.' અમેરિકાથી ભારત પાછા આવેલા શ્રીમતી પટેલ આવી વાત
કરતા-કરતા બિસ્કીટનું રેપર રોડ પર કયાં નાખી દે તમને ખબરે ના પડે !!! એ
અમેરિકાની પ્રેમિકાઓને કહેવાનું કે ત્યાં તો કો'ઈ દા'ડો રોડ પર કચરો ન'તા કરતા
આજે અહીં ભારતમાં આમ કેમ ? અગર તમે સ્વચ્છતાની વાતો કરો છો તો લો આજથી
શાપશ “હું કોઈ દિવસ રસ્તા પર કચરો નહીં નાખું” અને જો શાપશ ના લેવી હોય તો
સરકારને ભાંડવાનું બંધ કરો. અને અમેરિકા બહુ ગમતું હોય તો હાલવા માંડો ત્યાં
તમારા વગર અમારો દેશ નિરાધાર નહીં થાય. પણ અહીં રહીને અહીંનું ખોદવું એવી
રાખ્યદ્રોહિતા કેમ કરો છો ! “એ’લા રૂપેનભાઈ ! આજનું છાપું જોયું આજે ફલાણા
મંત્રીનું ૧૨૫ કરોડનું કૌભાડ બાધાર આવ્યું” બાઈક પર ફુલસ્પીડ જતાં-જતાં મોબાઈલ
પર કો'ક તમારા જેવો જ ગામ-ગપાટા કરનારો આટલું બોલે છે ત્યાં કો'ક પોલિસ તેને




પકડીને લાઈસન્સ માંગો છે. ત્યારે ‘ખબર છે હું કોણ છું ! એમ કહીને પોતાના (કાનૂન કે હાથ બદે લમ્બે હોતે હૈ) (ના, ગુડો કે!) ઓળખાજવાળા પોલિસ ઓફીસરને વચ્ચે પાડીને કે ૫૦ રૂ. ની નોટ ધરીને છટકી જનારાનું હોલ્સેલ માર્કેટ સ્વર્ણિમ ગુજરાતમાં પ્રત્યેક શહેરે છે. જો તમારા જેવા સજજનો (તમને સજજન કીધા !!! છો ખરા ?) આવી ગુસ્તાખી કર્યા કરશો તો ઉપરના લેવલે સુધારો કયાંથી આવે ? કારણ આ નાના ગુનાઓ જ મોટા ગુનાની નેટ પ્રેક્ટીસ છે. જેલદિલિથી કહો તમે મોટા ગુના કરતા નથી મતલબ લાંચ લેતા નથી, કટકી ખાતા નથી તેમાં તમારી ખાનદાની કામ કરે છે ? કે તમને એ પોસ્ટ મળી જ નથી. એના કારણે આ ગુના નથી કરતા ? શું તમને કોઈ ધારાસભ્ય બનાવે તો તમે લાંચ નહીં જ લો ને ? આ વાતો દેશના ભ્રષ્ટ રાજનેતાના બચાવ માટે જરાય નથી એમાં તો ધરખમ સુધારો જરૂરી છે. પણ હાલ, આપણી મનોવૃત્તિ ચકાસવા માટે છે. તમે તો નક્કી કરો જિંદગીમાં ખૂબાર થઈ જાઉં તો’ય લાંચ નહીં આપું” તો’ય તમને ધન્યવાદ (કરશો ??) આવી દગ્લાંખંખ બાબતો છે. જેમાં ટેક્સ ચૂકવવાની વાત નથી, કલાકો દેશ માટે ફાળવવાના નથી, કોઈ મોટી બુદ્ધિ લડાવવાની નથી. છતાં તેવા કાનૂનોનો આપણે ઠંડે કલેજે સત્તિનય ભંગ કરીએ છીએ. અને દેશને બરબાદી તરફ ઘેકેલવા માટે નાનો ધક્કો પૂરો પાડીએ છીએ.

હિમત હોય તો સરકાર સામે લડો પણ એવી રીતે કે સરકારને કાંઈક હલવું પડે. તમે અંદર-અંદર વાતો કર્યા કરીને સરકારનું કાંઈ સુધારી શકતા નથી. તો શા માટે સમય વેડફો છો.

સામાન્યથી ભારત દેશનો (ગુજરાતનો તો છે જ !) વણલઘ્યો નિયમ છે કે નિત્ય પંખીને ચણ નાખવા, ફૂતરાને રોટલી (તાજ !! વાસી નહીં!) નાખવી, ગાય-ભેંસને ધાસ નીરવું, આવી પશુ પ્રેમની પ્રવૃત્તિ એ પણ પ્રસિદ્ધ દેશાચારીનું પાલન છે. (આજથી ચાલુ કરજો) ‘માનવ સેવા એ પ્રભુસેવા’ આપણું સૂત્ર નથી. (હા !!! નથી !) આપણે ત્યાં તો પશુ-પંખી-જીવ-જંતુ સુધી તમામની દ્યા કરવાનું પ્રેક્ટીકલ અને દૈનિક જીવનમાં શીખવવામાં આવે છે. ‘માનવ સેવા એ પ્રભુ સેવા’ ના રૂપકડા સૂત્ર હેઠળ કેટલાક બિનભારતીય ધર્માઓ આપણને પશુ દુનિયાથી દૂર હટાવે છે. ગુજરાતમાં જૈનોની ૨૪૨ નાની-મોટી પાંજરાપોળો છે. જેમાં ગાય-ભેંસ બળદ-પાડો આદિ તમામ

પશુઓને આશરો અપાય છે. આજે માત્ર જૈનો જ નિત્ય (રોજ) ૧ કરોડ (અર્થાતું વર્ષે રૂપિયા ૩૬૦,૦૦,૦૦,૦૦૦ ત્રણસો સાઠ કરોડ) રૂપિયા પાંજરાપોળોમાં વાપરે છે. (આ અંકો માત્ર ગુજરાતનો જ છે !) (જૈનો પથ્થરમાં જ રૂપિયા નાખે છે બોલનારા ફરી વાંચે) આનું મૂળ કારણ આપણી હિન્દુ સમાજ વ્યવસ્થા છે. જ્યાં પ્રાણી-પંખી આદિ તમામ જીવસૂચિને જીવવાનો અધિકાર છે. હા !, આ જીવસૂચિને પોખવાના પુષ્યના કારણે જ આજે જૈનો સૌથી વધુ સુખી અને સમૃદ્ધ છે. અર્થાતું પ્રસિધ્ય દેશચારીનું પરિપાલન કરવું એ સુખી બનવાનો રાજ માર્ગ છે. જુઓ આવી અનેક બાબતો છે દા.ત. મર્યાદાસભર વસ્ત્રો પહેરવા, સંયમિત રહેવું, કોઈને ચૂસવા નહીં આ બધા જ પ્રસિદ્ધ દેશચારાનું પાલન કરનારા એકાંતે ૧૦૦% સુખી જ થાય છે. માટે સુખની ઈચ્છા રાખનાર દરેકને આ ગુજરાનું પાલન કરવું અંત્યાવશ્યક છે. દેશના આચારો પાળીને દેશમાં રહે-રહે જ સુખી થાઓ.





निंदानो त्याग

ઘરમાં કે દુકાનમાં જો ૫-૧૦ મિનિટ નવરાશ મળે અને સરખે-સરખા વાતો કરવા મંડી પડે તો વાતોમાં મૂળ તત્વ ક્યું હોય ? પારકી પંચાતમાં પારકી નિંદા પણ ભળી જાય. ફલાણાએ આમ કરવા જેવું નહોતું ખોટું કર્યું ! આમ કર્યું હોત તો સારુ થાત ! પણ એનામાં બુદ્ધિ જ કયાં છે ? (હા ભાઈ !!! તમને ભાડે આપી પછી ના જ હોય ને !!!) આવી નકામી નિંદા-કોન્ફરન્સમાં ભારતની ૧૧૦ કરોડની વસ્તીના દૈનિક ૧૧૦ કરોડ કલાક (સરેરાશ) તો જતા જ હશે. (અર્થાતું વર્ષે ત્રણ લાખ સાઠ હજાર કરોડ કલાક !!!) શ્રીમણ ભગવાન મહાવીરે સુખી થવા જરૂરી છિછો ગુણ કહ્યો છે. નિંદાનો ત્યાગ. કદી કોઈપણ વ્યક્તિની નિંદા ન કરો. તમને તમારી નિંદા કરે તે નથી ગમતું તો બીજાની નિંદા શા માટે કરો છો ? કોઈના ઘરના આંગણાનો કચરો સાવરણીથી સાફ કરવા તમે તૈયાર નથી થતા. પણ કોઈના જીવનનો દુર્ગુણ જીભથી સાફ કરવાની તલખ રાખો છો. કમાલ છે તમને ??? તમને નિંદા કરવાની કુટેવ છે ને ? તે ખરાબ લાગે છે ? તમે જેની નિંદા કરો છો તે વ્યક્તિને ખબર પડશે કે ફલાણા ભાઈ તમારી નિંદા કરતા હતા ત્યારે તમારા માટે શું વિચારશે ? ભલે, તમે તેનાથી બળવાન છો તે તમારું નહીં બગાડી શકે પણ તમે શા માટે કોઈને અણખામણા થાઓ છો ? જે વ્યક્તિની તમે નિંદા કરો છો તેનું તમારી નિંદા દ્વારા કાંઈ બગડતું તો છે નહિં. ઉલટાનું તમે બીજાના છિક્રો બોલીને સામેનાની આગળ ખરાબ થાઓ છો. નિંદા કરવાથી નુકશાન નિંદા કરનારને જ થાય છે. તમે આજે જેની નિંદા કરો છો. તે કાલે તમારી બમણી નિંદા કરશો. આ ચકમાં આપણી જીભને વ્યાપામ થાય છે. લોકોને તમાશો જોવા મળે છે. બાકી કાંઈ વળતું નથી. આજે બપોરના ઓટલા પર બેસીને ગામ આખાની નિંદા-કુથલી કરનારા મહિલા મંડળો સંકલ્પ કરે કે બપોરે ૨ ક. ભજન ગાઈશું. બપોરે ૨ કલાક સારુ પુસ્તક વાંચશું. એક જણ વાંચે બાકીના સાંભળે તો

કેટલો બોધ થાય ? જો ... કે ... બપોરની સિરિયલોનું ચાની જેમ વ્યસન થઈ ગયું હોય તેને નિંદા કરવાની પણ વાત ન આવે કે ભજન-પુસ્તકનીય ન આવે. ૨૪ કલાકમાં ગમે ત્યારે જોવાતા પિકચરો કે સિરિયલોમાં સંસ્કારનું તો ધોવાણ થાય જ છે. છતાં કદાચ એ વાત બાજુ પર મૂકીએ તો'ય તમને ટી.વી. જોવાથી ઉપયોગી થાય અરે ! પૈસા કમાવામાં, કે બુદ્ધિ વિકસે તેવું, દેશના વિકાસ માટે કે પરિવારની એકતા ટકાવનારી કોઈ બાબતો શીખવા મળે છે ? અને આવું કશું જ ન મળતા છતાં માત્ર આપણી દુષ્ટ વૃત્તિઓને પોષવા આપણે તેની સામું બેસી રહીએ તેમાં કેટલું વ્યાજબી છે ? તે વાચક સ્વયં વિચારે મૂળ વાત પર આવીએ, કે નિંદાના ચક્કરને તોડવા માટે તમે પ્રશંસાનું શસ્ત્ર અજમાવો (તમે ચૂપ તો રહી જ નથી શકવાના ને ?) કો'કે કરેલી સારી વાત, કો'કનું સત્કાર્ય તમે કહેતા ફરો, કમ સે કમ દિવસમાં પાંચ વાર તો કો'કની પ્રશંસા કરવી જ. આનાથી નિંદાનો દુર્ગુણ ધીમે-ધીમે દૂર થશે. અને અત્યાર સુધી નિંદા કરીને જે તમારી છાપ તમે બાગાડી છે તે'ય સુધરશે. શ્રમણ ભગવાન મહાવીરે દીક્ષા (સંન્યાસ) ગ્રહણ બાદ જ્યાં સુધી પૂર્ણ જ્ઞાન (ક્રેવળજ્ઞાન) ન પ્રગટ્યું ત્યાં સુધી અર્થાત્ સાડા બાર વર્ષ સુધી મૌન જ રહીને જંગલોમાં કઠોર તપ્ય પૂર્વક સાધના કરી હતી. અને આવા પ્રચંડ તપોબળ દ્વારા આત્મા પરથી મોહના તમામ વિકારો હઠી ગયા ત્યારે તેમને દેશના (સત્સંગ) આપવાની શરૂઆત કરી. મતલબ પૂર્ણજ્ઞાનની પ્રાપ્તિ પછી જ તેમને જગતને ધર્મનો રાહ ચીંધ્યો. અને માટે જ તેમના માર્ગના કોઈપણ વિધાનો કદી ખોટા ઠરી શકતા નથી. કદી કોઈને દુઃખી પણ કરતા નથી. (આપણે વિચાર્ય વગર જ બોલી નાખીએ એટલે મુસીબતો સર્જય છે !!) મહાવીર સ્વામીએ સુખી થવાના છઢા ગુણમાં એક વિશેષ વાત કરી છે કે જો તમે ખૂબ નિભ કક્ષાના હોવાના કારણે નિંદા વગર ન જ રહી શકો તો (આ વાત નિભ કક્ષાના લોકોની છે !) પણ મોટી વ્યક્તિઓની નિંદા તો ન જ કરવી. અહીં નિભ એટલે નિંદાના વ્યસનવાળી કોઈપણ જાતિની વ્યક્તિ એમ અર્થ કરવો. મોટી વ્યક્તિની નિંદા કરનારને ખૂબ જ કદુ ફળ ભોગવવા પડે છે. કોઈ રાજકારણી, શ્રીમંત, પ્રતિજ્ઞિત વ્યક્તિઓ ખોટી હોય તો'ય પ્રબળ પુણ્ય ધરાવતી હોય છે. તો જ તેમને તેવો મોભો મળે. અને તમને તેવો મોભો નથી મળ્યો માટે માની જ લેવું પડે તમારું પુણ્ય તેનાથી ઓદ્ધું જ છે. હવે સમજો કે જેની પાસે શસ્ત્રો ઓછા હોય કે ઉત્સાહ ઓછો હોય

અને વધુ શસ્ત્ર વાળા કે વધુ ઉત્સાહવાળા સામે યુદ્ધ કરે તો લગભગ હારે જ છે. તેમ ઓછું પુણ્યવાળી વ્યક્તિ વધુ પુણ્યવાળાની નિંદા કરે તો ટકી શું શકવાનો? હા, રાજકારણી કે અન્ય કોઈ વ્યક્તિનું કોક પગલું સમાજને અહિતકર હોય તો સંગઠિત થાઓ. જેથી દરેકનું પુણ્ય ભણે. પછી એવું કાંઈક વિચારીને કરો. (રિપિટ! વિચારીને) કે જેનાથી સામેનાને પણ થોડો ઘસારો પહોંચે બાકી, સરકારના ભાવવધારા સામે ૧૦,૦૦૦ વ્યક્તિઓ ખાલી પોતાના શુપમાં આકોશ ઠાલવે તેનાથી શું વળે? ૨૦૦ વ્યક્તિ પણ સંગઠિત થઈને કાંઈક કરે તો કાંઈક થાય. અરે! વાત તો એ હેઠે વણસી છે કે આપણે સર્વોપરિ એવા ધર્મની પણ નિંદા કરતા ખચકાતા નથી. મંદિરો અને દહેરાસરોને વધતા અને વિશાળ થતા જોઈ નવરી બજારો કૂતરાની જેમ ભસે છે કે ગુજરાતના સેંકડો લોકોને રહેવા ધર નથી અને આ ભગવાન માટે જુઓ તો ખરા! નાનું મંદિર બનાવ્યું હોત તો વાંધો શું હતો? મારે એ દોઢાચ્ચાઓને કહેવું છે. આપણા રાષ્ટ્રપતિ ભવનની જગ્યા ગરીબો માટે ફળવાય તો ૧૦,૦૦૦ (દસ હજાર!) ગરીબ કુંઠુંબો રહી શકે તેમ છે. કાઢી નાખો રાષ્ટ્રપતિ ભવન! એક માણસને રહેવા બે રૂમ રસોડું તો હું થઈ રહે! ત્યાં કાંઈ ચાલતું નથી એટલે ભગવાનનું પડાવવા આવવાનું? ભગવાન જેટલી નિરાગતા, વૈરાગ્ય, આધ્યાત્મિક ઉંચાઈ, પ્રકૃષ્ટપુણ્યાઈ ભારતની ગરીબ પ્રજાની નથી એટલે તે રહેઠાણ નથી પામતું. એક જગ્યાએ કો'ક લેખકે બાફીલું કે ભગવાન! તારા વાધા કેવા રૂપેરા હોય છે. તારા ઉત્સવમાં કેવું માણસ મળે છે? મારી નાની બહેનના ઝોક પર કોઈ થીગડુ'ય નથી મારતું. મારા ૧૫ ઓગસ્ટના વકત્યમાં પ્રજાજનો દેખાતા જ નથી. અરે! પણ તમે ભગવાન જેવા થાઓ તો ખરા! એક પારકી નિંદા છોરી નથી શકતા અને ભગવાન જેવા વાધા ને ઓડિયન્સ માંગો છો. કાંઈ બુદ્ધિ છે? અને યાદ રહે! વિશાળ દેવાલયોમાં ભક્તોની ભાવના વિશાળ થાય છે. અને તે વિશાળ ભાવનાના કારણે જ ગરીબોને અસ, વસ્ત્ર, મેડિકલ કેમ્પ જેવી સુવિધા પૂરી પાડે છે. આ ભાવનાઓનું ઉદ્ગમસ્થાન આવા મહામંદિરો જ છે. માટે આવી નિંદાઓના પાપમાંથી છૂટો અને સાચા અર્થમાં સુખી બનો



સુયોગ્ય ઘરમાં વસવું

oo

માનવીની મુખ્ય ત્રણ જરૂરિયાત છે. (૧) રોટી, (૨) કપડા, (૩) મકાન – આ ત્રણ સિવાયની બાકીની ચીજો માનવી લગભગ જરૂરિયાત માટે નહીં પણ સુવિધા માટે ઉભી કરે છે. પણ આ ત્રણ ચીજોમાં આપણે કેવી રીતે, કેવું મેળવવું તે બાબતે પણ ઉપદેશ ભગવાને આખ્યો છે. શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવા જરૂરી સાતમો ગુણ કહ્યો છે. અતિગુપ્ત કે અતિ પ્રગટ ન હોય તેવા, સારા પાડોશવાળા, પરિમિત બારણાવાળા ઘરમાં રહેવું. અગર આ જ વાત અત્યારના સંદર્ભમાં વિચારીએ તો બોલી ઉઠીએ. વાહ ! આટલું સુંદર અને સચોટ નિવાસસ્થાન બીજા કોઈએ નથી બતાવ્યું. આપણું નિવાસસ્થળ ખૂબ ગુપ્તસ્થાનમાં હોય તો પોલીસ કર્મચારીઓની શંકાનું કારણ બનશે. આપણું ઘર ગુપ્ત સ્થળે હોય તો ચોર, ગુંડા જેવા તત્વો પણ આવતા ખચકાય નહીં. તેમના આવ્યાની ખબર બીજાને ન પડવાથી લૂટાવાનો ભય રહે. તેવી જ રીતે અધમવૃત્તિઓને પોષનારા પણ આવા સ્થાનનો ફાયદો ઉઠાવે માટે આવા તમામ દુષ્ણોથી બચવા માટે પરમાત્માએ ગુપ્ત સ્થાનોમાં રહેવાની ના પાડી. સામે છેડે અત્યંત ખુલ્લા (પ્રગટ) ઘરોમાં પણ ન રહેવું. અન્યથા ઘરની ગુપ્ત વાતો બીજા જાણી જાય તો અનર્થ થાય. અતિપ્રગટ ઘરમાં રહેનારાની બેન-દીકરીઓની મર્યાદા કયારેક લક્ષ્મણ રેખા ઓળંગી જાય. માટે અતિ પ્રગટ ઘરમાં પણ ન રહેવું જોઈએ. ઘરના આસ-પાસના લોકો અર્થત્ પાડોશી વર્ગ સારો હોવો જોઈએ. (તમારા પાડોશીના પાડોશી સારા છે !!!) જો તે સારા હશે તો તમારામાં પણ સંસ્કારિતા જળવશે. જો આસ-પાસની વસ્તી સારી ન હોય તો બાળકોમાં ગુણીયલતા કયાંથી આવશે ? જો પાડોશી સારા હશે તો સંકટમાં સાથ આપશે એટલે સારા સજજન પાડોશી એ આપણા નિવાસસ્થાનનો મહત્વનો મુદ્દો છે. અને ત્રીજી વાત ઘરને બારણા બંદું ન

હોવા જોઈએ. કારણ કે વધુ બારણા ઘરમાં ચોરીની ચિંતા વધારે છે. કુકર્મ આચરનારાને ઝડપથી ભાગવાની તક વધુ બારણાવાળા ઘરોમાં જલ્દી મળે છે. વાસ્તુશાસ્ત્રાનુસાર પણ વધુ વધુ બારણા રહેનારના સુખી જીવન માટે વિધકર્તા છે. માટે વધુ પડતા બારણાવાળા ઘરમાં ન રહેવું જોઈએ. અહીં જણાવેલા દોષોથી મુક્ત ઘરમાં રહેવા માત્રથી ઘણા દૂષજો ટળી જાય છે. વળી, ઘર આપણા મોભાને અનુરૂપ જોઈએ. આજના કાળમાં આપણે આપણાથી વધુ સુખી લોકો સાથે રહેવાની ભાવના રાખીએ છીએ. હકીકતમાં આપણાથી વધુ સારા લોકો સાથે રહેવું જોઈએ. આખા ગામની પ્રજા શહેર તરફ દોડે એટલે આપણે'ય શહેરમાં દોડીએ. શહેરમાં 'સિટિ વિસ્તાર' માં રહેનારા સોસાયટી વિસ્તારમાં દોડે છે. અને સોસાયટી વિસ્તારમાં રહેતા લોકો ફાર્મિલાઉસ તરફ વળ્યા છે. આખર ગામડામાંથી ગામડામાં અને આ દોડમાં નાના માણસો લોન અર્થાત્ દેવાના ચક્કરમાં ફસાય છે. ઘર સારુ, સ્વચ્છ, આકર્ષક રાખવા માટે આપણા ગજા બહાર ખર્ચો ન કરવો જોઈએ. તમે ગમે ત્યાં કપડા નાંખો નહીં, ઘરની ચીજવસ્તુ ગોઠવીને રાખો. પથારી ઉપર ચાદરો વ્યવસ્થિત પાથરી રાખો. ઘરમાં નકામો કચરો ના રાખો. તો 'ય ઘર દીપી ઉઠે. પણ શિસ્ત જેવું હોય તો ને ??? બીજું શહેરમાં ખૂબ જ નાના નિવાસસ્થાનો હોય છે. જ્યારે ગામડામાં ગાર-માટીના પણ વિશાળ ઘરો હોય છે. આપણી ભાવનાની સંકુચિતા અને વિશાળતાનો આધાર આના ઉપર પડી રહે છે. જે સમજ શકાય તેવી વાત છે. વળી, ઘરનું બાંધકામ પણ કેવા દ્રવ્યોથી થયું છે તેના પર પણ આપણી સુખ-શાંતિનો આધાર રહે છે. એક સાવ ખોટો ખ્યાલ આજની પ્રજામાં છે કે ગાર-માટીના ઘર એટલે કાચા મકાન અને પાકા મકાનો એટલે સિમેન્ટના મકાન. આ સાવ ખોટી વાત છે. સિમેન્ટની ઈમારતોનું આયુષ્ય ૧૦૦ વર્ષનું હોય છે. ગાર-માટીના મકાનનું ૧૫૦ થી ૨૦૦ વર્ષનું. હા, ગાર-માટીના મકાનમાં પ્રતિવર્ષ લીંપણું કરવું પડે. પણ આ મહેનત આજી નથી હોતી અને પશુધન ઘર આંગણે હોય તો છાણનો ખર્ચ પણ ન થાય. આવા ગાર-માટીના ઘર ઉપર રંગકામ આદિ કરાવ્યું હોય તો અત્યંત દીપી ઉઠે. અસ્તુ આ'તો પ્રાસંગિક વાત થઈ પણ ઘરમાં રહેનારા સારા હોય તો ગમે તેવા ઘરમાં'ય લોકોને આવવું ગમે અને ઝગડાળું કે માયાવી પ્રજાની માલીકી હોય તો બંગલામાં પ્રવેશ પણ

કરવો અનિશ્ચનીય થાય એટલે જ ક્યાં મહેમાન થવાય ક્યાં ન થવાય એ માટે આ બે દુહા યાદ રાખવા જેવા છે.

જ્યાં આદર જ્યાં આવકાર, જ્યાં નૈનુમાં નેહ

ઉસ ઘર જાઉં સાજન, ભલે વરસે ભાલા-મેહ (૧)

નહિ આદર નહિ આવકાર, નહી નૈનુમાં નેહ

ઉસ ઘર કભી ન જાઈએ, ભલે કાંચન વરસે મેહ (૨)

એટલે ઘર બનાવવાની બાબ્ય સુસજજતા સાથે ઘરમાં રહેનારા'યેય
સારા બનવું એ આવશ્યક છે.

આ ગુણ પ્રગટાવીને સુખી થાઓ.



© Imagesofasia.com



90

સદાચારીઓની સંગત કરવી

‘દોસ્તી’, ભિત્રતા, આજના કાળમાં ખૂબ જ વધતી જતી આવશ્યકતા છે. કારણ ઘરમાં ભાઈ-ભાઈ વચ્ચેના સંબંધો આજે વણસ્યા છે. જો કે દોસ્તીમાં સગા ભાઈ જેવી સંબંધની મીઠાશ કદી પામી નથી જ શકતી. પણ હવે જે પરિસ્થિતિ આવી છે તેમાં જ વધુ સારાઈ જળવાય તેવી સલાહ આજથી સેંકડો વર્ષો પૂર્વે થયેલ શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવાના આઠમાં ગુણ તરીકે આપી છે. તે આ સદાચારીઓની સંગત કરવી. આમાં એક વાત એ વિચારો કે તમારી સંગત કરનાર શું સદાચારીની સંગત કરનારો કહેવાય ?? (ખબર પડી !!!) બેર, જે હોય તે પણ આપણે સુધરવા સારા અર્થાત્ સદાચારીની સંગત કરવી. સદાચારી કોને કહીશું ? આપણા આજના કાળ પ્રમાણે એમ કહી શકાય કે જે કોઈ-પણ જાતનાં વસની ન હોય, લડાઈ-ઝગડા કરતો ન હોય, ભગવાનમાં આસ્થા ધરાવતો હોય અશ્લીલ મજાકો કરતો ન હોય અને વડિલોનું સન્માન જાળવતો હોય તેને સદાચારી કહેવાય. આમાંથી કોઈમાં કાંઈક ઓછુ હોય તો તેટલી તેની સદાચારિતામાં ઉણપ કહેવાય. પણ આપણી આસ-પાસમાં આવા સજજનો મળી રહેશે જ. જેઓ વસની પણ ન હોય, ઝગડાખોર પણ ન હોય, ધર્મમાં આસ્થા પણ ધરાવતો હોય, અશ્લીલ મસ્તી ન કરતો હોય અને વડિલોનું સન્માન પણ જાળવતો હોય.

વયસની વ્યક્તિ દગ્ગો આપનાર બની શકે છે માટે તેની સંગત ન કરવી જોઈએ, ઝગડાખોર વ્યક્તિ કયારેક આપણા જાનનું જોખમ કરી મૂકે તેવી શક્યતા છે માટે તેની સોભત ન કરવી, ઈશ્વરમાં શ્રદ્ધા ન રાખનાર નાસ્તિક તો નિગુણી-દુગુણીથી'ય બદંતર છે માટે તેને સાથે ન ફરવું. અશ્વીલ મસ્તી કરનાર વ્યક્તિની માનસિકતા, ઉર્જા ખૂબ

પ્રદૂષિત હોય માટે તેનાથી દૂર રહેવું અને વડિલોનું માન ન જાળવનારો નફફટાઈ કરતા વાર ન લગાડે માટે તેને તજવો. આ પાંચ દૂષણો ન હોય તેવાની સોબત-મિત્રાચારી કરવી તે તમારા જીવનને સુખી-સમૃદ્ધ બનાવવાનો ઉપાય છે. દા.ત. તમે આવા કોક સજજન સાથે મૈત્રી કરી તો તમને ભય રહેશે કે સમાજ વેદિયો, ભગતડો કહીને વગોવશે. પણ આ બિરુદ્ધો દરેક સજજનને મળે છે તેવું નથી રૂઢિયુસ્તોને જ વધુ પડતા મળે છે. માત્ર સદાચારી અર્થાત્ જાલીમ દુષણો ન હોય તેવાની સોબત કાંઈ આવા બિરુદ્ધો આપે તેવું બનવાની શક્યતા ઓછી છે. વળી, ધંધો કરવામાં તો સમાજ તમારી સાથે જ પહેલો આવશે. કારણ તેને ખબર છે કે ધાર્મિક-સજજન વ્યક્તિ કોઈ દિવસ છેતરશે નહીં. અહીં માત્ર મંદિરોમાં જનારા, કથાઓના આયોજન કરનારા, નિત્ય પૂજા-પાઠ, પારાયણ કરનારાને ધાર્મિક નથી કહેવા પણ દયાળું, યથાશક્તિ ધર્મનું આચરણ કરનારા, સંતોની સ્વાર્થ વિના સેવા કરનારાને ધાર્મિક કહ્યા છે. આવા ધાર્મિક-સજજનો ખોટું ન કરે. માટે વેપાર વધારવા માટે પણ સજજન થવું (સજજન દેખાવું નહીં !!! થવું) અને સદાચારી સાથે રહેવું જરૂરી છે.

This is a marketing idea.

સદાચારીની સોબતમાં સૌથી શ્રેષ્ઠ તો સંતો-મહંતો જ આવશે. આજે કોઈપણ સંતો ધર્મ-રાષ્ટ્ર-સંસ્કૃતિ રક્ષાના કાર્યમાં જ પડ્યા છે. જાહેર મિટિયા એક નાની વાત મળે તો પણ મોટું સ્વરૂપ આપી દે છે. એક સંતે સમૃત્તિ (બે નંબરની !) બનાવી તો તે પૈસો પોતાના માટે કેટલો વાપરશે ? એક બંગલો, ગાડી, થોડી ભૌતિક સુવિધા કે દેશ-વિદેશ ભ્રમણ. આ સિવાય તેમની સંપત્તિ મંદિર બાંધવામાં જશે તો પણ સમાજને હિતકારી છે. હોસ્પિટલ ખોલશે તો'ય સમાજ માટે. નાના ગામડાઓમાં સત્સંગ-ભવન કે વાડી બનાવશે. તે પણ સમાજ માટે. જે વ્યક્તિ પોતાની સંપત્તિનો મોટો ભાગ અરે ! ખુદના જીવનનો મોટો સમયગાળો ધર્મ-સંસ્કાર-રાષ્ટ્રની રક્ષા ખાતર ખર્ચે છે. તેના પર નાનકડી ભૂલોનો ખટલો ચલાવાય જ શી રીતે ? કાળું નાણું સંત પાસે પકડાયું તે શુનો છે. તો રાજકારણી, શ્રીમંત ઉદ્ઘોગપતિઓ પાસે પડ્યું રહેવું ગુનો નથી ? સંતોએ પૈસા રાખવાની જરૂર જ્યારથી શ્રીમંતો ધર્મમાં છુટથી ધન આપતા બંધ થયા ત્યારથી જ પડી છે. આજે કો'ઈ સાંસદ કે ઉદ્ઘોગપતિના નાણાંની તપાસ કરવા કેમ કોઈ C.B.I. નથી

જતી ? જેના પૈસાનો ૧ ટકો પણ સમાજ માટે નથી વપરાવાનો તેના માટે કોઈ પણ પ્રકારની તપાસ નથી થતી અને જેના પૈસાનો ઉપયોગ હંમેશા સત્કાર્યમાં થાય છે. જે નજરે દેખાય છે. (નૂરુંપમાં રાજકારણીઓ સરકારી રૂપિયા આપશે (અરે ! એમાંથી'યે લઈ જાય છે !) પણ જિસ્સાના પ રૂ. કાઢે છે ????) તેમના પર કાળા નાણાંનો કેસ કેવી રીતે ચલાવાય ? પહેલા સાંસદો અને ઉદ્ઘોગપતિઓને પકડો પછી અહીં સુધી પહોંચો. પણ આ બધું આપણા (ખાસ તમારા !!!) પ્રયત્નો વગર કેવી રીતે થાય. એક સજજન બીજા સજજન સાથે સોબત, મૈત્રી કરે છે. ત્યારે સજજનોનું સંગઠન થાય છે. આજ રીતે મૈત્રી, દોસ્તી અનેક સજજનો સુધી વ્યાપે તો સજજનોનું સામ્રાજ્ય ચાલી શકે. આજે દુર્જનો સંગઠિત છે માટે તેમનું ચાલે છે. આપણા જેવા સજજનો સંગઠિત થાય તો તેમનું રાજ જરૂર બને. અને તો અનેક પાપાચારો કે જે સદાચારીને પણ દુરાચારી બનાવે છે તે અટકી શકે. અર્થાત્ સદાચારીની સંગત કરવી એ તમારા ખુદના માટે ફાયદો કરે છે તેમ સમાજ અને દેશ માટે પણ ફાયદો કરનાર છે. માટે જ ધાર્મિક સંગઠનો કે જે સંતોના માર્ગદર્શન હેઠળ ચાલે છે. તેમાં જોડાવું અનેક રીતે લાભકારી બનશે આમ, તમે સદાચારીની સંગત કરો અને કોઈ તમારી સંગત કરવાથી સદાચારીનો મિત્ર બની શકે તેવા બનો, અને આ ગુણના વિકાસ દ્વારા સુખી બનો.



Thanks for always being there for me.



Johanseet Maer

q q

કૃતજ્ઞતાને ધારણ કરવી

oo

‘કૃતજ્ઞતા’ નામના ગુણ બાબતે ઘણું બધું લખાય છે, બોલાય છે અને તેનું પાલન કરનારા પણ ઘણા હોય છે. કૃતજ્ઞતા એટલે ઉપકારો યાદ રાખી ઉપકારોના માટે આપણે કાંઈક કરી છૂટવું. આપણા સૌથી નિકટના જો કોઈ ઉપકારી હોય તો તે છે માતા-પિતા. શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવાના નવમાં ગુણ તરીકે કહ્યું છે. ‘કૃતજ્ઞતાને ધારણા કરવી’ હા,આ સુખી થવાનો માર્ગ છે. કારણ માતા-પિતાની આંતરડી કકળાવનારો કદ્દી સુખી ન થાય. આજે કાળ ખૂબ ખરાબ છે. અને સૌથી વધુ મોટી ખરાખી છે વૃધ્ઘાશ્રમો. જે બાળક મા-બાપને સાચવી ન શકે તેને પૃથ્વીમાતા નહી જ સાચવે. એક યા બીજી રીતે ફટકો પડશે જ. જે મા-બાપે આપણને જન્મ આપ્યો. જીવન આપ્યું, મોટા કર્યા એને વૃધ્ઘત્વમાં ન સાચવવા જેટલા નિર્લજ્જથવું એ નાલાયકતાની નિશાની છે. જેણે ૨૨-૨૨ વર્ષ આપણને સાચવ્યા. એ મા-બાપને માત્ર ૨ વર્ષના પત્નિના સહવાસથી છોડી દેતા જીવ શી રીતે ચાલે છે? આ એ જ પત્નિ છે જે પોતાના બાળકને સાક્ષાત્ શ્રવણ બનાવવા માંગે છે. અને પોતના પતિને શ્રવણ બનતા રોકે છે. તેનું બાળક શ્રવણનો અવતાર શી રીતે બને? કારણ કે બાળક તમારું સાંભળે નહી તો’ય તમને જુવે તો છે જ. જે બાળકે પોતાના મા-બાપને તેમના મા-બાપ સાથે કડકાઈથી વ્યવહાર કરતા જોયા છે તે પોતાના મા-બાપને સારી રીતે જાળવે તેવી આશા જ વર્થ છે. ભારતીય પરંપરા તો સંતોની પરંપરા છે. અહીં અવતરિત પ્રત્યેક વ્યક્તિ સંત બનવાના જ્વાબમાં રાચતી હતી. આજે વાત એ હેઠે વણસ્પી છે કે લોકો સંત નહી સાચા સંતાન પણ બનતા નથી. જે પ્રભુને પૂજે તે સંત. જે મા-બાપને પૂજે તે સંતાન. અગર તમે સાચા સંતાન નથી તો તમે સંતના શરણમાં શાંતિ નહી જ પામી શકો. મા-બાપને ન પૂજનારા, ન સાચવનારાને તેના દિકરા નહી સાચવે

આવી બીક બતાવી પડે એ પણ શરમજનક બાબત છે. શા માટે આવી બીક બતાવવી પડે ? મા-બાપના ઉપકારોને સમજુને સંતાને તેમને પૂજવા જોઈએ. ઉપકારીના ઉપકાર યાદ રાખવાની પરંપરા જ આજે ખતમ થઈ ગઈ છે. આ ખૂબ જ ચિંતાનો વિષય છે. એક સામાન્ય વ્યક્તિ ઉંચો આવે ત્યારે અન્ય લોકોનો સહારો લઈને જ આગળ આવે છે. પોતાની બુદ્ધિ, પૂર્ણ, ક્ષમતાની સાથે અન્યની સહાયે પણ તેના વિકાસમાં ભાગ ભજવ્યો છે. તો આ ઉપકારને ભૂલવો માનવતા થોડી છે ? ઘણાનો કુતર્ક હોય છે કે પહેલા જ્યારે અમારી સ્થિતિ ખરાબ હતી ત્યારની વાત બરાબર છે કે તે અમારાથી વડિલ વ્યક્તિએ અમને સહાય કરી પણ આજે અમે તેમનાથી ઘણા આગળ નીકળી ગયા છીએ. સામાજિક સ્તરે અમારી ક્ષમતા, સંપત્તિ, સાથી-મિત્રો તેમના કરતા ઘણા ઉચ્ચા દરજજાના છે. ત્યારે અમે તેમને મોટા માનીએ, ઉપકારી તરીકે આદર કરીએ એ બધું યોગ્ય નથી લાગતુ. આજે જે પરિસ્થિતિ છે તે પ્રમાણે જ વ્યવહાર ઉચિત છે. એ ગાંડાલાલોને કહેવાનું કે ‘ભલા માણસ ! રણમાં તરસે મરતો રાજીવી ૧ જ્લાસ પાણી માટે આપું રાજ્ય આપવા તૈયાર થઈ જાય કારણકે નિરાધાર અવસ્થામાં જીવન્ત રાખવાના ઉપકારનું મૂલ્ય આંકડાઓમાં ન થાય. એ પાણી આપનાર ભલે બિખારી માણસ હોય પણ રાજીવીએ તેનો ઉપકાર કદાચિ ભૂલવો ન જોઈએ. માનો ! તે વખતે તે સામાન્ય માણસે રાજીવીને પાણી ન આપ્યું હોત તો શું તે જીવત ખરો ? અને જો મરી જાત તો આ રાજ્ય સમૃદ્ધિ પામત ? અર્થાત્ સમગ્ર રાજ્ય સમૃદ્ધિ રાજ પુનઃ પામ્યો તેમાં તે વ્યક્તિનો ફાળો મહત્વનો છે. બસ, એ જ રીતે જન્મતા સાથે જ્યારે આપણી કુદરતી હાજત પ્રત્યે પણ જગૃતિ ન હતી, બોલવાની-વાંચવાની તો દૂર ! જીતે ખાવાની પણ સમજ નહોતી. ત્યારે તમારી માતાએ જ તમને સાચવેલા. આજે ભલે તમે બુદ્ધિ, શિક્ષણ, સંપત્તિ, સામાજિક પ્રતિષ્ઠા બધા જ વિષયમાં તમારા મા-બાપથી આગળ છો પણ યાદ રાખો એ વખતે જ્યારે તમે જીતે ખાઈ પણ નહોતા શકતા ત્યારે તમારા મા-બાપે ત્યજ દીધા હોત તો તમે ત્યાં જ પૂરા થઈ ગયા હોત ! આજે તમે જ્યાં છો ત્યાં સુધી પહોંચવામાં સૌથી મોટો ઉપકાર તમારા મા-બાપનો જ છે. કેટલાક કુપુત્રો કહે છે કે જન્મ મા-બાપે આપ્યો તો સાચવવા તેમની ફરજ છે એમની ફરજ બજાવી એટલે અમારા પર ઉપકાર થઈ ગયો ? એ કુપુત્રો કાન ખોલીને સાંભળે (ના ! આંખ ફાડીને વાંચે !!!) કે તમને સારી રીતે

સાચવીને એમને એમની ફરજ ખૂબ સરસ રીતે નિભાવી. હવે તમે તમારી ફરજ સારી રીતે નિભાવો. જો જન્મ આપેલ બાળકને સાચવવું મા-બાપની ફરજ છે તો જે મા-બાપે જન્મ આયો તેમને વૃધ્ઘત્વમાં સાચવવા એ સંતાનની ફરજ છે. તમે એમાં તેના પર જરા'ય ઉપકાર નથી કરતા. આખર બચપણમાં ગોદ દે'નારને ઘડપણમાં દગ્ગો ન દે'તા ગુણને પ્રગટાવી સુખી બનો.

શ્રવણ



93

ઉપદ્રવવાળા સ્થાનને તજવું

હુમલો-આકમણ જેવા શબ્દો આપણને ભય ઉપજવનારા છે. આ હુમલો અને આકમણને જરાક સરળ અને જુની ભાષામાં કહેવું હોય તો તે છે ઉપદ્રવ. આપણે હંમેશા ઉપદ્રવથી ડરતા જ રહ્યા હીએ. અને આપણી ક્ષમતા અને માનસિકતાને ચકાસીને શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવાના દસમા ગુણ તરીકે જણાવ્યું છે કે ઉપદ્રવવાળા સ્થાનને તજવું. આમ તો, ભગવાન મહાવીરે દીક્ષા ગ્રહણ બાદ સાડા બાર વર્ષ સુધી કઠોર તપ અને ઉપદ્રવવાળા સ્થાનોમાં સામેથી જઈને પ્રતિકુળતા વેઠી કર્મનો કષ્ય કરેલો. પણ કર્મક્ષય માટે જરૂરી છે માનસિક સ્વસ્થતા. માનસિક સ્વસ્થતા-સમાધિ કોઈપણ સંયોગોમાં ટકાવી શકવું એ કર્મક્ષયની પ્રાથમિક જરૂરિયાત છે. અને જો તે કેળવાઈ નથી તો ઉપદ્રવવાળા સ્થાને જવું ન જોઈએ. માટે ભગવાને પ્રાથમિક કક્ષાના જીવોને પ્રતિકુળ અર્થાત્ ઉપદ્રવવાળા સ્થાને ન જવાનો ઉપદેશ આપ્યો છે. ઉપદ્રવ અર્થાત્ આફિત. જ્યાં જવાથી મુસીબત થવાની શક્યતા હોય ત્યાં ન જવું જોઈએ. ઘરની આસપાસ જો ચોર લોકો વસતા હોય તો તેવા ઘરને પણ ઉપદ્રવવાળું સ્થાન કહેવાય. તેને તજવું જોઈએ. જે ચીજનો વપરાશ આપણા માટે નુકશાન કારક હોય તે ચીજવસ્તુનો વપરાશ પણ તજવો જોઈએ. દાત. બજારુ ખાદ્યપદાર્થ. ગુણવત્તાની દસ્તિએ બજારુ ચીજો ખૂબ નીચલા સ્તરની હોય છે. એ હકીકત છે. તો તેવી વસ્તુ ખાવાથી શરીરને ઉપદ્રવ થશે જ ને? કોલસ્ટ્રોલ, ડાયાબિટિસ, બ્લડપ્રેશર આદિ બિમારીઓનું મૂળ બજારુ ખાદ્ય પદાર્થો જ છે. તો તે ત્યજવા જ જોઈએ. આજે માણસ પાપથી તો ડરતો નથી પણ મોતથી^૪ ય ડરતો નથી. આપું મોહુ ભરીને પડીકી ખાદ્ય રાખે એ પડીકી પર જ લખ્યું છે ‘આના સેવનથી કેન્સર થાય છે’ છતાં

બિન્દાસ બનીને માણસ ખાંધે રાખે છે. બીડી-સિંગરેટના ધૂમાડામાં જિંદગીના ૫-૨૫ વર્ષ ઉડી જાય છે છતાં'ય લોકો છોડતા નથી. અગર છૂટવું જ છે. તો ઘણા રસ્તા છે. દા.ત. દર અઠવાડિયે ૧-૧ ઓછી કરો વિગેરે પણ જેને પરી જ નથી તેને શું ? અરે આ શરીરને ઉપદ્રવ કરનાર છે તો તેનો ત્યાગ શા માટે નથી કરતા ? ‘આદત સે મજબૂર હૈ’ એ તો નિર્ભળ અને નીચી કક્ષાના માણસોની વિચારધારા છે. શૂરવીર અને સારા માણસો તો ખોટું છે એટલું સમજે એટલે છોડી દેવાના વિચારને અને આચારને અપનાવે. તમે કેવા છો એ જાતે જ નક્કી કરજો. અહીં ઉપદ્રવવાળા સ્થાનને તજવું એ ગુણનો ગંભીર અર્થ એમ પણ નિકળે કે જ્યાં સંસ્કાર ઉપર ઉપદ્રવ થાય તેવા સ્થાન પણ તજવા. દા.ત. નવરાત્રિ એક ધાર્મિક તહેવાર છે એવું કહેવું પણ હવે ધાર્મિક વક્તિને શોભે તેવું નથી રહ્યું. ત્યાંની ખુલ્લેઆમ થતી દુષ્પ પ્રવૃત્તિઓ આપણી આંખો અભડાવે તેવી હોય છે. તેવી જ રીતે કોલેજ કેમ્પસો, સિનેમા ગૃહો, ઉંડ ડિસેમ્બરના રંગ-રાગ આદિ પણ મર્યાદાવિહિન જ હોય છે. સજજનવ્યક્તિ માટે આ તમામ સ્થાનો સંસ્કાર પર ઉપદ્રવ કરનારા છે. જે દેશમાં મર્યાદા એક સંભાનનો અને પાલનનો વિષય ગણાતો હોય ત્યાં તે ‘મર્યાદા’ નામના અમૂલ્ય તત્વ પર ઉપદ્રવ કરનારા તત્વોને દૂર હટાવવા આપણે પુરુષાર્થ કરવો જ જોઈએ. પણ હાલ, જેની શક્તિ ન હોય તેણે તો માત્ર બચતા-બચતા દૂર રહેવું જ સલામત છે. એ જ રીતે આજે ભણતર કે પૈસો કમાવાના બહાને વિદેશની ધરતી પર જવાનો પ્રવાહ પણ વધે છે. વિદેશની ધરતી પર તો આપણને બાહ્ય-આંતર બસે પ્રકારે ઉપદ્રવ થવાની પૂરી શક્યતા છે. મારા-મારી કે ખૂન ત્યાં મોટી વાત નથી. વિદેશીને નાના શુના હેઠળ પણ પકડીને જેલમાં પૂરવા ત્યાં ઘણીવાર બનતી ઘટના છે. અને એનાથી બચી શકાય પણ આંતર ઉપદ્રવ આપણી શ્રદ્ધા, આપણી ભક્તિ, આપણી સંસ્કૃતિ તો ત્યાં હણાય જ છે. ત્યાં મંદિરો ખૂબ દૂર છે. સંતોના સત્સંગ દુર્લભ છે. ત્યાં માનવતાની અમુક પ્રકારની બાબતો ચોક્કસ છે. પણ જે બાબતો આપણને વિશેષ જરૂરી છે. તે ત્યાં નથી જ. આહાર શુદ્ધ પણ ત્યાં જાળવવી કર્પરી છે. જ્યાં બધુ જ આત્મધન લુંટાય છે. ત્યાં પૈસા કમાવા કે ભણવા જવું જ અયોગ્ય છે. કદાચ જવું જ પડે તો પણ કાયમી સ્થિર રહેવું તો નિતાંત અયોગ્ય છે. સામે છેઠે જે ઉપદ્રવથી બચાવે ત્યાં વધુ સમય ગાળવો જોઈએ. સામાજિક સેવાભાવી સંસ્થાઓ, આસ્થાના આલંબન

સમા મંદિરો, સેંકડોના જીવન બદલતી ધર્મ-કથાઓ આ બધાનો રંગ માત્ર પરભવ



સુધારવા નહીં. અહીયા પણ સાત્વિક આનંદની પ્રાપ્તિ આપનાર છે. આવા સ્થાનોમાં અવર-જવર કરવાથી સજજન વ્યક્તિઓ સાથે સંબંધ બધાય છે. સજજનની સંગત ખરાબ કામ કરતા અટકાવે છે માટે પાપકાર્યોથી સહજ પણે બચી જવાય છે. માટે જ તમે સૌ બાધ્ય-અત્યંતર ઉપદ્રવ કરતા સ્થાનો ત્યાગ કરી સુખી બનો.

ગુટખાની ઉધ્યેથી જડબામાં કેન્સરનો સડો

ગુટાખામાં રહેતું ખૂટાજન માત્રાસની સુપારવા પાત્રકાંગેન અનિયાંત્રિત કેન્દ્રરમાં બદલ
નાંથી ૧૫૭૮ માં વિભાગ્ન ૩૦૦ કરોડનાં માટેટાંબાં ૧૦૦૦ કરોડનાં એઠ ગંયણે

Page 2 of 2

દેવાયં પુનઃ જાપાણી કંગાતો રખમણું
જાર્દેની કિસ્કારી અનુભૂતિ બાંધીન. હું જ મારું
દેશ વિષાઢાં. તેનું માણસ-નાથું એ તે બાંધું

ମୁଦ୍ରଣ କାର୍ଯ୍ୟ

१. वार्षिक बहुत कम हो तो वा वार्षिक
भूर्जप्रधान एवं प्रधान सभी हो तो वा उन्हें
बहुत अधिकार मिल दें। वा वार्षिक भूर्जप्रधान
सभीकारी वार्षिक भूर्जप्रधान कलिकारी वार्षिक
भूर्जप्रधान हों।

તમારું નાં ઘાતક તત્ત્વો

- जनसंख्या - दुनिया का सबसे बड़ा देश है।
 - भारतीय लोगों की जनसंख्या दुनिया की दूसरी सबसे अधिक है।
 - भारत में जनसंख्या वृद्धि दर दुनिया की सबसे अधिक है।
 - भारत में जनसंख्या वृद्धि दर सबसे अधिक वर्षों में रही है।
 - भारत में जनसंख्या वृद्धि दर सबसे अधिक वर्षों में रही है।

ਸੁਖਨੀ ਸੀਡੀ

93


લોક ગાહિત કાર્યોનો ત્યાગ

જન્મ અને મૃત્યુ આ બે ઘટના એવી છે કે જેમાંથી આપણાને એક દુનિયારૂપી રંગભૂમિ પર લાવે છે. અને બીજી દૂર હડસેલે છે. આ દુનિયાની રંગભૂમિ પર આવ્યા બાદ મનુષ્ય કેવો ખેલ કરે છે તેના પર દુનિયાના લોકો તેની પ્રશંસા કે નિંદા કરે છે. કેટલાક સારા કાર્યો દ્વારા પ્રશંસા પામે છે અને કેટલાક દુષ્કૃતોની વણજીર ચલાવી નિંદા પામે છે. અને માટે જ આપણી પ્રશંસાપ્રિય માનવ-જાતને સુખી બનવાના પ્રાથમિક ૧૧ માં ગુણ તરીકે શ્રમણ ભગવાન મહાવીર જણાવે છે કે લોક ગર્હિત કાર્યોનો ત્યાગ કરવો. જે કાર્યથી તમારી લોકમાં નિંદા થાય તેવું કાર્ય કદાપિ ન કરવું. પ્રત્યક્ષ જ દુઃખી કરે તેવી વાત છે લોક નિંદિત કાર્ય કરવું તે. અને લોકો દ્વારા પ્રશંસા થાય તે પ્રત્યક્ષ જ સુખી કરનારી વાત છે. પણ આજના લોકો માટે એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે કે ધર્મસ્ય ફલમિચ્છન્તિ ધર્મ નેચ્છન્તિ માનવા : । પાપસ્ય ફલં નેચ્છન્તિ, પાપ કુર્વન્તિ માનવા : । માણસો ધર્મનું ફળ અર્થાત્ સુખ તો ઈથે જ છે. પણ ધર્મની કરણીને ઈચ્છતા નથી. જ્યારે પાપના ફળ રૂપ દુઃખને કદાપિ ઈચ્છતા નથી પણ પાપ તો કર્યે જ રાખે છે. અગર આંબાની કેરી ઈચ્છો છો તો બાવળના બીજ શા માટે વાવો છો ? અને બાવળના બીજ વાવો છો તો આંબાની આશા રાખવાની મૂખ્યમાં કેમ કરો છો ? જેવું આપો તેવું મળે. તમે ગાળ બોલો અને પેલો તમને ગાળ ન બોલે એવું બનતું હશે ? અરે ! જરા ઉંખુ વિચારો કે પેલી વ્યક્તિ તમારા માટે ઘસાતું બોલે અને તમે તેના માટે ઘસાતું ન બોલો તેવું બન્યુ છે ? અર્થાત્ આપણા દ્વારા કરાતું ખોટુ કામ સમાજ વખોડે જ છે અને સમાજ દ્વારા થતી આપણી નિંદા આપણા દુઃખનું કારણ બને છે. અને માટે જ લોક ગર્હિત કાર્યો કરવા એ દુઃખનો માર્ગ છે. માટે તેનો ત્યાગ કરવો જોઈએ. લોક ગર્હિત કાર્યોમાં માત્ર ચોરી, લંટ, ખૂન, મારા-

ਸੁਖਨੀ ਸੀਰੀ

મારી જ નથી આવતી પરંતુ તમારા દ્વારા કરાતી ડગલાબંધ પ્રવૃત્તિ એવી છે કે જે લોક
 ગર્હિત અર્થાત્ નીંદનીય છે. દા.ત. તમે રોંગ સાઈડ ગાડી ચલાવો છો તો તે પણ
 અયોગ્ય છે. તમે કોઈ ગરીબને ચૂસીને પૈસો કમાઓ છો તો પણ તે નીંદનીય છે. તમે
 તમારા પરિવાર માટે સમય નથી ફાળવતા એ પણ અયોગ્ય છે. તમે કોઈ ગરીબ તમારી
 સામે હાથ લાંબો કરે ત્યારે કાંઈ નથી આપતા તો તે પણ ધરાર ખોટું છે. ઘરમાં પોતાનું
 કામ પણ જાતે ન કરવાની અને ઓર્ડરો ફાડવાની ટેવ પણ કુટેવ જ છે. આ તમામ
 વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. તમે ખુદ શાંતિથી, સ્વસ્થ મનથી, જરાક નિરાંત કાઢીને
 વિચારો કે રોંગ સાઈડ ગાડી ચલાવવી એ ગુનો નથી લાગતો? એનાથી તમને અને
 બીજાને નુકશાન નહીં થાય? અને પોલિસ હોય કે ન હોય સાચી દિશામાં ગાડી
 ચલાવવામાં તમને કાંઈ મોટો ફરક પડવાનો છે? ના ... જરાય નહીં તો આવી રીતે
 કાનૂન ભંગ શા માટે? તમારી હુકાને ગરીબો પાસેથી તગડો નફો ન લો તો તમે ભૂખે
 મરશો? જરા'ય નહીં. તો શું તમારા ઘર-ગાડી લુંટાઈ જશે? ના એ પણ નહીં થાય તો
 પછી માત્ર થોડા રૂપિયાના મોહમાં ગરીબોને ચૂસવાની હલકી વૃત્તિના ભોગ શા માટે
 બનો છો? તમે પૈસો કમાઓ છો તે તમારા અને તમારા પરિવારના સુખ માટે જ ને ???
 (તમે કાંઈ દાનેશ્વરી કણ્ણ તો નથી જ !!!) તો પૈસો કમાવાની લ્હાયમાં રાત્રે ૦॥૧. પણ
 પુત્ર પરિવારને માટે ન ફાળવીને તેમની અસંતુષ્ટતા શા માટે વહોરો છો? તમને એમ
 થશે કે દરેક પોત-પોતાની મસ્તીમાં છે. કયાં ઘરમાં કોઈ અસંતુષ્ટ છે? પણ ના. પુત્રના
 લગ્ન પછી આ અસંતુષ્ટતાઓ બહાર આવે છે. જ્યારે આપણે યૌવનમાં પૈસા ધેલા
 બનીએ છીએ ત્યારે વારસામાં એ જ વસ્તુ પુત્રને મળે છે. માટે આ પણ લોક ગર્હિત ચીજ
 છે. ભારતના કોઈપણ શહેર-નગર-ગામમાં તમે ફરો તો ગરીબ પ્રજા તો જોવા મળે જ.
 આ ગરીબી માનવસર્જિત છે. કુદરતી નથી. પણ હાલ એ ચર્ચા નથી કરવી. આપણે
 એટલું વિચારવું છે કે જ્યારે કોઈ માનવ આપણી પાસે પેટનો ખાડો પૂરવા ભીખ માંગે છે
 કે ફાટેલા વસ્ત્રમાં ઠંડીમાં દઢરે છે ત્યારે તમે હોટલોમાં મજેથી ખાઈ કેવી રીતે શકો છો?
 શું હોટલની ખુરશીમાં કોળિયો ભરતા પૂર્વે એ માસૂમ ભૂખ્યા બાળનો ચહેરો યાદ પણ
 નથી આવતો. એ વ્યક્તિ પૈસા ખોટી જગ્યાએ વેડફશે તેવો ડર તમને હોય તો યોગ્ય
 ખાદ્ય-પદાર્થ તેને આપો કે પહેરવા માટે સાદા કપડા અપાવો. આવું કાંઈપણ આખ્યા

વિના તેનો હાથ ઠેલવો કાંઈ તમારા જેવા સજજનને શોભે ખરુ ? બીજુ વાત ઘરમાં ખુદનું કામ તો જાતે કરો. ઝગડાનું મૂળ ક્યારેક (ના ... ધણીવાર !!) તમારી આણસ જ બને છે. તો તે છોડો. આવી તમારા જીવનમાં ધણી બાબતો હશે જેનાથી તમારી સાથે સંપર્કમાં આવનારે હુઃખી થવું પડે છે, આ બધું અને આવી અન્ય પણ બાબતો જે સામાન્ય દુનિયા પણ અયોગ્ય માને છે. તેટલું તો મન મક્કમ કરીને છોડતું જ જોઈએ. આ સુખી થવાનો નેશનલ હાઈવે છે. લોક-ગર્હિત કાર્યોના ત્યાગનો આ ગુણ પ્રગટાવી તમે સુખી બનો.



તકરાર થઈ ગઈ હોય તો એકરાર કરીલો
પણ વર્થ વિચાર કરીને ભવિષ્ય બગાડશો નહીં.



શોપિંગ એ સામ્રાત સમયની અને ખાસ કરીને મહિલા મંડળની આવશ્યકતા નહીં પણ (કુ) આદત છે. આકર્ષક જાહેરાતો કરીને કંપનીઓ ઢગલાબંધ કર્યા આપકા ઘરમાં પથરાવી જાય છે. જેના બદલામાં કરોડો નહીં અબજો રૂપિયા વિદેશ ભેગા કરે છે. આખર ... આપણું અર્થતંત્ર તૂટે છે. નાના માણસો શોખાય છે. અને આ વિષમતા ચૂરવા માટે જ શ્રી શ્રમજા ભગવાન મહાવીરે બારમો ગુણ બતાવ્યો છે આવક પ્રમાણે ખર્ચ કરવો. આપણે ત્યાં હાલ શિર્ષસન છે. પહેલા ખર્ચો નક્કી થાય મહિનામાં આટલો ખર્ચો થાય છે. ગમે તેમ કરીને આટલા રૂપિયા બજારમાંથી કમાવાના. આ લક્ષ બાંધીને તમે બજારે જાઓ છો. એટલું જ નહીં. તમામ વેપારી આ લક્ષ બાંધીને જ આવે છે. પરીક્ષામે સર્જય છે. અનિતિ, હલકી ગુણવત્તા આદિ દૃષ્ટાંતો. કારણ કે સાચા રસ્તે તો તમને જરૂરી પૈસા ન મળે અને તમારે તો નક્કી જ છે ગમે તે ભોગે આટલા પૈસા જોઈએ. પછી એ નીચો રસ્તો જ આચરવો પડે ને? અર્થાતું આજનાં લોકો (તમારા સહિતના !!) ખર્ચ મુજબ આવક કરવાનું સૂત્ર અપનાવે છે. અને યાદ રાખો, જે આ જ પરંપરા ચાલશે તો નિશ્ચિત છે કે તમારા પર દુઃખ જ વધશે. કારણકે જ્યારે તમે આ રીતે હલકો માલ કે વધુ પૈસા, ઓછો માલ આવી અનિતિ કરો છો ત્યારે ગ્રાહક એક વાર છેતરાય, બે વાર છેતરાય આખર સમજીને પોતાની જાતે દુકાન બદલશે. અને કયાં સુધી તમે આ રીતે ખર્ચને પહોંચવા પૈસો વધારવા મહેનત કરશો? કારણ ખર્ચી તો જરૂરિયાતની ચીજવસ્તુમાં સિમિત નથી. સુવિધાની ચીજવસ્તુ સુધી અને સ્ટેટ્સની ચીજવસ્તુ સુધી પણ વિસ્તરાય છે. અને એ રીતે તમારા ખર્ચનું (બિનજરૂરી !) બિલ હ આંકડા વટાવતા'ય વાર નહીં લગાડે. જે તમારા માટે આ મંદીમાં કમાવું અધરુ છે. અને આ લક્ષ સિદ્ધ નહીં થાય તો તમે અને તમારો પરિવાર દુઃખી થશે જ. તમે

તમારા દિકરાને પૈસાની સુવિધાના કારણે દર વર્ષે અમુક કપડા, રમકડા કે અન્ય ચીજે અપાવો જ છો. પછી અમુક વર્ષે એ ન અપાવી શકો તો એને દુઃખ થાય. અને અપાવવાની તમારી શક્તિ ન હોય. આખર પારિવારિક પ્રિતિ ઘટે અને કલહ પેદા થાય. આનું મૂળ છે તમે ખર્ચ પ્રમાણે આવક કરવાનું ગાંડપણ કર્યું તે. આના બદલે વિચારો કે આપણી આવક ૫૦૦૦ રૂ. જ છે. તેમાં કેવી રીતે જીવાય ? એનું આયોજન કરો અને પૈસા વધે તો ભલે અન્ય ખર્ચ કરો પણ પૈસા નથી તો જેટલા છે તેટલામાં જીવવાનો પ્રયત્ન તો કરો. રવિવારે હોટલ બંધ, પર્સનલ સ્કૂટર આદિ છોડીને સરકારી વાહન વાપરો. અરે ! વસ્ત્ર સાદા વાપરો, ફોન-મોબાઈલનો ઉપયોગ ઘટાડો, તો ઢગલા-બંધ ખર્ચ ઘટી જશે. આજે ટૂથપેસ્ટ કંપનીઓ ૧૫૦૦ કરોડથી વધુનું ટર્નઓવર ધરાવે છે. ૧૦૦ વર્ષ પૂર્વે આમાંથી એક પણ રૂપિયો તે માર્ગ નહોંઠો જતો. આજે પણ દાટાડ કરતા સુપરશક્તિશાળી એકપણ ટૂથપેસ્ટ નથી. તો વર્ષ ૭૦૦ રૂ. (ઓછામાં ઓછા) ટૂથપેસ્ટમાં શા માટે વેડફો છો ? આજે માત્ર અમદાવાદ શહેરનું ડેનિક (પ્રતિદિન મોબાઈલ બિલ ૧૦૦૦૦૦૦૦ (એક કરોડ!!!) રૂ. છે. અર્થાત્ પ્રતિવર્ષ ૩૬૦,૦૦,૦૦,૦૦૦ (ત્રણસો સાઈઠ કરોડ !!) રૂપિયા માત્ર ગુજરાતનું એક જ શહેર મોબાઈલ પાછળ વેડફો છે. જેમાંથી ૮૦ % બિનજરૂરી વાતો હોય છે. તો આ બાબત પર કંન્ટ્રોલ ન મૂકી શકાય ? અનાજની ખરીદી આસ-પાસના ગામડામાંથી કરાય કે શાકભાજ માર્કેટયાઈમાંથી ખરીદાય તો કેટલો ફરક પડે ? આ બધું કહેવાનો ઉદેશ તમારો ખર્ચ ઘટે તો તમે અનીતિથી અટકો તે છે. અર્થાત્ આ જાણી-આચરીને તમારે સજજન બનાવાનું છે. અનીતિનો માર્ગ છોડવાનો છે. અને આખર પૈસો તો કાયમ ટકવાનો નથી જ. ગમે તેટલી બુદ્ધિ ધરાવતા હો કે કુશળ મેનેજમેન્ટ ધરાવતા હો પૂછ્ય પરવારે પૈસો તમને છોડીને ચાલ્યો જશે. અને પૈસો જો નહી જાય તો તમારે પૈસો છોડીને પરલોક ભેગા થવું પડશે. અર્થાત્ ગમે તે ભોગે ધન સાથેની માનવીની મિત્રતા શાશ્વત તો નથી જ રહેવાની (લક્ષ્ણિને ચંચળ એમ ને એમ થોડી કીધી છે ?) તે છૂટે જ છૂટકો. અને પૈસો હોય ત્યારે આપણે સુખી અને પૈસો ઘટે એટલે દુઃખી આવું શી રીતે ચાલે ? શું ૧૧૦ કરોડની ભારતીય વસ્તી સંપૂર્ણ શ્રીમંત બની જાય એ કદાપિ શક્ય છે ? ના, નથી જ. તો પૈસા વિના પણ મસ્તીમાં રહેતા શીખી જવું એ ડહાપણ ભર્યું નથી લાગતું ? તમે પરિવાર

સાથે કયાંક શાંત સ્થળે ફરવા જાઓ કે સંતપુરુષોના મુખે સત્તસંગ સાંભળો. કોઈ સરસ ભજન સાંભળો કે સારુ લાઈબ્રેરીમાંથી લાવીને પુસ્તક વાંચો સવારે યોગ કરો કે સવારે ચાલવા જાઓ કે બાળક સાથે રમો. આ બધામાં ખર્ચ વિના આનંદ મળો છે. જિંદગીમાં ખર્ચ મુજબ આવક નહીં પણ આવક મુજબ ખર્ચ કરવાના સિદ્ધાંતને અપનાવશો તો દુઃખી થવાના ઘણા રસ્તા બંધ થઈ જશે. આ જ વાત તમારી નવી પેઢીને'ય સમજાવો અને આ ગુણને જીવનમાં ઉતારી સુખી બનો.

એવું ક્યારેય ન માનતા
કે તમને જે કાંઈ મળ્યું છે તે
તમારી આવકત હોશીયારી
કે ચાલાકીથી મળ્યું છે.
નજર દોડાવશો તો તમારા જેવા
હોશીયાર લોકો ઘણાં દેખાશો
જેમને આ બદ્યું નથી મળ્યું.

તમે નહીં ખર્યેલા
કૃપિયાના તમે
ચોકીદાર માત્ર છો,
માલિક નહીં.




۹۴

સંપત્તિને છાજે તેવો વેશ પહેરવો

માણસ પોતાની પાસે જે છે તે જગતને દેખાડવાનો મોહ છોડી શકતો નથી. કારણકે સારુ દેખીને પ્રશંસા કરવી એ જગત આખામાં માન્ય બાબત છે. પણ આ કારણે પોતાનાથી અધિક સંપત્તિ લોકોની હરોળમાં આવવાની મૂખ્યાઈ કરીને હુંખી બનતા લોકોને શ્રમજ્ઞ ભગવાન મહાવીરે સુખી થવા ૧૩ મો ગુણ જણાવ્યો છે. સંપત્તિને છાજે તેવો વેશ ધારણ કરવો. માણસને સારા બનવા કરતા સારા દેખાવાનો મોહ વધુ હોય છે. સારા દેખાવું કાયમી શક્ય વાત નથી. પણ સારા થવું એ કાયમી શક્ય વાત છે. વસ્ત્ર એ દેહ ઢાંકવાનું સાધન છે. આ વાત સદા સર્વએ યાદ રાખવી. આજે વસ્ત્ર દ્વારા જ દેહ ઢાંકાય છે. પણ


દેહના કયા ભાગ ? કેવી રીતે ઢાંકવા ? બાબતે આપણે ત્યાં સમજણ હોવા છતાં અંધકાર છે. હકીકતમાં આપણે આ બાબતે આંખ આડા કાન કર્યા છે અને તેના મીઠાં નહિ પણ માઠા ફળો આપણે પણ ભોગવીએ છીએ. દુનિયા ગમે તેટલી આડા રસ્તે જાય, ભલે બધા દુર્જનતા તરફ બેંચાય પણ સારા, બુદ્ધિશાળી લોકો દેખાદેખી તરફ જ ધ્યાન આપતા નથી. (તમે એમાં ખરા ?) અને આજે પણ એવો વર્ગ છે. જે પોતાની સંસ્કૃતિ-સદગુણો આદિને વળગેલો રહેવા છતાં'ય આધુનિક યુવાશક્તિઓને આકર્ષી શકે છે. આ માટે રૂદ્ધિયુસ્તતાનું જરૂરાશાલ, અન્ય પર આપણી માન્યતા ઠોકી બેસાડવાની વૃત્તિનો ત્યાગ જરૂરી છે. જો એ છોડીએ અને યોગ્ય રીતે તાર્કિક રજુઆત

કરીએ તો બધા જ (આધુનિક સમાજ સહિતના) ભર્યદાસભર વસ્ત્રોની વાતને સ્વીકારે જ છે. અસ્તુ, હાલ આપણે વાત કરવી છે વસ્ત્રની પસંદગી કેવી કરવી? તમે જો ખૂબ ધનાઢ્ય છો તો સાવ સામાન્ય કહેવાય તેવા વસ્ત્રો ન પહેરવા જોઈએ. વસ્ત્રોમાં

તમારી સમ્પત્તિની સુગંધ માણી શકાય તે ગુનો નથી. શ્રીમંતાઈ, શેઠાઈ આદિ પણ નોકરો માટે ઉપકારકારી સ્થાન છે. અગર શેઠ ના હોય તો નોકરને ગુજરાન ચલાવવા વેતન આપે કોણ ? અને શેઠ પોતાનો મોતો જાળવવો હોય તો શ્રીમંતાઈને યોગ્ય વેશ પહેરવો જ જોઈએ. નોકર જેવો વેશ પહેરવાથી નોકર વર્ગ તેની માન-મર્યાદા જાળવવામાં ઉણા ઉત્તરે જ. આપણે ત્યાં પૂર્વે રાજા-મહારાજા નગરચયર્યા જોવા ગુપ્તવેશે નીકળતા હતા. આવા વખતે તેમનો વેશ સામાન્ય વ્યક્તિઓ જેવો જ રહેતો અને અન્ય લોકો દ્વારા તેમની માન-મર્યાદા ત્યારે ન જ જાળવતા. આજે પણ લશ્કરમાં મીલેટ્રી વેશમાં જનરલે કોઈ હુકમ કર્યો હોય તો તે હુકમ લેફ્ટેનન્ટ આદિ તમામ સેનાનીને માથે ચઢાવવો પડે. પણ તે હુકમને જનરલ સાદા વસ્ત્રમાં રદ ન કરી શકે. કા.કે. આ પ્રકારની સજજતા વિના લશ્કરી તંત્રમાં શિસ્ત ટકવી જ મુશ્કેલ છે. વસ્ત્રાનુરૂપ ભાવો માનવ મનમાં પેદા થાય છે એ સાવ સાદી સમજાય તેવી વાત છે. તમે કોઈ મેજર કે અફ્સરના વસ્ત્ર પહેરો તો લડાયકતા પ્રગટે જ. સૂટેડ-બૂટેડ તૈયાર થઈને તમે ભીખારીની માફક રસ્તા પર બેસી નહીં શકો. સંત પુરુષને જોતા આપણા હાથ જોડાઈ જાય છે તેમાં તેમનાં વસ્ત્રો જ ભાગ ભજવે છે. આ જ રીતે ગરીબ વ્યક્તિ કે મધ્યમ વ્યક્તિઓએ પણ બહુધા અનિવાર્ય કારણ વિના શ્રીમંત વેશના અભરખા ન કરવા. માનવને જીવવા માટે ભોજન અને વસ્ત્રની જરૂરિયાત છે પણ ભપકાની નથી. તમે ટૂંકી કમાણીમાંથી ભારે કપડાં ૧-૨-૩-૪ વાર લાવી શકશો આખર થાકશો. અને પછી સાદા વસ્ત્રો પહેરવા ભારે પડશે. અથવા પૂર્વે કણ્ણ તેમ ભારે કિમતના શ્રીમંતાઈને શોભે તેવા વસ્ત્રો પહેરવા માત્રથી તમારો હાથ ખર્ચ માટે છૂટો થતો જશે. કાપડના પ્રસિદ્ધ અને મોંઘા શો-રૂમ્સમાંથી ખરીદેલા વસ્ત્રો પહેરીને ચાની લારી પર ઉભા રહેવું નહીં ગમે સારી કોઇ હટ પર જ નજર મંડાશે. જમવા માટે સાદી હોટલ પસંદ નહીં પડે ૩ સ્ટાર કે ૫ સ્ટારની શોધ થશે. જે તમારી ટૂંકી આવકને માફક નહીં પડે. માટે સિંમ્પલ



એન્ડ શોભરની નીતિ અપનાવવી જ હિતાવહ છે. એ જ રીતે લગ્નાદિ પ્રસંગે પણ માંગીને લાવેલા ધરેણા પહેરીને જાત-પ્રદર્શન કરવા કરતા ‘મળ્યુ તેમાં સુખ’ માનવું ડાહ્યાનાભર્યું છે. તમે કેટલીવાર કોઈનું ઉછીનું માંગશો ? અને શું ઉછીની ચીજ તમે પહેરી છે એ જાણીને અન્ય પર તમારો પ્રભાવ પડશો ? એના બદલે પોતાની શક્તિ અનુસાર વસ્ત્ર પરિધાન દ્વારા સમાજમાં સાત્ત્વિક વ્યક્તિ તરીકે જીવી જાણવું શું ખોટું ? અર્થાત્ સંપત્તિને છાજે તેવો વેશ પહેરવાથી તમારું ભલુ થશે. આ વાત જીવનમાં ઉતારી સુખી બનો.



**Is it looking good that a beggar
is giving lecture at auditorium**


٩٥

બુદ્ધિના આઠ ગુણવાળા થતું


માણસનો વિકાસ પુણ્યના અર્થાત્ નસીબના આધારે થાય છે. એ વાત સાવદરી જ છે પણ એ વાત પણ ભૂલવી ન જોઈએ કે બુદ્ધિ અને પુરુષાર્થ આપણા નસીબને વધુ તેજસ્વી બનાવી શકે છે. શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવાના ચૌદમા ગુણમાં કહ્યું છે કે બુદ્ધિના આઠ ગુણવાળા થવું. (બુદ્ધિ હોય તેને !!!) બુદ્ધિના આઠ ગુણવાળા બનવામાં પ્રથમ ગુણ છે (૧) સારી અને ઉપયોગી વાતો સાંભળાની ઈચ્છા રાખવી. આપણે ત્યાં કિકેટ અને સિનેમા બે ખરાબ અને નિરૂપયોગી ચીજ પાછળ જ સમય વેડફાય છે. છાપાની આ કોલમ સારી અને ઉપયોગી છે એ સાબિત કરવા એકે'ય તર્ક જરૂરી નથી. આ વાત સહજ સિદ્ધ છે પણ તમારી નજર પહેલી ક્યાં જાય? ક્યાં? કેટલા? મર્યા? આ જ જોવા છાપાના પૈસા બર્ચોને ??? ટૂંકમાં આ ગુણ કેળવવા યત્ન કરવો પડે. (૨) તે બાબતો બરાબર સાંભળો. આપણને એકવાર જોયેલી ફિલ્મ-સ્ટોરી ટોટલ બે વર્ષ પછી'યે યાદ હોય પણ કથામાં સંત-વાણી જાજમ પરથી ઉભા થતા જ ધૂળ ભેગી ખંખેરાઈ જાય. આ કુટેવ છે. સારી-ઉપયોગી વાતો ધાનપૂર્વક સાંભળવાની પ્રયત્નપૂર્વક ટેવ પાડવી જોઈએ. (૩) સાંભળીને બરાબર ઠસાવી દે. જે યત્નપૂર્વક સાંભળ્યું છે તે વાત મૂલ્યવાન છે એમ મનને આદેશપૂર્વક કહેવું ન પડે તમે સાંભળવામાં યત્ન કર્યો અર્થાત્ જરૂરી છે એમ મન સમજ જ જરો પણ. તે વાત મનમાં ઠસાવી દેવી જોઈએ અર્થાત્ આ યાદ રાખવાનું છે એમ મનને હુકમ કરી દેવો જોઈએ. (૪) મનમાં યાદ રાખો. આટલેથી કામ પતતું નથી. હાથમાં મોબાઇલ કે કાગળ નથી અને કોઈ અગત્યનો નંબર યાદ રાખવો હોય તો શું કરો ઘર સુધી જતા બીજો વિચાર કર્યા વગર ગોઝ્યા કરીએ દા.ત. ૨૨૬૭૪૧૪૧ હોય તો ઘરે જતા સુધીમાં ઢગલોવાર એ ગણગણી ચુકાયો હોય એમ જે સારી અને જીવનમાં ઉપયોગી બાબત છે

એ મનમાં ફરી-ફરી યાદ કરવી જોઈએ. (૫) તેની આસ-પાસની વસ્તુ સ્થિતિનો વિચાર કરે. અર્થાત્ જે વાત સાંભળી છે તેની બાબતમાં કેવા સંજોગમાં કેવા લોકોની વચ્ચે આ બાબતનો અમલ કેવી રીતે થઈ શકે એ વિચારે. દા.ત. મંદિર દર્શન કરવા જવું. તો આ વાત સૂતકના દિવસોમાં જુદી રીતે વિચારાય. સાવ નાસ્તિકો સાથે રહેતી વખતે જુદી રીતે વિચારાય એ બધું એકવાર વિચારતા થાઓ એટલે સૂજવા જ માટે અને ન સૂઝે તો કોઈ ડાખા માણસની સલાહ લેવાય. પણ પહેલા આ બાબતે મનમાં વિચાર કરતા થવું એ જ મહત્વનું છે. (૬) લાભા-લાભનો વિચાર કરે. મને આ સારુ અને ઉપયોગી કાર્ય કરવાથી શું લાભ થશે? અને શું નુકશાન થશે? એ વિચારે. દા.ત. કોઈ રાજકીય પણ સમાજને માટે અયોગ્ય નિર્જયનો વિરોધ કરવામાં આગેવાની લેવી હોય ત્યારે એ વાત સારી છે અને ઉપયોગી પણ છે. ત્યારે વિચાર કરવો કે આનાથી શું જાનનું જોખમ થાય તેવી પરિસ્થિતિ ઉભી થશે? અને જો હા, તો આ બાબત એટલી બધી ખરાબ છે કે જેને દૂર હંટાવવા જાનનું જોખમ બેડવું પડે? આદિ બાબતો વિચારીને પછી. (૭) તેનો સાર કાઢે. મતલબ આ બાબતો ચોક્કસ પણે ગંભીર છે પણ જાનના જોખમ જેટલું આગળ વધવા જેવું નથી. કે ના, આમાં મરી ફીટવું જોઈએ. આદિ સાર કાઢે. વળી સાર કાઢતી વખતે મનમાં નિર્બણતાથી ઢીલ પણ ન દાખવે કે જન્મની બનીને આકમક બની જવાનું ગાંડપણ ન દાખવે. અને છેલ્લે (૮) તેનો અમલ કરવા યત્ન કરે. દા.ત. જો રાજકીય વિરોધ અત્યાવશ્યક છે તો ખૂબ જ આકમક બનીને તૂટી પડતા વાર ન કરે. અથવા મોટા સંગઠનો જાગૃત કરીને તેમાં સહુને જોડવા આદિમાં ઢીલાશ દાખવ્યા વિના કે મોતનો ડર રાખ્યા વિના શૂરવીર બનીને કામ કરે. અસ્તુ. પણ આ આઠ ગુણ તેઓ માટે જ છે. જેનામાં બુદ્ધિ હોય. અને સન્માર્ગે બુદ્ધિ વાપરવાની ઈચ્છા હોય. બાકી, દુનિયાને ચૂસીને પૈસા કમાવાના એક જ દુર્માર્ગે બુદ્ધિ વાપરનારા માટે આ વાત જરા'ય જરૂરી નથી. હકીકતમાં આ બુદ્ધિના આઠ ગુણનું પ્રગટીકરણ તમારા સ્વર્ણ-સુખી અને સમૃદ્ધ જીવનનો પાયો છે. અગર તમે ધંધામાં આ બાબતો કમથી વિચારશો તો ધંધો-વ્યાપાર જરૂર વધશે જ. અગર ધરમાં થતી રોજિંદી કચ-કચમાં આ વાત વિચારવાનું શરૂ કરો તમારા ધરમાં ખૂબ જ શાંતિ છવાયેલી રહેશે. સાવ નાની બાબત કે 'શાક તમે લાવો કે હું લાવું'. જેવામાં'ય વાત છૂટાછેડા સુધી વણસે છે. ત્યારે આ બાબતોને યાદ

રાખી જીવનમાં ઉતારવાની જરૂર છે. અરે ! ઘર અને ધંધા સિવાય તમે કયાંય કાઈ કામ કરો છો કે એ સિવાય આ આઠગુણાની તમારે જરૂર પડે ! હકીકતમાં આપણા સમાજ, ધર્મ, ગામ, દેશ માટેના કાર્યમાં ખાત્ર વાતો કરવા સુધીની નહી પણ કાર્ય કરવા સુધીની સેવા આપવી જોઈએ તો જ આપણો સાચા અર્થમાં વિકાસ થશે. અને આ તમામ કાર્યમાં બુદ્ધિના આઠેંય ગુણોનો યોગ્ય ઉપયોગ કરી સુખી બનો.



Thinking
is free.
Do more
of it.



૧૭

નિત્ય ધર્મનું શ્રવણ કરવું

oo

આત્મા, પરમાત્મા, મોક્ષ આ બધી વાતો ભારતના પ્રત્યેક માનવને ગળથૂથીમાં જ મળેલી હોય છે. નાના બાળકોને આ વાતો ઘોડિયામાં જ સાંભળવા મળે છે પણ આ તમામ વાતોની સત્યતા સંતોના સત્સંગથી જ પામી શકાય છે. અને આ બાબતોને શ્રદ્ધા અને બુદ્ધિ બગેના બળે સમજવા માટે શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવાના પંદરમાં ગુણ તરીકે કહ્યું નિત્ય ધર્મનું શ્રવણ કરવું. આજના યુવાવર્ગમાં અને હવે તો બાળ-કિશોર વર્ગમાં પણ આત્મા જેવી સાવ સાચી વાતો પરથી શ્રદ્ધા ઉડી ગઈ હોય તેવું જોવા મળે છે. એક કોલેજના બાંકડે બેસીને કોઈ વાર ધર્મ બાબતે વાત નીકળો તો યુવાનો તરત કહે છે “કયાં છે આત્મા ? આત્મા દેખાતો તો નથી તો કેવી રીતે મનાય ? આ બધા લોકોને ઠગવાના ધંધા છે. અંધશ્રદ્ધા છે” અરે મૂરખ ! પણ તમે આ વાત શા માટે કોલેજ કેમ્પસમાં ચર્ચા છો. તમારામાંથી કોઈએ ધર્મશાસ્ત્રોનો ઠોસ અભ્યાસ કર્યો છે ? અરે ! કોઈ દા'ડો ધાર્મિક પુસ્તક હાથમાં લઈને ૦॥ ક. પણ વાંચ્યું છે ? નથી ને ? છતાં પણ માત્ર તમને આત્મા માટે શ્રદ્ધા નથી એટલે આત્મા નથી એવું થોડું મનાય ? હકીકતમાં તમારી માન્યતા જે હોય તે પણ આ આત્મા-પરમાત્માના વિષયની ચર્ચા કોઈ જ્ઞાની સંત-મહાત્મા સાથે કરો. જે વિષયમાં જે પ્રોફેસર નિષ્ણાત હોય તેની સાથે તે વિષયની ચર્ચા કરો તો સાચું જ્ઞાન મળે અને તમારી દલીલ, માન્યતા સાચી છે કે ખોટી એ તે વિષયના નિષ્ણાત સાથે ચર્ચા કરો તો સમજાય. માત્ર મિત્રો કે પ્રોફેસરો જેમને ભલે આખી દુનિયાનું જ્ઞાન હોય પણ ધર્મજ્ઞાનમાં મીઠું હોય તેની સાથે કરવાથી સત્ય હાથમાં કેવી રીતે આવે ? માટે જો તમે કદાગ્રહી ન હો, જો સાચું તાર્કિક રીતે પુરવાર થાય તો માનવાની તૈયારી હોય તો તમારી તમામ દલીલો જિજ્ઞાસા બુદ્ધિથી કોઈ જ્ઞાની-સંત પુરુષને જણાવવી જોઈએ. આત્મા-પરમાત્માના અસ્તિત્વ બાબતે

ધર્મશાસ્ત્રોમાં જગ્યાવાયેલ તર્કો (દિશાંતો) જાગ્યાવા જોઈએ. અને પછી સત્ય જે મળે તે ગ્રહણ કરવું જોઈએ. જો તમે એકાન્ત આગ્રહી કે ભોગવાદી માનસ નહી ધરાવતા હો અને તટસ્થ બુદ્ધિથી શાની સંત-પદ્ધતાનું સાનિધ્ય પામી આત્મતત્ત્વ નિષ્ઠય કરવા યત્ન કરશો તો જરૂર આત્મા-પરમાત્મા-મોક્ષ જેવા પદાર્થો છે જ એમ માની જશો. આમાં શંકા જ નથી. તમે એ બાબતોનો અભ્યાસ નથી કર્યો માટે તમને તે નથી તેવું લાગે છે. શું બીજા કે ત્રીજા ધોરણમાં ભણતો બાળક $x + y + y$ જેવા બીજગણિતના દાખલા ગડી શકે? અરે! ગણવાની વાત જવા દો. એ આ દાખલો સાચો પણ માને? એ એમ જ કહે કે સરવાળા તો અંકમાં જ થાય. x, y ના સરવાળા જ ન હોય પણ તમે આ માની કે સમજી શકો ને? કેમ? કારણ કે બીજગણિતની પ્રક્રિયા તમે સમજેલા છો. બસ, એમ આત્મ-પરમાત્માના અસ્તિત્વના તર્ક-દિશાંત જે સાંભળો-સમજે તે માની શકે. જેને સાંભળવું જ નથી એને સમજાવાય શી રીતે? આ બધા ગહન તત્વોનું શાન સત્તંગ અર્થાત્ ધર્મશ્રવણથી જ થાય છે. ધર્મશ્રવણ કરવાથી દુરાચારની વૃત્તિઓ સહેજે વિલય પામે છે. સદાચાર પાળવાની ઈચ્છા પ્રગટે જ છે. અને સદાચારી બનવાથી પુણ્ય વધે છે. પુણ્ય અર્થાત્ નસીબ તેજવંત બને તો સુખ-શાંતિ મળે એ સર્વગ્રાહ્ય વાત છે. માટે નિત્ય ધર્મશ્રવણએ સુખી બનવાનો રસ્તો છે. ધર્મશ્રવણ એ ટી.વી. પર નહી પર સંસારત્યાગી સંતોના સાનિધ્યમાં બેસીને કરવાથી જ તાત્ત્વિક લાભ થાય છે. જો સામે જ સંત-પુરુષ બેઠા હોય તો મનના સંશય પૂછી શકાય. અથવા જે સાંભળીએ છીએ એમાં જ સંસાર ભૂલીને તન્મય થઈ શકાય. ધરમાં ટી.વી. પર સાંભળતા કાંઈક કામ આવે કે ધરમાં કાંઈક વાતો થાય તો આપણી મનોદશા સંસારના કાર્યમાં પાછી જોતરાઈ જાય છે આ રીતે ધર્મ-શ્રવણ કરવાથી જોઈએ તેવો લાભ થતો નથી. માટે આમ, તો નિત્ય ધર્મશ્રવણ માટે આસ-પાસમાં જ્યાં કથા સત્તંગ થતા હોય ત્યાં સમયસર જવાની ટેવ પાડવી જોઈએ. કદાચ નિત્ય ન થાય તો'ય જ્યારે જ્યારે સંયોગ મળે કે આસ-પાસમાં સંસારત્યાગી સંત-પુરુષોના મુખેથી ધર્મશ્રવણ કરવાનો સમય મળે તો તુરંત તે લાભ ઉઠાવવા તત્પર રહેવું જોઈએ.

ધર્મશ્રવણ એ માનસિક શાંતિની અમોદ દવા છે તમે ધર્મમાં બિલકુલ ન માનતા હો તો પણ જો ડિપ્રેશનનો ભોગ બન્યા હો ત્યારે ડેક્ટરની દવાઓ ખાઈને પૈસા-શરીર

બજે બગાડવાના બદલે જો માત્ર ધર્મશ્રવણ કરીને સમયનો સહૃપયોગ કરો તો તમને સઘળા ટેન્શન, નિરાશાજનક વિચારોમાંથી મુક્તિ મળશે. આ સાવ સાચી અને ધણા લોકોના અનુભવની વાત છે. જો નિત્ય ધર્મશ્રવણનો લાભ ન મળી શકતો હોય તો ધરમાં સારા ધાર્મિક પુસ્તકો રાખીને સમય મળે તેનું વાંચન કરવું જોઈએ. ધર્મવાંચન એ ધર્મશ્રવણની જેમ સુખી કરનાર કિયા છે. પણ સંસાર-ત્યાગી સંતના મુખેથી ધર્મ-શ્રવણ જેટલું ઉત્કૃષ્ટ તો એકે'ય ધર્મકાર્ય નથી. કારણ કે જેટલા સત્કાર્ય દુનિયામાં થાય છે તેમાં ધર્મશ્રવણથી ઉત્પન્ન થયેલ સદ્ગ્રામભૂત છે. માટે નિત્ય ધર્મ-શ્રવણના ગુણને પ્રગટાવીને સુખી બનો.



અજીર્ણ ભોજન ન કરવું

માણસ પોતાની જુંદગીમાં મોજ-મજા માટેના ઠગલાબંધ રસ્તાઓ પર દોડે છે.
સારા કપડા, વિદેશયાત્રાઓ, શ્રીમંતાઈ, લોંગ ડ્રાઇવ, તોફાન-મસ્તીના અનેક પ્રદેશોમાં
માનવ-મન વિહેરે છે પણ આ બધા કરતાં'ય એક ચીજ પ્રત્યેક માનવને વધુ વ્હાલી હોય
છે. ચટાકેદાર ભોજન. અને આ જીબના ટેસ્ટની શુંખલા એટલે સુધી લંબાય છે કે તે
વ્યક્તિને લેબોરેટરી ટેસ્ટો કરાવવા પડે છે. આવી પરિસ્થિતિ હું:ખદાયી બને છે. અને
તેવું ન થાય તે માટે જ શ્રીમણભગવાન મહાવીરે સુખી થવાના ૧૬ માં
ગુણમાં કહ્યું અજિર્ણો ભોજનં ત્યાગઃ અજીર્ણમાં ભોજન ન કરવું.

કોઈપણ વ્યક્તિ ભૂખી થાય એટલે તેની કાર્યક્ષમતા ઘટે છે. અને તેવી જ રીતે વધુ પડતું ખાવાથી પણ કાર્યક્ષમતા ઘટે છે. કારણ કે વધુ પડતું ભોજન શરીરમાં ઘણા રોગો પેદા કરે છે. આજે ભારતની પ્રત્યેક વ્યક્તિ ક્યાં તો અતિપોષણથી પીડાય છે ક્યાં

તો અપોષણથી પીડાય છે. ટગલાબંધ લોકોને ખાવાના ફાંઝા હોય છે માટે અપોષણના કરણે મોતના મુખમાં ધકેલાય છે. તો સુખી સંપન્ન લોકો મર્યાદાબહાર જીભના ચટકા કરવાથી અનેક રોગોનો ભોગ બની મૃત્યુ સુધી ધકેલાય છે. ઇતાંથી આ બધુ જાણ્યા પછી પણ આજની પ્રજા એ જ જીભના ટેસ્ટ પાછળ ગાંડી બનીને ધૂમ્યા કરે છે. આજે લગભગ મોટાભાગના સ્કુલ-કોલેજના



સ્કુલન્ટ્સ ફાસ્ટફૂડનો નિયમિત આહાર કરે છે. હવે, વિચારો કે ૫-૧૫ દિવસ વાસી

હોટલના ભોજનમાં શું બેકટેરીયા ઉત્પન્ન નહીં થયા હોય ? અથવા આવા ગંદા પદાર્થો આરોગવાથી શરીર પર અસર નહીં થાય ? બેફામ મીઠાઈ ખાનારા ડાયેબિટીસના દર્દી બને પછી છંદગીબર મીઠાઈની વાદમાં જૂરવાનો વખત આવે છે તેના બદલે જીવનના અંત સુધી પ્રમાણસર મીઠાઈ ખાવાનો લ્હાવો શા માટે નથી લેતા ?આહારગ્રહણ એ દેહના રક્ષણ માટે છે. શરીરને પોષણ મળે તો એ આપણી ઈનિક કિયામાં સહાય થઈ શકે. જુબ માટે જ ખવાતા પદાર્થોમાં શારિરીક પોષણ આપનાર ચીજો લગભગ ન મળે. ચોકલેટ, ચ્યુંગમ, તળેલા નાસ્તા એ માત્ર દેહને બગાડનારા છે. છતાં'ય શાકાહારી પ્રજા અમુક મર્યાદામાં રહે છે. પણ માંસાહારી પ્રજા તો માંસાહાર દ્વારા એ હેઠે હુઃખી થાય છે કે જેની માંસાહાર કરનારને ખુદને'ય કલ્પના નથી હોતી. માંસ, દૂડ એ શરીરને પોષણ આપનાર છે એવો ભામક પ્રચાર સર્વત્ર વ્યાપેલો છે. પણ કેવી રીતે દૂડ પોષક છે ? ૧૦૦ ગ્રામ દૂડમાં પ્રોટીનનું પ્રમાણ માત્ર ૧૩.૩% છે. જ્યારે ૧૦૦ ગ્રામ ચણામાં ૨૪.૦૦% અને મગફળીમાં ૩૧.૫% પ્રોટીન છે. ૫૦ ગ્રામ દૂડમાં માત્ર ૮૩.૫ કેલરી છે. જ્યારે ૫૦ ગ્રામ ઘઉમાં ૧૭૬.૫ કેલરી છે. અર્થાત્ એકેય રીતે દૂડ શરીરને વધુ પોષણ આપનારા નથી. સામે છેદે પંખીના શરીરના રોગો દૂડમાં પ્રસરેલા હોય છે. જે બેકટેરીયા માંસાહારીના દેહમાં'ય પ્રસરે છે. કોલસ્ટ્રોલ અને મોટાપાની ગંભીર બીમારી માંસાહારીમાં વ્યાપક હોય છે. આથી જ માંસાહારનો ત્યાગ એ શરીર અને આત્મા બને માટે ફાયદાકારક છે. શાકાહારમાં પણ પોષણ આપનારા સાત્વિક પદાર્થો ભૂખ લાગે ત્યારે જ ખાવા જોઈએ. મેડિકલ સાયન્સમાં એક વાત પ્રસિદ્ધ છે કે એક સાથે લીધેલો ખોરાક હોજરી ૫-૬ કલાકમાં રસ-ક્સ છુટા પાડીને આંતરડા તરફ ધકેલે છે. હવે તમે વધુ આહાર લીધો હશે તો હોજરી ગમે-તેમ કરીને તે ખાયેલા આહારને બહાર (આંતરડા) તરફ કાઢી નાંખશો. અર્થાત્ ખોરાકનું યોગ્ય પાચન થશે નહીં. જો આ રીતે ખોરાકનું પાચન ન થાય તો તે અજીર્ણમાં પરીષેષણશે. જે પેટના રોગ, ઝડપ, કબજ્જ્યાત, તાવ આદિ રોગોનું કારણ બનશે. અને આવા રોગોમાં પણ લોકો એલોપેથી દવાના રવાડે ચડીને શરીરમાં જેર વધારવાનું કાર્ય જ કરતા હોય છે. હકીકતમાં અજીર્ણના રોગમાં કોઈ દવાની જરૂર નથી. અજીર્ણની દવા છે કાંઈ જ ન ખાવું. ખાવાનો ત્યાગ એ અજીર્ણના રોગની મોટામાં-મોટી દવા છે. જો ૨૪ કલાક જેટલું ભૂખ્યા રહો તો

અજ્જણના રોગમાંથી છૂટકારો મળી જ જાય. આનાથી દવાના પૈસા પણ બચશે. અને શરીર પણ સુધરશે. અજ્જણ વધુ ખાવાથી થાય છે માટે અકરાંતીયા બનીને કયાંક મફતનું ભળે એટલે ભોજન પર તૂટી પડવાની કુટેવ છોડવી જોઈએ. એ વખતે ભોજન પારકું છે પણ પેટ તો તમારું છે એ યાદ રાખવું જોઈએ. અને આ રીતે પ્રમાણસર જ ભોજન કરો તો અજ્જણના રોગનો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય. આ ઉપરાંત ગરમ પાણી પીવું, સૂયસ્ત પૂર્વે જમી લેવું, સવારે ચાલવા જવું, યોગાસન કરવા એ બધા જ સ્વાસ્થ્ય સુધારનારા ઋષિ-મુનિઓ દ્વારા કથિત ખર્ચ વિનાના ઉપાયો છે આવા ઉપાયોને અજમાવી સુખી બનો.



٩٤

યોગ્ય કાળે પદ્ધ્ય જમવું

વિશ્વની ૭૦૦ કરોડની વસ્તી આજે બજારમાં બે વસ્તુઓની ખરીદી કરે છે.
(૧) ભોગ સામગ્રીઓની (૨) ભોગ સામગ્રીના વપરાશથી થયેલા રોગ મટાડવાની. આ
બે જ પ્રકારની ચીજો જ બજારમાં વેંચાય છે. અને એમાં પણ આજની પ્રજા પેટ નહીં પણ
જુબ માટે જેટલો ખાદ્યસામગ્રી માટે ખર્ચ કરે છે તેટલો ઈતિહાસના કોઈ કાળે નહીં થયો
હોય ! અને માટે જ ઈતિહાસમાં કદ્દી ન થયા હોય તેટલા રોગોથી આજનું વિશ્વ પીડાતું
જોવા મળે છે. આ દુઃખમાંથી બચવા શ્રમણ ભગવાન મહાવીરે ૧૭ માં ગુણ
તરીકે ફરમાવ્યું કે “યોગ્ય કાળે પદ્ધ્ય જમવું” આજની પ્રજા ભગવાનનું કહ્યું
ન માને. પણ ડોક્ટરનું કહ્યું પરાણે માનવું પડે છે. આહારગ્રહણ એ આપણે માટે
સામાન્ય વાત બની ગઈ છે. પણ તમારી જિંદગીનો આધાર આહાર ગ્રહણ છે. શું
જિંદગીથી વધુ કિંમતિ બીજુ કાંઈ છે ? નહીં ને ??? તો જિંદગીની સ્વસ્થતા, સાત્ત્વિકતા
ટકાવી રાખવા, વૃષ્ણિગત કરવા માટે આહારગ્રહણની પદ્ધતિ જાણી-સમજ જીવનમાં શા
માટે નથી ઉતારતા ? વ્યક્તિ જ્યારે ખોરાક લે છે ત્યારે તેના મનમાં અધિરાઈ, કોધ,
લોભ આદિ દુર્ગુણોની ગટર વ્યક્તતૃપે વહેતી હોય તો એ વખતે લીધેલ આહાર શરીરમાં
જઈને રોગોત્પાદક થઈ શકે છે. કારણ કે તેવા આહારની અંદર નેગેટિવ ઉર્જા પ્રવેશી
ચૂકી હોય છે. એ શરીરમાં બગાડો કરે જ છે. અને આવા દૂષિત આહાર દ્વારા લોહી પણ
તેવું દૂષિત બનશે. તે દૂષિત લોહી બ્રેઇન સુધી પહોંચે છે ત્યારે દૂષિત વિચારોનું ઉત્પાદક
બને છે. આ વૈજ્ઞાનિક સત્ય છે. અને માટે જ ભોજન કરતાં પૂર્વે આપણે ત્યાં પ્રાર્થના
કરવાની સુમધુર પરંપરા હતી. જેનાથી મનના આવેગો શાંત થઈ જાય અને મન સ્વસ્થ
થાય. મનને સ્વસ્થ રાખીને લીધેલ આહારમાં પોઝિટીવ ઉર્જા ભળે છે. જે શરીરમાં
પોઝિટીવ એનર્જી કિએટ કરે છે. જે આજના કાળના તમારા સહિતના તમામ માનવીની
મહત્તમ જરૂરિયાત છે. આ ભોજન સ્વસ્થ ચિત્તે પણ ‘યોગ્ય કાળે’ કરવું જોઈએ. યોગ્ય

કાળ માટે અંગેજ સાહિત્યમાં સરસ વાત કરેલી છે. "Arouse 5'o clock and eat 10' o clock eat 5' o clock and slip 10' o clock" તમે સવારે ૫ વાગે ઉઠો ને ૧૦ વાગે જમો. સાંજે ૫ વાગે જમો અને ૧૦ વાગે સુવો તો શરીર નિરોગી રહે છે. આ વાત તો ભગવાન મહાવીરે ૨૫૦૦ વર્ષ પૂર્વે કરેલી છે. આયુર્વેદમાં હોજરી સૂર્યમુખી કમળ જેવી કહી છે. સૂર્યમુખી હુમેશા સવારે ઉગે છે. સૂર્ય જે તરફ હોય તે તરફ મુખ રાખીને જીવે છે. સૂર્યસ્ત સમયે બીડાઈને કરમાઈ જાય છે. હોજરી પણ સૂર્યની હાજરીમાં સારુ કાર્ય કરે છે. અને માટે જ રાતે ખાનારાઓને કબજિયાત, પેટ ફુલવું, શરીરમાં સુસ્તી, પેટમાં દુખાવો આદિ રોગો વધુ થાય છે. માટે ભોજનનો યોગ્ય કાળ સૂર્યની હાજરીમાં જ છે. તેમાં પણ મધ્યાહન એ ભારે આહાર માટે સવિશેષ યોગ્ય છે. પણ આવા યોગ્ય કાળે ગમે તે ખાઈ-ખાઈને શરીર બગડનારા પણ હોલસેલમાં જોવા મળે છે. એક સાવ સામાન્ય હકીકત છે કે કોથળીમાં ગજા બહાર સામાન ભરો તો કોથળી ફાટે જ. બસ, એ જ રીતે જો તમે પેટમાં વધુ પડતું નાખો તો શરીર બગડે જ. અથવા શરીરને પ્રતિકુળ આહાર લો તો પણ શરીર બગડે. શીયાળામાં આઈસકીમ ખાઈને માંદા પડવું એ મૂર્ખાઈ છે. એવી રીતે કેન્ટીન કે હોટલના વાસી ભોજન કરીને ફુડ પોઇઝનના ભોગ બનવું એ ગાંડપણ જ છે. (જે તમે કરી રહ્યા છો !) આખી દુનિયાને ખબર છે કે બજારુ ચીજોમાં હલકી ગુણવત્તા હોય છે. પેખ્સી, થમ્સઅપમાં આંતરડા ઓગાળી કઢે તેવા જેરી રસાયણ છે. તો'ય તમને પૈસા ખર્ચને પીવાનો શોખ થાય તો તેમને ધંધો કરવામાં શું વાંધો આવે ? કેવી કમનસીબી છે આજના કાળની કે લોકોને ઉપ રૂ. લિટર ભેયાળના દૂધમાં પાણીની ભેણસેળ દેખાય છે અને ઉપ રૂ. લિટર પેખ્સીમાં જેરની ભેણસેળનો વિચાર પણ નથી આવતો. અરે ! સ્વાસ્થ્યને હાનિકારક ઠંડાપીણા ખરીદવા આપણે દુકાન સુધી જઈએ છીએ અને સ્વાસ્થ્ય પ્રદાયક દૂધ આપણને ઘરના દરવાજે આપવા આવું પડે છે. આ તમામ શરીરને હાનિકારક તત્વો ખાવાનો મોહ છોડી જ્યાતનામ લેખક અક્ષય જૈને બનાવેલ “અપને ઘર કા દાના ઠીક, દાલરોટી ખાના સીખ” નો મંત્ર અપનાવવો એ સુખી થવાનો માર્ગ છે. દૂધ કે તેલના વધતા ભાવ માટે બૂમો પાડનારા પેખ્સી કે પીજાના ભાવ સામે વિરોધ નોંધાવે છે ? અરે ! એ ચટાક કરવાનું છોડે પણ છે ? જો એ બજારુ ખાદ્યપદાર્થ ત્યાગ કરો તો મર્યાદિત મૂડીમાં આજે પણ

જીવનનું ગાડુ ગબડાવી શકાય. કા.કે. બજરુન્દુ-ખાદ્યપદાર્થના ખર્ચી ઉપરાંત તોકટરી ખર્ચી પણ તે વ્યક્તિઓના બચી જશે. માટે જે સમજુ અને સજજન હોય તેવા વ્યક્તિઓએ પોતાના સ્વસ્થ ભાવિ માટે યોગ્ય સમયે, શરીરને પોષણ આપનાર પૌણીક અથર્ત પથ્ય આહાર મનની સ્વસ્થતા પૂર્વક ગ્રહણ કરવો એ હિતાવહ છે.

‘યોગ્ય કાળે પથ્ય આહાર’ ના સૂત્રને જીવનમાં ઉતારી મૃત્યુ પર્યન્ત દૈહિક સ્વસ્થતા જાળવી સુખી બનો



૨૦

ધર્મ, અર્થ, કામ ને પરસ્પર બાધા ન પહોંચે તેમ વર્તવું

ooooooooooooooooooooooooooooooooooooooo

આપણે ત્યાં આજ-કાલ જીંદગી જીવતા શીખવનારા અને શીખનારા વધી રહ્યા છે. આમ તો, ગમે તે રીતે જીંદગી પૂરી કરી નાંખનારાની જમાત નાની નથી હોતી. પણ દુઃખ એટલે થાય કે જે લોકો જીવન જીવવાની કળા શીખવા માટે સમય ને સંપત્તિ બન્ને વાપરે છે. તેઓ પણ વાસ્તવિક જીવનમાં સારી રીતે જીવતા નથી. શ્રીમણ ભગવાન્ મહાવીરે સુખી થવાના ૧૮ માં ગુણમાં જિંદગી જીવવાની પધ્યતિ બતાવી છે. તે ગુણ :- ધર્મ, અર્થ, કામ ને પરસ્પર બાધા ન પહોંચે તેમ વર્તવું. આમ, તો આવું શીખવવું ન પડવું જોઈએ. ભારતીય પરંપરામાં આ રોજિંદા જીવનમાં વણાયેલ હતું પણ હવે તો બધા (તેમે પણ !!!) વિશ્વની સંસ્કૃતિ અપનાવે છે તે? એટલે આવું શીખવવું પડે છે. જીવનમાં કદી'યે ધર્મ ન તજવો. તેમે ગમે તેટલા દુઃખ આવે પણ શ્રદ્ધાથી ગ્રભુને વળગી રહેશો તો દુઃખ દૂર થશે જ અને દુઃખ દૂર ન થાય ત્યાં સુધી દુઃખમાં મક્કમતા, સાત્ત્વિકતા પ્રભુ જ આપશે. અર્થાત્ હું એમ નથી કહેવા માંગતો કે આખો દિવસ મંદિરમાં જ પડ્યા રહે. મારો કહેવાનો ભાવ એટલો જ છે કે ધાર્મિકતા તમારા રોમ-રોમમાં વણાયેલી રાખો. કયાંય અધર્મ અર્થાત્ દુરાચારનું સેવન કરવાની પાપવૃત્તિ ન રાખો. સાથે - સાથે જો ઘરની જવાબદારી તમારા માથે છે તો ધન ઉપાર્જન પણ કરો. પૈસો માનવીની ખૂબ જ મોટી જરૂરિયાત છે. જ્યારે ઘર-સંસારની જવાબદારી તમારા માથે છે ત્યારે અન્યોને ઠગ્યા વિના (અને ઠગાયા વિના !!!) નિતિમત્તાથી પૈસો કમાવવો એ ગૂહસ્થનું કર્તવ્ય છે. અગર પૈસો નહીં કમાઓ તો બાળકની ફી, કપડા, ઘરમાં અનાજ, લાઈટબિલ આ બધું કયાંથી થશે? માટે બેકાર રખણારા કર્તવ્યબ્રાટ યુવા આલસે બાઈક પર કે પાણના ગલ્લે કે બાંકડા પર ટાઈમ પાસ ના બહાના હેઠળ સમય બગાડવાના બદલે કાંઈક કામ કરીને કમાવું જોઈએ. પણ આ

પૈસો કમાતા અન્યોને દુઃખી ન કરવા. નોકરને ચૂસીને વધુ કામ કરાવનારા કે ઓછો પગાર આપનારાને તેનું ફળ આ ભવમાં કે પરભવમાં વ્યાજ સહિત મળે છે. વળી, આવું કરવાથી નોકરને પણ શેઠ માટે કે શેઠની દુકાન માટે મમત્વ નથી રહેતું પહેલાના કાળમાં મુનિમો પેઢીને દુબ્બતી બચાવવા કમ્મર કસતાં આજે તમારો સ્ટાફ તમારી દુકાનનું દેવાળું ઝૂંકાય તો ઉભો ય નથી રહેતો એની પાછળનું મુખ્ય કારણ આ જ હોવું જોઈએ અને યૌવન એટલે પૈસો કમાવાનો, ચિકાર ધન એકહુ કરવાનો સમય એવું કેટલાક પરણેલા પુરુષોની માન્યતા છે. ઘરમાં પત્ની છે તેટલી ખબર પણ તેમને મન સજ્જવ રહેતી નથી. આમ, પૈસા પાછળ પાગલ થવું એ મૂર્ખઈ છે. પત્નીના જીવનમાં અન્ય વ્યક્તિની પદ્ધરામણી ન થાય તે માટે પતિએ સમય આપવો જોઈએ (સાડી નહીં !!!) પૈસાથી કોઈ વ્યક્તિ તમારી ન થાય. તેને લાગણી, હુંક, સમય જોઈએ. પૈસો કમાઈને આખર તમારે તમારા પરિવારને જ રાજી કરવાનો છે ને ? સમાજનો પ્રતિષ્ઠિત વ્યક્તિ પણ ઘરમાં તંગ સંબંધો ધરાવતો હશે તો સુખી નહીં જ હોય. ભલે શ્રીમંત હોય, શરીરે સ્વસ્થ હોય તો'ય. માટે પારિવારિક પ્રેમ એ જીવનમાં સુખી થવાનું જરૂરી તત્વ છે. પૈસા કરતાં'ય વધુ મહત્વનું છે. પણ એક વાત યાદ રહે કે, પૈસો અને સુખી સંસારિક જીવન આ બને નસીબ અર્થાત્ પુણ્યના આધારે મળનારી ચીજ છે. અને પુણ્ય ધર્મ કરવાથી પ્રાપ્ત થાય છે. માટે જીવનમાં સુખની ખેવના કરનારે ધર્મ કરવો જ પડે. કદાચ, તમે ધર્મને ન માનતા હો તો'ય ધર્મ કર્યા વિના સુખી ન બની શકો. આજે બુધ્યમાન્ અને ડિગ્રીધારી સારા ઘરના યુવાનો બેકાર રખે છે. અને બિલ્ડર લોભીમાં અબજો રૂ. ઓછુ ભણેલા, ઓછી બુદ્ધિવાળા કમાય છે. કારણ કે નસીબ યારી આપે છે. ઘણા'ને લગ્ન બાદ તેમની પત્ની સાથે ખૂબ જ સારુ બને છે. (જો કે આ તો ભૂતકાળની વાત થઈ !!!) અને આજે લગભગ ઘણાને લગ્ન પૂર્વના પરિચિત પાત્ર સાથે લગ્ન કરવા છતાં પણ છૂટાછેણા નગારા વાગે છે. કારણ કે પે'લાનું નસીબ તેજસ્વી છે આથી, સુખી બનવા ધર્મ, અર્થ અને કામ ત્રણો'યને પરસ્પર બાધા ન પહોંચે તેવું જીવવું એ જ આપણા માટે એક માર્ગ છે. આ માર્ગ પર ચાલીને સુખી બનો.

۲۹

ਅਤਿਥੀ, ਸਾਧੁ ਅਨੇ ਵੀਨ-ਦੁ:ਖੀਨੀ ਸੇਵਾ ਕਰਵੀ

ભારત દેશ એ ઋષિ-મુનિઓનો દેશ છે. આવું વિધાન ઘણીવાર વાંચવા-
સાંભળવા મળે છે. પણ ઋષિ-મુનિઓ દ્વારા આ દેશને કેટલો ફાયદો થયો છે એ બાબતે
ઘણું કહેવાતું હોવા છતાં ઘણું કહેવાનું બાકી છે. એ સર્વ સાધુજનના ઉપકારમાંથી ઋષિ-
મુક્તિ માટે શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવાના ૧૯ માં ગુણમાં
કહ્યું છે કે અતિથિ, સાધુ અને દીન-હુઃખીની સેવા કરવી. પરોપકાર એ
આપણને મળેલ અમૃત્ય વારસો છે. આપણને જે મળ્યું એ બીજાને આપવું એ માનવતા
છે. આ સર્વેને દાન આપવું એમ અહીં નથી લખ્યું. અહીં તેમની સેવા કરવી એમ લખ્યું



છે. સેવા કરતી વખતે આપણો અહંકાર તૂટે છે. દાન આપતા કદાચ વધે પણ ખરો. અને બાહ્યકિયાની સાથે આંતરશુદ્ધિ પણ થાય તેનું ધ્યાન રાખવાનું પ્રભુ ચૂક્યા નથી. માટે અતિથિ, સાધુ, દીન-દુઃખીની સેવા કરવી એમ કહું છે. અતિથિ એટલે બહારથી આવેલ કોઈપણ જાતિનો મુસાફર. એનો ઉચિત સત્કાર કરવો જોઈએ. એની સાથે તમારી કોઈ ઓળખાણ ન હોય તો પણ આ આપણી ફરજ છે. આજે હોટલો ખૂલ્લી ગઈ એટલે બહારથી આપણા ગામમા આવતા અતિથિ પૈસા ખર્યને ત્યાં જ પોતાનું પેટ ભરી લે. આનાથી અતિથિ સત્કારની પરંપરા લુખ થઈ. પૂર્વના કાળમાં કોઈ પણ ગામમાં કોઈ પણ વ્યક્તિ ભૂખી ન રહેતી. આસ-પાસ લોકો તેને ભોજન અર્થે ઘરે લઈ જઈ પ્રેમથી જમાડતા. આ સુંદર પરંપરાથી અપોષણની સમર્થ્યા સ્વાભાવિક રીતે જ નાચ થતી હતી. વળી, શ્રીમંત કે નિર્ધન કોઈપણ વ્યક્તિમાં કોઈને કોઈ જાતની શક્તિ હોય જ છે. ઘરમાં આવતા અતિથિજનો સાથેની વાત-ચીત

આદિમાં પણ તેના ધંધા આદિની જાણકારી મળે. અને સમાન ધંધા ધરાવનારા સાથે સંબંધ બંધાવાથી ઘરમાં અર્થ સંપત્તિ પણ વધતી હતી. આ સાવ સાચી વાત છે વિશ્વાસ ન હોય તો આજથી રોજ ૨-૪ અતિથિ (ઓળખાણ વિનાના) ઘરે લાવતા રહો. દ મહિનામાં માની જશો. બીજી વાત છે. સાધુઓની સેવા કરવી. સાધુ એટલે સમાજને સૌથી વધુ પ્રમાણમાં આપનારા અને સમાજ પાસેથી સૌથી ઓછું લેનાર દિવ્યપુરુષ. સમગ્ર વિશ્વમાં ભારતદેશ જ એવો છે જ્યાં સંતો પેદા થાય છે. ભારતથી આખા વિશ્વમાં સંતોની નિકાસ થઈ છે. અને થાય છે. ૧) બહારની પ્રજાના સાધુઓ કરતા ભારતીય પરંપરાના સંતો ખૂબ જ ઉંચી આધ્યાત્મિકતા પરાવે છે. દુનિયાના અન્ય પ્રદેશના ધર્મો કે




સંતો ઈચ્છાઓની તૃપ્તિ થયા બાદ શાંત સુંદર વાતાવરણમાં ધ્યાન શીખવે છે. જ્યારે ભારતીય સંતો ઈચ્છાનો જ નાશ કરી જંગલોમાં ડાંસ-મશ્યરની વચ્ચે આત્મ-સાધના કરે છે. અને તેવી સાધનામાં પણ પાર ઉતરે છે. આ જ ભારતીય સંતોની ઉંચાઈ છે. હા ! કથા-પારાયણો કરનારા કે માત્ર મંદિરોમાં રહીને હરિભક્તિમાં મળન થયેલા સંતો વૈભવી ઠાડ ધરાવતા હશે. ગાડીઓ કે બંગલાની સુવિધા ભોગવતા હશે પણ તેમની સંપત્તિનો મહત્તમ ઉપયોગ લોક કલ્યાણના કાર્યમાં જ થાય છે. પ્રજાને સંસ્કારી, શિક્ષિત બનાવવામાં તેમનો ફાળો બહુમૂલ્ય હોય છે. આવા પ્રભુ ભક્ત અને પ્રજાવત્સલ સંતોની સેવા એ પૂજ્ય અર્થાત્ નસીબ જળકવનાર સત્કાર્ય છે. પ્રભુને રાજ રાખનારનો રાજ્યપો મેળવવો એના જેવું સત્કાર્ય બીજુ એકે'ય નથી. હા, માત્ર વેશધારી, દુનિયાને ઠગનારા અમુક લોકો સંતના નામે ઢોંગ રચનારા હોય છે અને હશે. પણ એટલા માત્રથી સમગ્ર સાધુઓને ખરાબ કહેવા બિલકુલ યોગ્ય નથી. જેમણે સંસારના બંધનો ત્યાગીને વેરાગી ગુરુના હાથે સંન્યાસ સ્વીકાર્યો હોય તેવા શાસ્ત્રજ્ઞ, વેરાગી સંતો સાધુની સેવા કરવી એ સુખનો માર્ગ છે. ત્રીજી બાબત છે દીન-દુઃખીની સેવા કરવી. જે વ્યક્તિને ધન-ધાન્યાદિની તકલીફ હોય તે પણ મનુષ્ય છે, તે પણ ઈશ્વરનું સંતાન છે, તેઓ પણ

આપણા દેશના નાગરિક છે. એવી ભાવનાથી તેમને મદદ કરવી જોઈએ. જો આપણે કોઈને આજે મદદ કરશું તો આપણા હુંખમાં કોઈ મદદ કરશે. તમે ગમે તેટલી સંપત્તિ-સામર્થ્ય ધરાવનારા હો પણ પૂણ્ય પરવારે હુંખ આવે જ છે. તેમાં કોઈ પણ વ્યક્તિનું કાંઈ ચાલતું નથી. ત્યારે પૂર્વે દીન હુંખીની જેટલી સેવા કરી હશે તેટલું જ ફળરૂપે આપણને પાછું મળશે. માટે દીન-હુંખીને દેખતા સાથે જ કાંઈક ને કાંઈક આપણે આપવું જોઈએ. ભલે તે સામેની વ્યક્તિ કદાચ સારી ન હોય તો પણ આપણા હૃદયમાં કઠોરતા ન આવે તે માટે આપણે સામેનાને આપવું જોઈએ. આર્થિક સમૃદ્ધિનો આ પાયો છે કારણ કે જ્યારે તમે કાંઈક દાન દીન-હુંખીને આપો છો ત્યારે તે વ્યક્તિ તમને હુવા આપે છે અને તેની આંતરડી ઠરે છે. આનું સીધું જ પુણ્ય તમને પ્રાપ્ત થાય છે. તેની હુવા ફળવાથી તમારા સર્વ વાંछિત સિદ્ધ થાય છે. કારણકે પરમાત્માની ભક્તિ-સેવા એ મહાન પૂણ્ય કાર્ય છે. તો પરમાત્માએ કહેલું માનવું અને પૂણ્ય કાર્ય ન કહેવાય? આ અતિથિ-સાધુ-દીન હુંખીની સેવા કરવી એ પરમાત્માની આજ્ઞા છે. એ આજ્ઞાનું પાલન પ્રયંક પુણ્ય બંધાવવાનું સામર્થ્ય ધરાવે છે. અને પુણ્ય ધ્વારા સુખી થવાય એ તો સર્વજનસંમત વાત છે. માટે અતિથિ-સાધુ-દીનહુંખીની સેવા કરવાના ગુણને જીવનમાં આત્મસાત કરી, ઉજવળ ભવિષ્યના નિર્મિણ કરવા પૂર્વક સૌસુખી બનો.

Poverty is not an accident.
Like slavery and apartheid,
it is man-made and
can be removed by
the actions of
human beings.

- Nelson Mandela






અસદુ આગ્રહને સટૈવ તજવો

માણસને જીવનમાં આગળ વધવામાં સૌથી વધુ નડતર રૂપ જો કોઈ થતું હોય તો તે છે ‘પોતાનો અહંકાર.’ અહંકારના કારણે જ માણસ બીજા સારા લોકો સામે ટકરાય છે. અને પોતાનું અસ્થિત્વ નાના વર્તુળમાં જ પૂરાયેલું રાખે છે અને માટે જ વિશાળ, સમુદ્દર દણ્ણિવાળા બનીને સુખી થવાના ૨૦ મા ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે અસદ્ આગ્રહને સદૈવ તજવો. આપણે કાયમ માટે એક ભૂલ કરીએ છીએ કે કોઈ પણ વાત આપણે કરી એટલે તે બાબતે જડતાપૂર્વકનો આગ્રહ રાખીએ છીએ. કોઈપણ વસ્તુનો જડઆગ્રહ કદાપિ ન કરવો. તમારા બાળકે નવા કપડાની માંગણી કરી. તમે ના પાડી ત્યાર પછી તેણે પોતાની માંગણી ચાલુ જ રાખી તો તમે પણ તમારી વાતમાં મક્કમ થઈ જશો. કે હવે તો હમણા નહી જ અપાવું. આમાં દિકરો આણસમજુ છે માટે પોતાની વાતમાં પક્કડ રાખે છે. તમે પણ પક્કડ રાખો તો તમે સમજુ છો તે કેવી રીતે કહી શકાય ? માટે આવા વખતે તમારો આગ્રહ જડ અથર્તુ ખોટો અહંકારને વશ થઈને ન પકડી રાખવો એ બાપ તરીકે તમારું કર્તવ્ય છે. હા ! આનો મતલબ એ નથી કે તમે એને જોઈતી વસ્તુ કાયમ અપાવી જ દો. બાળકને બગાડતો અટકાવવા તેની ઈચ્છા પર અંકુશ જરૂરી છે જ. પણ એની વાત સમજો. પૈસાની અછત કે બીજુ જે કારણ હોય તે બાળકને સમજાવવાનો પ્રયત્ન કરો. ન સમજે તો વાત બદલી કાઢો. થોડીવાર ઘરની બહાર નીકળી જાવ (ગુરુસાથી નહી !!!) કે ગમે તે રસ્તો એવો અપનાવો કે બાળકને મારા પિતા જડવલણ દાખલે છે. એમ અહેસાસ ન થાય. આવું જડતાભર્યું વલણ એના મનમાં તમારા માટે નેગેટીવ ઇફેક્ટ ઉભી કરે છે. અને બાળકને સુધારવા કે કોઈ અન્ય યોગ્ય (રીપીટ ... યોગ્ય !!!) કારણસર તમે ‘ના’ પાડો તો બરાબર છે પણ માત્ર અહંને વશ થઈને તમે ‘ના’ પાડો છો તેમાં તમારી

પર્સનાલીટીનો પારો નીચો જાય છે. સામેની વ્યક્તિઓ તમને જડ, કદાગ્રહી સમજે છે. (જેમ બીજા આવું વર્તન કરે ત્યારે તમે તેને સમજો છો તેમ !!!) માટે અસદુ અર્થાતુ ખોટો આગ્રહ કદાપિ ન કરવો. જ્યારે સમાજ, દેશ, મંડળ આદિમાં પણ કોઈ વાત ચાલતી હોય કે કોઈ નિર્ણય થયો હોય ત્યારે તમે તેની વિરુદ્ધમાં કાંઈક વિચાર રજૂ કર્યો હોય તો છેક સુધી તે કાર્યને તોડી પાડવા મથ્યા કરો છો. આવું શા માટે? તમારી શક્તિને તોડવામાં નહી જોડવામાં વાપરો. તમને આ કાર્ય ન ગમ્યુ છતાં લોકો કરે છે તો દૂર રહો. તમને પસંદ કાર્ય અન્ય વ્યક્તિઓ સાથે મળીને કરો. આ કરતા તમારા મનમાં પે'લા કરતા ચિદિયાતા બનવાનો કે સામેનાને બતાવી દેવાની દુષ્પ વૃત્તિ રાખવાના બદલે મારી શક્તિના યોગદાનથી સમાજને કાંઈક ફાયદો થાય એવો ભાવ રાખવો. તમારા પોતીટીએ વિચારોથી તમારા વિરોધીઓ તમને નુકશાન નહી કરી શકે. અરે! તમે જો તમારા કાર્યમાં તેમને આવકારશો તો ઉત્સાહથી જોડાશે પણ ખરા. આમ, એક જડ આગ્રહના કારણે સામેનાના કાર્યને તોડી પાડવાના દુષ્પ આનંદ પામવા કરતા તેના કાર્યને થવા દઈ એક નવું કાર્ય આપણે પણ કરીએ તો આપણને સાચો આનંદ આવશે. સમાજને પણ ફાયદો થશે. આ અસદુ આગ્રહને બીજા રસ્તે વાળવાની રીત છે. તમે બીજા કામમાં ગૂંથાશો એટલે પે'લાના કામમાં ડખો કરવાની હુરસદ જ નહી મળે. (કોઈના કામમાં ડખો ન કરવો એ પણ એક સમાજ સેવાનો પ્રકાર છે!) અને આથી તમારો જડ આગ્રહ નામનો દુર્ગુણ વિકસતો જ અટકી જશે. આ વાત તમે અમલમાં મૂકી શકો તેવી છે. જડતાપૂર્વકના આગ્રહના કારણે તમે આજ સુધીમાં ઘણીવાર તમારી ઈમેજ ડાઉન કરી છે. આ જડઆગ્રહ જો વેપારીઓ સાથે રાખ્યો હશે તો ધંધો પણ વિકસતો અટક્યો હશે. આથી આર્થિક સ્થિતિ પર પણ અસર પહોંચી હશે. જો આવો જડઆગ્રહ પણ્ણ-પુગ્ર આદિ સાથે કરો છો તો તેમનો સ્નેહ-પ્રેમ તમારે ગુમાવવો પડ્યો હશે. માટે માત્ર અહંને વશ થઈને કદી પણ પોતાના અસદુ આગ્રહને પકડી રાખવો જોઈએ નહી. અહી અસદુ આગ્રહને સદૈવ તજવો કહ્યુ તેની સામે છેડે બીજુ સુત્ર ખુલે છે. સતનો આગ્રહ સદૈવ રાખવો. વ્યસન ન જ કરાય, મંદિર જવું જ જોઈએ. માંદાની કે મા-બાપની સેવા કરવી જ જોઈએ આવા ઘણા સત્કાર્યો પ્રત્યે આગ્રહ રાખવો જોઈએ. આ આગ્રહ ન રાખવાથી આપણા જીવનમાં અસદુનો આગ્રહ રાખવાનો દુર્ગુણ ઘૂસી જાય છે. માટે એવું ન થવા

દેવું એ સજજન વ્યક્તિનું કર્તવ્ય છે. જો તમે કોઈના વિચારને (તમારા વિચારને પડતો મૂકીને !!!) અપનવાશો. તો ક્યારેક બીજા પણ તમારા વિચારને અનુકૂળ થશે. તમે અગર જરૂરલણ દાખવશો અને કાયમ તમારી માન્યતા જ સાચી ઠેરવવા યત્ન કર્યા કરશો તો બીજા પણ કદ્દી તમારી વાતમાં સહમતી નહી દાખવે માટે તમારી વાતને અહીં ઓગાળી છોડતા શીખવી એ તમારી પ્રગતિ માટે જરૂરી વાત છે અસદ્દ આગછ સદૈવ તજવાના ગુણને જીવનમાં ઉતારી સુખી બનો.



23

ગુણોમાં પક્ષપાત કરવો

પરિવર્તન તો દુનિયાનો નિયમ છે. સમય બદલાય એટલે દુનિયામાં નાના-મોટા બદલાવ આવે જ. પણ પૂર્વના કાળમાં લોકોને ગુણ પ્રત્યે વધુ પ્રેમ હતો. આજે પ્રજાને પૈસા માટે વધુ પ્રેમ છે. અને માટે જ ગુણ પ્રત્યેના રાગને વિકસાવવા શ્રીમાણ ભગવાન મહાવીરે સુખી થવાનો ૨૧ મો ગુણ દર્શાવ્યો છે કે ગુણોમાં પક્ષપાત કરવો. સદ્ગુણ એ સમગ્ર સૃષ્ટિમાં સહેવ પ્રશંસનીય ચીજ રહી છે. અને રહેશે જ. પણ ભૌતિકતાની આ હવામાં પ્રજા ગુણ કરતાં'ય ધનને વધુ મહત્વ આપે છે તે ચિંતાનો વિષય છે. જેમ આજે ભારતમાં વિપુલ માત્રામાં અન્નનું ઉત્પાદન થાય છે જ પરંતુ સરકારની દુર્નિતિના કારણે જ ભાવવધારા અને ગરીબોને ભૂખ્યા સુવાનો વારો આવે છે. તેમ આપણે ત્યાં ગુણાનુરાગ અને ગુણની પ્રશંસાની તંગી જ ભોગવાદ અર્થાત્ નશ્વર ધન આદિ પ્રત્યેની આસક્તિને વૃદ્ધિ કરનાર બને છે. આ નશ્વર ધન આદિ પ્રત્યે આસક્તિના કારણે જ ધરમાં ભાઈ-ભાઈની વચ્ચે ઝગડા થાય છે. ખુરશી માટે સામસામે મારામારી થાય છે. અને બે દેશો વચ્ચે યુધ્યો થાય છે. આખર, આ બધુ મૃત્યુ બાદ અહીં મૂકીને જ જવાનું છે. તો શા માટે આટલી બધી તેના પ્રત્યે મમતા કરવી ? આ સદ્બુદ્ધિ સર્વત્ર હોતી નથી. માટે જ આવી ઘટનાઓ બને છે. આનો ઉપાય એ છે કે મમત્વનું સ્થાન બદલો આજ સુધી પૈસા પ્રત્યે જે આસક્તિ છે, એ હવે ગુણો પ્રત્યે વાળો. જો ગુણ પ્રત્યે તમે આસક્ત થશો. તો ધન આદિ નશ્વરની આસક્તિ તૂટશે જ. દા.ત. તમે કયાંક બજારમાં ગયા, સામેનો વેપારી માલ બતાવે છે, તમને ગમે છે, ત્યારે તે વેપારીના વિનય-વિવેક, તેની ધાર્મિક આસ્થા કે અન્ય કોઈ સદ્ગુણ પ્રત્યે પ્રેમ જાગરો તો પૈસા બાબતે માથાફિડ નહીં કરી શકો. તમારા નોકર કે ઓફિસસ્ટાફની વફાદારીને પગાર ચુકવતા નજર સામે લાવશો તો પગાર વધારો સહજ થઈ જશે. આનાથી તમે

કંગાળ નહી થાઓ. પરંતુ સામેની વ્યક્તિને તમારા પ્રત્યે માન જાગશે. તમારા કામમાં સામેની વ્યક્તિ કોઈ પણ છેતરપીડી કે ભેળ-સેળ નહી કરે. તમારો થોડોક ઘસારો તમારી ઘણી મોટી ઉત્તેજિતનું કારણ બનશે. માટે થોડા ખર્ચની સામે જંગી નફાની પ્રાપ્તિને જેમ આપણે સ્વીકારીએ હીએ તેમ ગુણોના પક્ષપાત કરવાથી પડતા ઘસારા દ્વારા મોટો વ્યવહારિક અને આભિક લાભ મેળવવો એ બુદ્ધિમાન્ વ્યક્તિનું લક્ષણ છે. (ગમારો આ ન સમજી શકે.) આનાથી તમારા જીવનમાં ગુણ અને ગુણવાન્ પ્રત્યે પ્રેમ જાગશે એ જ મહત્વની બાબત છે. ગુણ અને ગુણવાન્ પ્રત્યેનો પ્રેમ એ તમારામાં ગુણોનો ઉદ્ભબ કરવાની પ્રારંભિક જરૂરિયાત છે. આજે પ્રત્યેક વ્યક્તિમાં (તમારામાં પણ !!!) દુર્ગુણોની દુર્ગંધ જ વધી રહી છે. અને એ દુર્ગુણોથી તમે તમારા જીવનમાં તો પછાટ ખાઓ છો જ. એની સાથે તમારા દ્વારા આચરાયેલ દુર્ગુણ બીજાને પણ દુર્ગુણના આચરણનું નિમિત્ત પૂરુ પાડે છે. અર્થાત્ તમારો દુર્ગુણ દુનિયામાં બમણો થાય છે. દા.ત. તમે કોઈની સાથે ગાળા-ગાળી કરવાપૂર્વક મોટો ઝગડો કર્યો. તો સામેની વ્યક્તિ પણ કાંઈ બાકી નહી રાખે. તમારી સામે એ'ય બેફામ બોલવાપૂર્વક ઝગડો વધારશે. આમ પરસ્પર વેર-એરના વૃક્ષનું વાવેતર થશે. આ લડાઈ-ઝગડામાં કેટલાક તમારા પક્ષે અને કેટલાક સામેવાળાના પક્ષે રહેશે. એટલે તે લોકો પણ અરસ-પરસ ટકરાશે. આ આખી'યે વેરની પરંપરા અસહિષ્ણુતાનામના દુર્ગુણની પેદાશ (પ્રોડક્ટ) છે. જો તમે થોડાક સહિષ્ણુ બનીને સામેવાળાની ભૂલને ગળી ગયા હોત તો આ લડાઈ-ઝગડો પેદા જ ન થાત. તમે થોડીક પણ સહિષ્ણુતા ન રાખી તેના પરીક્ષામે આ લડાઈ-ઝગડો થયો. વેર બંધાયું. હવે વિચારો કે આ ગુસ્સાના અને ઝગડાના સમયનો સદુપયોગ કર્યો હોત તો તમે કેટલું મેળવ્યું હોત ? સૌ પ્રથમ તો શ્રમણ ભગવાન મહાવીરની જેમ દુર્જનને'ય માર્ઝી આપવાથી મળતા સુખની અનુભૂતિ કરી શકત (આ સુખાનુભૂતિ આજના કાળમાં શક્ય છે !) એ સમયમાં કયાં તો ધંધાના બે કામ પતાવીને અર્થોપાર્જન કરી શકત. કે ધરમાં પુત્ર પરિવારને સમય આપીને તેમનો પ્રેમ સંપાદન કરી શકત. અરે ! ગુસ્સાના કારણે થતા એસીડીટી, ડિપ્રેશન જેવા રોગોથી બચી તો અવશ્ય શકત. આ બધુ એટલા માટે અહીં બતાવાય છે કે આ વાંચીને તમે તમારા સુખી જીવન માટેની નિતિનું નિર્માણ કરી શકો. આ કોર્સ M.B.A., M.B.B.S., M.A. કે L.L.B. જેવી ડિગ્રીઓવાળાને પણ

ભાષણ મળતો નથી. છતાં એ તમામ ડીગ્રીઓથી'યે વધુ જરૂરી છે. કારણકે પૈસો, પરિવાર, સ્વાસ્થ્ય, પ્રતિજ્ઞા આદિ તમામ સંસારની નશ્ચર ચીજો તમે સુખી થવા જ એકનિત કરો છો. જો આ તમામથી સુખ પ્રાપ્તિ ન થાત તો તમે તેને ઈચ્છિત નહીં જ. બરાબરને ??? તો આ તમામ ચીજ પામીને પણ તમે સુખી નથી થયા એ વાત પણ સાચી જ છે ને ??? આ વિષમતા ચૂરાય અને સંસારમાં પણ થોડીક સુખ-શાંતિની પ્રાપ્તિ કરી શકો માટે અહી આ વિવરણ કરાય છે. અર્થાત્ આ ગુણોના પરિપાલનથી તમે સ્વયં જ સુખી થવાના છો. આ વાતનો અનુભવ એક-બે દિવસમાં થવો મુશ્કેલ છે. આજ સુધી તમે દુનિયા સાથે જે ખોટા ધંધા કર્યા છે તે તમારી મનોવૃત્તિ બદલાય તો જ આ બાબતની પૂર્ણ અનુભૂતિ થાય. માટે ધીરજ ધરીને સુખી થવા માટે ગુણોમાં પક્ષપાત કરવો આદિ ગુણો જીવન વ્યાપ્ત કરો.



۲۸

ਦੇਸ਼-ਕਾਣਨੇ ਵਿਰੁਦ਼ ਪ੍ਰਵੱਤਿ ਤਜਵੀ

એકવાર ગુજરાતના ગામડામાં હજામતનો ધંધો કરીને ગુજરાન ચલાવનાર હજામે વિચાર કર્યો. જ્યાં હજામો જ ના હોય તાં જઈને હું ધંધો કરુ તો વહુ કમાઈ શકાય. અને તે વિચારને અનુસારે તેને પંજાબમાં હેરકટિંગ સલૂન ખોલ્યું. (વિચારો !!!) પરિણામે તેને ભૂખ્યા મરવાનો વારો આવ્યો કા.કે. પંજાબની શીખ ધર્મની શ્રદ્ધાળું પજાવણ ન કપાવવાના તેમના ધર્મને અડગ રીતે વળગી રહે છે. માટે જ શ્રમણ ભગવાન મહાવીરે સુખી થવાના ૨૨ મા ગુણમાં જણાવ્યું કે દેશ-કાળને વિરુદ્ધ પ્રવૃત્તિ તજવી. આજે જમાનો જ ખરાબ આવ્યો છે. (અર્થાત્ જમાનામાં લોકો ખરાબ પાક્યા છે !) કે તે દેશ-કાળને વિરુદ્ધ વર્તન કરતા અચ્યકાતા પણ નથી. જે ચીજવસ્તુ સારી હાલતમાં ઓછી ડિમ્બતે સ્વદેશી બજાર પૂરી પાડે છે તેવી વસ્તુ આકર્ષક પેંકિંગ અને સ્ટેટ્સ સિન્ઝોલ ખાતર



Mall Culture

વિદેશી કંપનીની ખરીદવી એ દેશ વિરુદ્ધ કાર્ય છે. કા.કે. તમે આ રીતે જો પરદેશી પેદાશો વાપરશો, બીજાઓ પણ આનું અનુકરણ કરશો. તો તે ચીજની ઉત્પાદક આખી ભારતીય લોભી (ઉત્પાદક કોમ) ભૂખે મરશો. અને યાદ રાખજો ! માનવી એક-બે દિવસ ભૂખ્યો રહેશે. કાયમ નહીં. અને પછી ભૂખના કારણે પેદા થયેલ આતંક રોકવાની શક્તિ

કોઈ લશકરનીએ હોતી નથી. બિહારનો નકસલવાદ એ ભૂખમરામાંથી પેદા થયેલ આતંક છે. જેની સામે ભારતીય લશકર પણ વામણું છે. આનું મૂળ તમે દેશ વિરુદ્ધ પ્રવૃત્તિ કરી તે. વિદેશી માલ તો જ વપરાય જો તે ચીજાનું ઉત્પાદન આપણા દેશમાં પૂરતુ કે સારુ ન થતુ હોય. આ જ રીતે બીજી બાબત એ છે કે આપણું યુવાધન જોબ કરવા વિદેશ તરફ જ મીટ માંડીને બેઠું હોય છે. આ પણ દેશ વિરુદ્ધનું કાર્ય છે. વિદેશ ભણવા કે કમાવા જનારા યુવાનો એકદમ બુદ્ધિમાન અને પ્રતિભાશાળી જ હોય છે. તો જ ત્યાંના પ્રારંભિક ખર્ચ કરવાનું વિચારી શકે. હવે તેની જે બુદ્ધિ ત્યાંના કાર્યોમાં વપરાય છે તેનાથી તેને પોતાને ભલે પૈસો મળે પણ તેને વર્ષે ૫૦,૦૦૦ ડોલર મળશે તો સામે તેની બુદ્ધિના ઉપયોગથી એ વિદેશી કંપનીઓ ર લાખ ડોલરથી વધુ નફો મેળવે છે. અર્થાત્ આપણા દેશની બુદ્ધિથી વિદેશી નાણું મજબૂત થાય છે. તેના બદલે તે યુવાન દેશભક્તિની ભાવનાથી ભારતમાં જ રહીને નોકરી-ધંધો કરત તો કદાચ વર્ષે ૧૦,૦૦૦ ડોલર કમાત પણ તેના દ્વારા આશરે ૫૦,૦૦૦ ડોલરનો જંગી નફો ભારતીય મજૂરથી માંડીને મેનેજર સુધીના તમામને મળત આટલા જંગી નફાના ભાગીદાર જો ભારતીયો થાય તો ભારતીય નાણું કેટલું મજબૂત બને ! પણ આના માટે ગાંડાની જેમ ધૂમ કમાવાની મનોવૃત્તિ ત્યાગવી પડે.

આ દેશ વિરુદ્ધ ન લાગતી છતાં'ય દેશવિરુદ્ધ પ્રવૃત્તિ જ છે. બાકી દાણચોરી જેવી અનેક પ્રવૃત્તિ તો દેશવિરુદ્ધ પ્રસિધ્ય જ છે. બીજુ, કાળ વિરુદ્ધ પ્રવૃત્તિઓનો પણ ત્યાગ કરવો. દા.ત. કોઈ મોટા રાજકીય નેતાનું મૃત્યુ થાય ત્યારે ઔચિત્યથી પણ (ભલે તે ગમે તેવા હોય !!!) તે દિવસે હોટલ-થિયેટર આદિમાં ન જવું જોઈએ. જ્યારે ભૂકુંપ આદિ મોટી દુર્ઘટનામાં હજારો લોકો માર્યા ગયા હોય ત્યારે આપણે નફફટ બનીને પાપાચારો ન કરવા. મોજશોખની મૂડી એ હુંખી જનોને માટે વાપરવી. આજે મોટી રથ્યાત્રા કે ધાર્મિક કાર્યો કરતી વખતે કેટલાક અણસમજુ છુંબો કહેતા હોય છે કે આના કરતા આટલા રૂપિયા ગરીબોને ભોજન-ભાણતર કે ધરો બનાવવામાં વાપર્યા હોત તો કેટલાને શાંતિ મળત ? આ રથ્યાત્રા ૪ કલાકમાં પૂરી થઈ ગઈ. રૂપિયાનું પાણી જ કર્યું ને ?? અને ભાઈ ! આમ બીજી તરફ તો જુઓ, તમને ધર્મ માટે વપરાતા પૈસાને જ અન્ય માર્ગ વાળવાની કુબુદ્ધિ કેમ સૂઝે છે ? Weekend માં રવિવારે સાંજે દરેક

શહેરોમાં હોટલો ગંધાતી ગટર માફક ઉભરાય છે. આ હોટલોનો ખર્ચ જીવનજરૂરી નથી જ. તમે તે રૂપિયાથી ગરીબોને માટે કાંઈક કરો. એ રૂપિયાનું ટોટલ કેટલું થાય એ જાણવું છે? માત્ર અમદાવાદનું પ્રતિ રવિવારીય Hotel's bill 3.2,00,00,000 (૨ કરોડ !) થી વધુ છે. અર્થાત્ માત્ર અમદાવાદની પ્રજા ૧ રવિવાર હોટલ છોડે અને તે પૈસા ગરીબો માટે ફાળવે તો ૨,૦૦,૦૦૦ (બે લાખ !!!) ગરીબો મિષ્ટાન્ન સહિતનું ભોજન પામે. આ વસ્તુ મહેસાણા, પાટણ કે ડીસા જેવા કોઈ પણ શહેરને લાગુ પડે છે. તમે આ પૈસા પર નજર કરો ને ?? ધરમના પૈસા પર તરાપ કેમ મારો છો ?

અસ્તુ. દેશ-કાળ વિરુદ્ધ કાર્યો કરવાથી આપણો તે દેશમાં કે તે કાળમાં (સમયમાં) લોકોની નજરે હીન હેખાઈએ છીએ. દુનિયા આપણને તુચ્છતા ભરી નજરે જુવે છે. જે તમને દુઃખી કરનાર છે. આમ તો, આ દુઃખ તમારા અહંકાર ઘવાવાનું દુઃખ જ હોય છે. જો અહં-મમ જેવું કાંઈ રાખો જ નહી તો આ વાત જ ન આવે. શ્રમણ ભગવાન મહાવીરે અહંકાર તોડવાની વાત કરી છે તે પણ ખૂબ જ સુંદર અને મનોવૈજ્ઞાનિક છે. પણ હજુ તમે પ્રાથમિક ભૂમિકામાં છો અને અહંકાર તોડી શકો તે સ્થિતિ નથી તો તમારો અહંકાર કોઈએ તોડવો પડે તેવી પરિસ્થિતિ જ ન સર્જો. એ જરૂરી છે. આ દેશ-કાળ વિરોધી કૃત્ય તમને અને સામેનાને બનેને નુકશાન કારક છે. માટે તે ન જ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. આખરે સ્વસ્થ અને મસ્ત સમાજનું સર્જન સંદગુણ પ્રગટાવ્યા વગર શક્ય જ નથી અને એ સંદગુણો પ્રગટાવવા પા-પા પગલી માંડતા સર્વે આ ગુણ પણ જીવનમાં ઉતારી સુખી બનો.

A Grocer
Shop



۲۴

બળાબળનો વિચાર કરવો

oo

પ્રત્યેક વ્યક્તિએ આગળ આવવા માટે ખુલ્લી આંખે સપના જોઈએ અને સારા સપના જોઈ તેને ચરિતાર્થ કરવા તનતોડ મહેનત કરવી જોઈએ. આ સાવ સાચી વાત છે પણ ક્યારેક લોકો ગજબહારનું વિચારતા હોય છે. અને મોટા ઉપાડે મોટા કામો આરંભીને દુઃખી થાય છે. એ ભૂલ સુધારવા જ સુખી થવાના રૂપ મા ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવ્યુ છે કે બળાબળનો વિચાર કરવો. અર્થાતુ આપણી શક્તિ મુજબ કાર્ય કરવું. પૂર્વના કાળમાં શ્રીમંત-ધનાઢ્ય કહેવાતા



વિના જ દુનિયાના રવાડે ચઢીને પોતાની શક્તિનું માપ વિચારતા હોય છે તે જ મુખ્ય કારણ છે. જો કોઈ ગમે તેટલી સામર્થ્યવાળી પણ વ્યક્તિએ પોતાની શક્તિ અનુસાર જ ધંધો કર્યો હોત તો આજે તેમને દેવાળું ફૂંકીને ઉભા થઈ જવાનો વારો ન આવત અરે ! શેરબજારમાં આર્થિક દણિએ હર્ષદ મહેતા બનવાનું સપનું જોનારા સામાન્ય ઘરના લોકો સેન્સેક્સ ગગડે ત્યારે નરસિંહ મહેતા જેવી આર્થિક મંજુવણ (ભક્તિની સાત્ત્વિકતા નહીં

!!!) અનુભવે છે. તેમાં પણ તેઓએ પોતાની શક્તિ બહાર કાર્ય કર્યું. તેનું પરિણામ જ અંકિત થયું છે. પોતાની શક્તિ ન હોવા છતાં'ય કયારેક પ્રસિદ્ધિના શિખરો સર કરવાની જેવનામાંથી કેટલાક નામધારી ભક્તો પોતાના ભગવાનના વિશાળ મંદિરો બનાવવાની જેવના અને આયોજનો કરે છે તે અધૂરા રહેવા પાછળ પણ તેમણે ગજા બહારનું કામ ઉપાડ્યાનું જ કારણ મુખ્ય હોય છે. આ 'તો કેટલાક નમૂના જ પ્રદર્શિત કર્યા આવું તો ઠેક-ઠેકણે બનતું હોય છે. જો તમે તમારી શક્તિ-ઉપરવટ થઈને કાર્ય કરવા જશો તો હુંમેશા માર ખાશો. કારણ કે કાર્યના આરંભથી પૂણ્યાદૃતી સુધીના આખાય સમયગાળામાં મહેનત, પૂણ્ય અને બુદ્ધિ ત્રણેય ચીજો છૂટથી વપરાય છે. આ ગ્રાણ ચીજો પૈસાથી પણ વધુ મહત્વની છે. જો તમારી પાસે અત્યંત બુદ્ધિમત્તા હશે પણ તમે પૂણ્યવાન નથી તો તમારી બુદ્ધિ જ તમારું કાર્ય બગાડી શકે છે. દા.ત. કોઈ ગરીબને તમે હોસ્પીટલમાં દાખલ કર્યો. ખર્ચ તમે ઉપાડ્યો. પણ જો તમારું કે સામેવાળાનું શારિરિક પૂણ્ય નહીં હોય તો તેને ડોક્ટર ખોટી દવા કે ઇન્જેક્શન આપી બેસરો. જે તેના રોગની માત્રામાં વૃદ્ધિ કરશો. આના કરતા તમે તેને હોસ્પીટલ ન લાવ્યા હોત તો ઓછો રીબાત. અલબાત આવી ઘટના કાયમ નથી થતી. એ વાત સાચી છે તો આવી ઘટનાઓ ઘણીવાર બને પણ છે જ. એ પણ સનાતન સત્ય છે. જો તમારી પાસે સખત મહેનત જ હશે. બુદ્ધિ કે પૂણ્યબળ નહીં હોય તો'ય કાર્ય ભાંગી પડશો. કારણ કે મંદિરના નવસર્જન જેવા કાર્યમાં તનતોડ મહેનત જરૂરી છે પણ ગણત્રીપૂર્વકનું સુસંચાલન પણ અતિ અગત્યનું છે. જે બુદ્ધિવાનો જ કરી શકે. પણ જો તમે પૂણ્યવાન હશો તો તમને બુદ્ધિવાળા અને મહેનતું સ્વયં સેવકો બને સામેથી મળી જશે. અને તમારું કાર્ય પૂરુ કરી દેશે પણ તેમાં સાવ પાંગળું પૂણ્ય નહીં પણ વિશિષ્ટ પ્રચંડ પૂણ્યની આવશ્યકતા રહે છે. સામાન્ય પૂણ્ય થોડા સમયમાં જ ઘસાઈ જાય છે અને વ્યક્તિ ત્યાં ને ત્યાં રહી જાય છે. અર્થાતું પોતાની ભાવના ચરિતાર્થ કરી શકતી નથી. માટે પૂણ્ય એ તો કોઈ પણ સપનાને સાકાર કરવા જોઈતું મહત્વનું રોમટિરિયલ (કાચો માલ) છે. તો બુદ્ધિ અને મહેનત પણ તે કાર્ય માટે જરૂરી મનાયું છે. આ ગ્રાણેય પરિબળોનો વિચાર કરીને કાર્યને ઉપાડનાર વિના વિધે પોતાની ભાવનાનુસાર કાર્ય સમ્પત્ત કરી શકે છે. માટે બળા-બળનો વિચાર આ ગ્રાણેય બાબતે કરવો જોઈએ. જો'કે નેગેટિવ વિચારધારા વાળા ઘણા લોકો પોતાની શક્તિ

આંકડીને કાર્ય જ ઉપાડતા નથી એ પણ ધરાર અયોગ્ય છે. પોતાની શક્તિ કરતા પોતાનું વધુ મૂલ્ય આંકવું તે ગુનો છે તો પોતાના ગજથી ઓછુ મૂલ્ય આંકવું તે'ય ગુનો છે. વળી તમે કાર્ય કરશો તો તમારી શક્તિ ખીલશે તે બાબતમાં બુદ્ધિ વિકસશો માટે કાર્ય જ ન કરવું તેમ ન કરવા કરતા નાના-નાના કાર્યો કરતા કરતા ધીમે-ધીમે તેનાથી મોટા કાર્યો કરવા. સાથે સાથે આ કાર્યોને પૂર્ણ કરવા જરૂરી મૂલ્ય ચીજ પૂર્ણ પણ વધારતા જવું જે તમને ખૂબ ઉપયોગી થશે. પૂર્ણ વધારવા માટે પ્રાથમિક તબક્કામાં ભગવાનના દર્શન કરવા, સંતોનો સત્સંગ કરવો, વહિલોને માન આપવું, દીન-દુઃખીને દાન આપવું, પ્રસિદ્ધ આદિની લાલચ વિના ધર્મ અને સમાજના કાર્યો કરવા આટલું જ જરૂરી છે. તો બળા-બળનો વિચાર કરીને જ કાર્ય ઉપાડો. અને કાર્યની સિદ્ધિ માટે પૂર્ણને વધારતા સુખી બનો.



૨૬

સદાચારી એવા જ્ઞાનવૃધ્ઘોને પૂજવા

ooo

ભૌતિક સુખ સાધનોનો સમંદર છેલ્લા ૨૦૦ વર્ષમાં દિન-પ્રતિદિન પોતાની મર્યાદાને ઓળંગતો જાય છે. ત્યારે સૂકાતી જતી સદાચારની નદીઓને નવપત્રલાવિત કરવા માટેના ઉપાયો પણ વિચારવા જેવા છે. અને તે માટે શ્રેષ્ઠ રસ્તો શ્રમણ ભગવાન મહાવિરે સુખી થવાના ચોવીસમાં ગુજરાતમાં દર્શાવ્યો છે.

સદાચારી એવા જ્ઞાનવૃધ્ઘોને પૂજવા. વિશ્વના તમામ દેશો હંમેશ પૈસાદારોને જ પૂજતા રહ્યા છે. તેની સામે ભારત એ એવો દેશ છે જ્યાં ભૌતિકતાના સાધનો વધવા છતાં'ય ત્યાણી અને જ્ઞાનીઓ જ પૂજાનો વિષય બનતા રહ્યા છે. આજે પણ એક અબજપતિ વ્યક્તિ જ્ઞાની સાધુપુરુષ પાસે તો ચરણમાં જ બેસે છે તે ભારતનું મહત્વનું જમા પાસું છે. સંતોનું પૂજન તો ખૂબ સુંદર સત્કાર્ય છે જ. પણ સંસારી એવા પણ સદાચારી જ્ઞાનવૃધ્ઘોને પૂજવા એ સુખી જીવનનો માર્ગ છે. કારણ કે જેમણે સંસાર જાણ્યો અને સાચી રીતે (સારી નહીં !!!) માણયો છે. સંસારમાં પગભર થવા આવતા સંઘર્ષની ઘટમાળમાંથી પસાર થવાની હથોટી જેમણે મેળવી છે તેમનો સહવાસ જ્યારે આપણને આવા અવરોધો આવે ત્યારે તેમાંથી બહાર નીકળતા શીખવી શકે છે, પણ જો આપણે તેમને કાયમ પૂજયા-સન્માન્યા હોય તો સદાચારી જ્ઞાનવૃધ્ઘ એવા વડિલોની અનુજ્ઞા વિના યૌવનથી છકી ગયેલી યુવા આલમ પ્રેમ લગ્ન પછી પસ્તાઈને છૂટા-છેડાના પ્લેટફોર્મ પર જીવન-ગાડીને ઉભી રાખે છે. તેમાં મુખ્ય વાંક વડિલોની અવજ્ઞા કર્યાનો જ છે. માટે તમામ સમાજમાં વ્યાપક બનેલ આ એક કડવા અનુભવને યાદ રાખીને સદાચારી જ્ઞાનવૃધ્ઘોને પૂજવાના કર્તવ્યનું પાલન કરવું એ સર્વજનહિતાય સર્વજન સુખાય પ્રવૃત્તિ છે. આ તમામને અનુભવ સિદ્ધ વાસ્તવિકતા છે. બાળક કરતા તેના શિક્ષક જ્ઞાનવૃધ્ઘ છે. (સદાચારી હોય તો વિશેષ આનંદની વાત !) અને તેમની પાસે ભણીને

બાળક પોતાનું ભવિષ્ય ભૌતિક રીતે ઉજળું બનાવે છે. તો તમે યુવાન કે પ્રોથ થયા પછી તમારાથી વધુ વડિલો પાસેથી જ્ઞાન મેળવતા ખચકાઓ છો કેમ? જીવન જીવવા જરૂરી વ્યવહાર કયાં કેટલો રાખવો? કોણ સજજન છે? અને કોણ માત્ર આપણા પૈસાને જ સંન્માને છે?, બાળકને સંસ્કાર કેવા અપાય? આદિ અનેક પ્રકારનું જ્ઞાન તમારી દર્શિએ ઓછું ભાણેલા વડિલોમાં જ વધારો હોય છે. પૈસા કયાં રોકાય તેની પણ જાણકારી વડિલો પાસેથી જાણવી જોઈએ. મતલબ વિનયપૂર્વક તેમનું સંન્માન કરીને તેમની પાસેથી શીખવી જોઈએ. કારણ કે જે પેઢીઓ કે કંપનીઓ ડેવાળું ફૂંકે છે. નાદારી નોંધાવે છે. તે અલગ-અલગ અનેક વ્યક્તિઓનું ૨-૫-૧૦ લાખનું કરી જાય છે. આ યાદીમાં તમે માર્ક કરજો મોટા ભાગે યુવાનોના જ રૂપિયા હોય છે. કારણ કયારે કઈ પેઢીમાંથી રૂપિયા કાઢી લેવા તેની કોઠા-સૂજ વડિલોને ગમે ત્યાંથી પ્રાપ્ત થયેલ હોય છે. જે તમે કાયમ (અર્થાત્ લાંબો સમય) તેમની સાથે સહવાસ કરો તો જ સમજ શકો એક-બે દિવસમાં નહીં. માટે આવા સદાચારી જ્ઞાનવૃધ્ય વ્યક્તિઓનો સહવાસ આપણને દરેક ક્ષેત્રમાં ઉપયોગી થઈ શકે છે. તમારી આસ-પાસમાં તમે નજર કરશો તો આવી પીઠ વ્યક્તિઓ જે સદાચારી હોવા સાથે જ્ઞાનવૃધ્ય પણ હોય તે મળી આવશે જ. આ નક્કી છે. હા! આ વ્યક્તિ જ્ઞાનવૃધ્ય હોવા સાથે સદાચારી હોય તે જોવું જ જોઈએ કારણ કે ઈતિહાસની ભાષામાં કહીએ! તો મહાભારતના યુધ્યમાં કૌરવોના પક્ષે તેમના મામા શકુની જ્ઞાનવૃધ્ય હતા જ પણ તે દુરાચારી અર્થાત્ નિષ્કારણ માયા-પ્રપંચ આદિ કરનારા હતા. જ્યારે પાંડવ સેના સાર્થવાહ કૃષ્ણ સદાચારી હોવા સાથે જ્ઞાનવૃધ્ય હતા પરિણામ આપણે જાણીએ જ છીએ કોની જીત? કોની હાર? માટે સદાચારી ન હોય તેવા જ્ઞાનવૃધ્યની સંગત પણ દુર્જનસંગતિની જેમ નુકશાનકારી જ છે. માટે આવી ભૂલ ન કરવી. આખર માનવમાં પ્રયંક બુદ્ધિ હોય તો'ય જો તેનું મન સદગુણમાં, ધર્મમાં, ન્યાયમાં સ્થિર નથી તો પરિણામે વિનાશને જ નોંટરે છે. અરે! અમારા મતે તો દુરાચારી સામાન્ય માણસ



કરતાં'ય દુરાચારી જ્ઞાનવૃધ્ધ વધુ ખતરનાક પુરવાર થાય છે. તમે જ વિચારો કે ગામનો સામાન્ય માણસ કદાચ ખોટુ કામ કરે તો કો'કના ઘરના ૫-૨૫ હજાર રૂપિયા ચોરી જશે. જ્યારે દુર્ભુદ્ધિના નિધાન નેતાઓ એકા'દ ટેકસ નાંખીને પ્રજાના અબજો રૂપિયા સરકાર ખાતે નહી પણ પોતના નામે કરાવવાની ક્ષમતા ધરાવે છે. એ આપણને વધુ નુકશાન કરે છે. આ માનવામાં આવે તેવી જ વાત છે ને ? માટે આ બાબતે સ્પષ્ટ રહીને જ અર્થાત્ સદાચારી હોય તેવા જ્ઞાનવૃધ્ધોની જ સંગત કે સેવાકરણનો આગ્રહ રાખવો. હા ! આમાં કોઈ દુરાચારી કે જ્ઞાનહીન પ્રત્યે મનથી'યે અનાદર ન જ કરવો. તેમને જડુર પડે તો તેમની પણ સેવા કરવી જ જોઈએ. આખર તે સદાચારી નથી તો તમે'ય કયાં મોટા સત્પુરુષ છો ? તમે પણ તેવા જ છો આ તો તમને જ્ઞાન મળ્યુ માટે તમે સુધરો છો. (કદાચ !!!) તેમને મળશે તો તે'ય સુધરશે. આમ વિચારીને તેમની પણ ઉચિત સરભરા કરવી પણ સદાચારી જ્ઞાનવૃધ્ધોની સંગત અને સત્કાર કદી ન જ ચૂકવા આ સદાચારી જ્ઞાનવૃધ્ધોનું પૂજન કરીને સાચા અર્થમાં સુખી બનો.



29

આશ્રિતોને પાળવા પોષવા

પરસ્પર એકબીજાને સહાયક થવાથી જ જીવન વ્યવહાર ટકી શકે છે અને એ જીવનવ્યવહાર ટકાવવા માટે જેઓ આપણને સહાયભૂત થાય તેમને કોઈ પણ રીતે વળતર આપવું એ આપણી સજજનતા છે આ વાત શ્રમાણ ભગવાન મહાવીરે સુખી થવાના પચ્ચીસમાં ગુણમાં કરી છે કે આશ્રિતોને પાળવા પોષવા. આશ્રિત એટલે જેમની જુંદગીનો ધણો મોટો આધાર તમે છો તે આમાં તમારા બાળકો, પત્નિ, નોકરો, ઓફીસ સ્ટાફ આદિ આવે. તે તમારા આશ્રિત અર્થાત્ તમારા આશ્રયે જીવનારા કહેવાય તેમને ઉચ્ચિત પ્રેમ-હૂંફ, સમય, પૈસો આદિ આપવું એ તમારું કર્તવ્ય છે. (કર્તવ્ય એટલે કરવા યોગ્ય જે ન કરો તો તમે તમારી ફરજ ચૂક્યા કહેવાઓ) તમારા બાળકો, પત્નિ, વૃદ્ધ મા-બાપ આદિને તમારા પ્રેમ-સમય-હૂંફની જરૂર હોય છે. ત્યાં પૈસો આપીને છૂટવાની વૃત્તિ ન રાખવી જોઈએ. બાળકને ૧,૦૦૦



રૂ. મળવાથી જેટલો આનંદ આવે તેના
કરતા તમે તેની સાથે ૧ કલાક સમય
ફાળવીને રમો-વાતો કરો કે સાથે બેસીને
તેને વ્હાલ કરો તેનાથી મને છે. હા !
મને ખબર છે કે કોમ્પ્યુટર અને
ટી.વી.ના જમાનામાં આ બાળકોને
ટી.વી. કે વિડિયો ગેમ્સનો જ કેઝ હોય

છે. છતાં'ય કહું હું કે જો તમે બાળકને માટે સમય ફાળવશો તો ધીમે-ધીમે તે ટી.વી. કે રમત-ગમતના સમયે પણ તે ટી.વી. આદિ છોડીને તમારી પાસે દોડી આવશે. બસ, તમે બાપ તરીકે ટી.વી. કરતા વધુ આકર્ષક બની જાઓ. આ અઘરું નથી. તમે માત્ર થોડોક

વિચાર કરો કે બાળકને શું ગમે છે ? લગભગ બાળકને હાસ્ય ગમે. તો શરૂઆતમાં એકા'દ જોકસ કહો. પછી તેને ફરવા લઈ જાઓ. આમાં તમારી અને બાળક વચ્ચેની અાત્મિયતા દઢ થશે. પછી તમે જે ઈચ્છશો તે કરવા બાળક તૈયાર રહેશો. તે જ રીતે પત્તિને પણ સંતોષ આપવો એ પતિ તરીકે તમારું કર્તવ્ય છે. (પરસ્પર બને માટે !!!) સમય નામની મૂલ્યવાન મૂડી તમે જેને આપશો તે તમારી પાસે પૈસાની આશા રાખવાનું છોડી દેશે છતાંય તમે તેને ખૂબ જ પ્રિય બની શકશો. વૃધ્ઘ મા-બાપ માટે પણ આ નિયમ લાગુ પડશે. હવે વાત આવે છે તમારા નોકર-ચાકર કે ઓફિસ સ્ટાફની. આજે તે લોકો બાબતે શેઠોમાં એક ભયંકર ગેરસમજ વર્તે છે. શ્રીમંતો તે નોકર વિગેરેને માત્ર પગાર આખ્યા બાદ પોતે તેને ખરીદી લીધાનો જ અનુભવ કરે છે. વધુ કામ, યોગ્ય કારણે પણ રજા ન આપવી, તેની કોણુંબિક મુશ્કેલીમાં સહાય ન કરવી આ બધું શું યોગ્ય છે ? તમે નોકર હોવ અને કોઈ શેઠ તમારી સાથે આવો વ્યવહાર કરે તો તમને કેવું લાગત ? તમારા મન પર એ શેઠ પ્રત્યે કેવી છાપ પડત ? બસ, તમારો સ્ટાફ તમારા માટે આવી જ છાપ મનમાં સંધરી બેઠો છે. જે તમારા માટે ખતરનાક પૂરવાર થઈ શકે છે. વાસ્તવિકતામાં પગાર આપવો એટલે કે એ વ્યક્તિને કંપનીના નફામાં (ભલે ખૂબ થોડા અંશે !) સહભાગી બનાવવો. અને તેના કામની ગુણવત્તા વધે તો પાર્ટનરશીપ (અર્થાત્ પગાર વધારવો) વધારવી. ગુણવત્તા ઘટે તો પાર્ટનરશીપ છોડી દેવી અર્થાત્ નોકરીમાંથી છૂટો કરવો. તમે જ્યારે આ નિતિથી કામ કરશો ત્યારે તમારી પેઢી, તેને પોતાની લાગશે. અહીં વધુ કામ કરીશ તો મને પણ વધુ પૈસા મળશે. એમ માન્યતા દઢ થશે પછી તેના કામની કવોલિટી સુધારવા તમારે કહેવું ન પડે તો સામેથી જ મહેનત કરવા લાગે. આ તમારો આશ્રિત છે. તેને માત્ર પૈસાની જ નહીં પણ કારણ-સંજોગ ઉભા થાય ત્યારે રજા પણ જોઈએ. એ વખતે સકારણ રજા માંગે ત્યારે રજા આપવી એ પણ આશ્રિતને પોષવાનો જ પ્રકાર છે. માંદગી, પ્રસંગ, વ્યવહાર સાચવવા આદિ ઘણી બાબતોમાં તમે તેને રજા ન આપીને કે પગાર કાપીને હેરાન કરો છો. જે ધરાર અયોગ્ય છે. એક બીજાવાત, તમે તમારા સ્ટાફને પગાર કેટલો આપો ? શું તમે ઉ-૪ હજારના પગારમાં ઘર-ગુજરાન ચલાવી શકો ? નહીં ને ? તો તે કેવી રીતે ચલાવતો હશે ? અને માટે જ તે માણસ બીજા આડા માર્ગ (ક્યો તમે સમજો છો !) પૈસા મેળવવા પ્રયાસ કરે છે.

સામેનાની ક્ષમતા સાવ નબળી હોય કે તમે ધૂમ કમાણી ન કરતા હો તો વાત અલગ છે. પણ તમારી કમાણીની સીમા નથી તો તેને ઘર-ગુજરાન ચાલે તેટલું તો આપો ! આ ભવમાં પૂછ્ય છે તો શેઠ બન્યા છો પણ આવતા ભવમાં પાપોદય હશે તો નોકર થશો. તારે જો અત્યારે સારો પગાર આખ્યો હશે તો તમને'ય આવતા ભવમાં સારા શેઠ મળશે. અત્યારે તમે તમારા નોકરને ચૂસ્યો હશે તો બીજા ભવની હાલત વિચારી લેજો. અસ્તુ. આ વાતો શેઠ માટેની છે. જે નોકરીયાત છે. તેને આ બધુ વાંચીને શેઠને શીખવવાના બદલે પોતે નિતિમત્તાથી કામ કરે જવું જોઈએ અને પુત્ર પરિવારરૂપ આશ્રિત જનને પોષવાનું કર્તવ્ય નિભાવવું જોઈએ પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવનારને વધુ સારુ સ્થાન, સમૃદ્ધિ, સુખ, સદ્ગુણ આદિ પ્રાપ્ત થાય છે. માટે સુખી થવાની ઈચ્છા કરનારા પ્રત્યેકે આશ્રિતોને પાળવા પોષવા રૂપ ગુણને જીવન વ્યાપ્ત કરવો.



દીર્ઘદા થવું

માણસને લોંગ ડ્રાઇવની મજા ગમે છે. પણ માણસને લોંગ થિંકની મજાની ખબર જ નથી. ટૂંકી વિચારસરણી એ દુઃખનો માર્ગ છે. અને માટે જ સુખી થવાના છિફ્ફિસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે કહ્યુ છે કે દીર્ઘદિષ્ટા થવું. દીર્ઘદિષ્ટાએ માનવને પ્રત્યેક કાર્યમાં સફળતા અપાવનાર ચીજ છે. બીજી ભાખામાં કહીએ તો દીર્ઘદર્શિપણું એ આપણને કાયમ સુખના રસ્તે ચલાવવાનું સામર્થ્ય ધરાવે છે. સંસારમાં જીવો છો તો સંસારના પ્રશ્નો જ તમને મુંજવવાના, માટે સંસારના પ્રશ્નો ઉકેલવા માટે તમને દીર્ઘદર્શિતા કેવી રીતે કામ લાગે છે તે જોઈએ. Ex. તમે કોઈ નવી શ્રીમંત વ્યક્તિ સાથે મિત્રતા કરી. મિત્રતાના નાતે તેની સાથે ઉઠક-બેઠક, ખાંડી-પીણી, ફરવા જવાનું બધુ જ ચાલુ થયુ તેવા વખતે તમને તે શ્રીમંત વ્યક્તિના અમુક ખરાબ મિત્રો, ખરાબ હુર્ગુણો કે તે નવા શ્રીમંત મિત્રની ખરાબ છાપ બાબતે જાણકારી પ્રાપ્ત થઈ અને તે વાત સાચી છે તેવા પુરાવા પણ મણ્યા. તો તે શ્રીમંત મિત્રના કારણે તમને ગાડીઓમાં ફરવા કે મોટી ગ્રાંડ હોટલોમાં ફરવા (રખડવા) મળતુ હોય તોંય તે મોજ-મજા છોડી દેવી તે તમારી દીર્ઘદર્શિતા છે. બાકી અત્યારે આ મિત્ર સાથે મફતમાં મજા કરવા મળે છે તો કરો જલસા. પાછળ પછી કોઈ જોખમ આવશે ત્યારે મિત્રતા છોડી દઈશું કે ‘પડશે એવા દેવાશે’ એમ વિચારીને તેની સાથે મિત્રતા ટકાવી રાખવી એ તમારી ટૂંકી બુદ્ધિનું પરિણામ છે. અને આના કારણે તમે જીવનમાં ન કલ્પેલા દુઃખોની ખાણમાં દુલી જાઓ

**Do NOT judge
by appearances;
a RICH *heart*
may be under a
POOR coat.**

- Scottish Proverb -

www.vivayheatdaughtex.com

તેવી પૂરી શક્યતા છે. કારણ કે સામેની વ્યક્તિ સાથે તમે જે સુખ(મોજ-મજા) માઝો છો. તે વ્યક્તિ પર પોલિસ કેસ, દુશ્મનોની ચડાઈ કે અન્ય કોઈ પણ મ્રકારની દુર્ઘટના એકાએક થવાનો પૂર્ણ સંભવ છે. જો તમે સાથે હશો કે સંબંધ પણ રાખતા હશો તો તે વ્યક્તિના ખોટા કામોમાં તમે પણ ગુનેગાર તરીકે શિક્ષા પામી શકો છો. આ કપોળ કલ્યિત વાત નથી ઘણી જગ્યાએ બની ચૂકેલી ઘટનાઓ છે. માટે દોસ્તી કરતા પૂર્વે તે વ્યક્તિના કેરેકટર (ચારિન્ય) બાબતે ચોક્કસ ચકાસણી કરવી જોઈએ. એ જ રીતે તમારા ઘરમાં કોઈ બાબતે મોટો જગડો થાય તો આ જગડાને કોર્ટ-મેટરનું સ્વરૂપ આપી કોર્ટના ઘક્કા ખાઈ પૈસા-સમય બજેનો વેડફાટ કરવો એ મૂર્ખાંભી ભર્યું ફૂટ્ય છે. આ રીતે કોર્ટમાં પૈસા વેડફલાથી તમારા અને સામેના પક્ષના બજેના દુઃખમાં અને દરિદ્રતામાં વધારો થાય છે. આના બદલે બે-ચાર ડાયા માણસની સલાહ મુજબ સમજાવટથી થોડું જતુ કરીને પણ તમે જો સમાધાન કરી લીધું હોત તો આ તકલીફ ન થાત. તમે કોર્ટના ચક્કરમાં પડ્યા પછી બહાર નથી નીકળી શકતા. અને કદાચ બહાર નીકળો તો'ય ત્યારે તમારી હાલત બહુ જ ભૂંડી થઈ હોય છે. પણ આ બધું તમે શાંત-ચિંતે બેસીને અને દીર્ઘદર્શિતા પૂર્વક વિચારો તો જ સમજાય માત્ર અહંકારને વશ થઈને તમે કોઈની સામે પ્રતિકાર કરવા ફૂઢી પડો છો. ત્યારે તમારી સૂજ અવરાઈ જાય છે. અને તમે નુકશાની ભોગવો છો. આ આદત સુધારવાથી તમને જ ફાયદો થશે. તમારી દણ્ણ જેટલી વિસ્તરશે એટલો તમને ફાયદો થશે. તમારી દણ્ણ આમ તો હજુ આ લોક સંબંધી પણ પૂર્ણ વિકસી નથી. પણ જો તમારે ખૂબ-ખૂબ સુખી થવું હોય તો તમારી દણ્ણ પરલોક અને મોક્ષ સુધી પણ વિસ્તારવી જોઈએ. જો તમને આ સંસારના ધન, મકાન, ગાડી, પત્ની, પરિવાર બહુ જ છોડીને ચાલ્યા જવાનો વિચાર પણ આવશે તો'ય તમારી તેના પ્રત્યેની આસક્તિ તૂટવા લાગશે. અને જો તમારી આ આસક્તિ તૂટશે તો રાગના કારણે થતી કર્મબંધ (પાપ) ની પરંપરા પણ તૂટશે. આ પાપો ઘટવાથી દુઃખની માત્રામાં પણ ઘટાડો થવાનો જ. માટે સંસારની આસક્તિ તોડવી એ પણ દુઃખ ઘટાડવાનો ઉપાય છે. જે જગતના જીવમાત્રાને ઠંઘણીય છે. માટે આ રીતે દીર્ઘદર્શિતાને આટલી વિસ્તૃત બનાવવી જોઈએ. આવી દીર્ઘદર્શિતા જ તમને સર્વત્ર સુખી કરશે. આવી દીર્ઘદર્શિતાથી જ તમારા કાર્યો સફળ થઈ શકશે. બાકી ટૂંકાગાળાના લાભોમાં અટવાઈ જવાથી આપણાને તાત્ત્વિક ફાયદો થતો નથી. ટૂંકીબુદ્ધિથી

થતા લાભોમાં અટવાવવાથી આપણને દીર્ઘદર્શિતાના ગુણનો વિકાસ કરવાની ઈચ્છા પણ થતી નથી. જે બહુ મોટો ગેરલાભ છે. માટે સુખી જીવનને ઈચ્છનારા પ્રત્યેક માનવે શ્રમજી ભગવાન મધાવીર પ્રરૂપિત સુખી થવાના તમામ ગુણો પ્રગટાવવા જોઈએ એમાં પણ દીર્ઘદર્શિતાના ગુણને વિશેષરૂપે પ્રગટાવી સુખી બનો.

No man can tell whether
he is rich or poor by
turning to his ledger.
It is the heart that
makes a man rich.

૨૮

વસ્તુના તારતમ્યને જાણવું

પ્રત્યેક વ્યક્તિને પોતાની પસંદગી ભિન્ન-ભિન્ન હોય છે અને એ ભિન્ન ભિન્ન પસંદગીવાળી વ્યક્તિઓ પોતાની જ પસંદને સાચી કે સારી માને છે. આ ભૂલ હુઃખનો માર્ગ છે. અને માટે જ સુખી થવાના સત્યાવીસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે ભાષ્યુ છે કે ‘વસ્તુના તારતમ્યને જાણવું’

હુનિયામાં આજે જે વસ્તુનું માર્કિટિંગ વધુ થાય તે જ વહેંચાય છે. સારી ગુણવત્તાએ માલ વેચાણ માટે જરૂરી ચીજ હતી. (છે નહીં !) આજે તો સારી જાહેરાત એ જ માલના વેચાણ માટે મહત્વની ચીજ બની રહી છે. અને આ જાહેરાતોની આકર્ષક-લોભામણી વાતોમાં આવી જઈને તમે ખોટી વસ્તુ લઈ આવી હુઃખી બનો છો. કોલગેટ, પેપ્સોડાન્ટ કે બીજી કોઈ પણ ટૂથપેસ્ટ એ દાંત માટે ફાયદાકારક નથી. માત્ર ને માત્ર તોકટરોને ખરીદી લઈને અને ટી.વી. પર જાહેરાતો મુકીને મલ્ટીનેશનલ કંપનીઓના માટે ફાયદાકારક ટૂથપેસ્ટો તમારા ખીસસા ખાલી કરવા જ બનાવાય છે. દાતણ જેટલી સુપરશક્તિશાળી, ડિસ્પોસેબલ અને દાંત માટે ફાયદાકારક ચીજ આ વિશ્વમાં કોઈ બનાવી શકે તેમ નથી. પણ લીમડા કે બાવળના ઝડ પાસે (એડવેટાઈઝના) જાહેરાત કરવાના પૈસા નથી માટે તે વેચાતા નથી. ખાદી બંડારના સ્વદેશી વસ્ત્રો કદાપિ વિદેશી



કે ફેકટરીના કાપડ કરતા ઉત્તરતા હોતા નથી. તો શા માટે તે નથી વેચાતા? કારણ કે ગાંધી હાટ પાસે જાહેરાતના પૈસા નથી. આ તો બે ચાર નમૂના છે. આવી તો ઢગલાંધ બાબતો એવી છે કે જે તમે માત્ર જાહેરાત જોઈને ખરીદવાના કારણે સારી ગુણવત્તાવાળી વસ્તુ ગુમાવી બેસો છો. આ જાહેરાતોના કારણે વસ્તુના તારતમ્યને જાણવાની તમારી ક્ષમતા અને ઈચ્છાશક્તિ બને ઘટ્યા છે. લોકો જે ખરીદ તે લેવાનો ગાડરીયો પ્રવાહ વધ્યો છે. આ કારણે જ દાંત, વાળ, સ્ક્ઝિનના રોગો કે બજારમાં જે-તે બંકોમાં નંખાતા રૂપિયા ગુમાવાના ડિસ્સા વધતા ગયા છે. શા માટે આવું? તમારા પૈસા ખર્ચને તમારા ખુદના વપરાશ માટે તમારે જાતે ખરીદીને લાવવું છે તો તેમાં તમે શા માટે પેકિંગ કે માર્કેટિંગને મહત્વ આપો છો? આનાથી ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ તમારા ઘરમાં આવે છે તમારા ઘરને અને શરીરને અભદ્રાવે છે. આના બદલે સાત્વિક, શુદ્ધ ચીજ-વસ્તુઓ જ વાપરવાનો આગ્રહ રાખો તો પૈસા અને આરોગ્ય બધું જ બચે. કોઈ પણ બે સરખી વસ્તુ બિન-બિન સ્થળેથી મળતી હોય તો સૌ પ્રથમ તેમાં વપરાતા રો માર્ટિરિયલ અર્થાત્ કાચા-માલ બાબતે જાણવું જોઈએ. શેમાં સારા દ્રવ્યો આવે છે? આ સારા દ્રવ્યો જેમાં આવતા હોય તેવી ચીજ ખરીદવી એ તમારા માટે ફાયદાકારક છે. કારણ કે દ્રવ્યશુદ્ધ તમારી મનશુદ્ધિ પર પણ અસર કરે છે. ખરાબ દ્રવ્યોથી નિર્ભિત ચીજોનો વપરાશ માનસિક અશુદ્ધિ પણ વૃદ્ધિગંત કરે છે. આ દુર્વિચારોનું ઉત્પત્તિસ્થાન છે. માનવ વસ્તુના તારતમ્યને જાણ્યા વિના હલકી ગુણવત્તાનો માલ વાપરે છે. તે તેના આત્મા માટે પણ હાનિકારક છે. પાપોની પરંપરાને સર્જનાર છે. માટે ભૌતિક ક્ષેત્રે તમામ ચીજોમાં વસ્તુના તાર-તમ્યને જાણીને ત્યાર બાદ ઉચ્ચિત વ્યવહાર કરવો જોઈએ.

એ જ રીતે સામાન્ય સંસારી માણસ અને સંતપુરુષ એ બે વચ્ચે પણ તરતમતા રહેલી છે. આ તારતમ્ય પણ જાણવું જોઈએ. એક સજજન સામાન્ય વ્યક્તિ સાથે રાખેલો સંબંધ તમને આર્થિક મદદ જ કરી શકશે. પણ એક સંત પુરુષ સાથેનો સંબંધ તમને આધ્યાત્મિક મદદ કરી શકે છે. આધ્યાત્મિક મદદ એ તમને આ ભવ અને પરબ્રવ બનેમાં ઉપયોગી થઈ શકે છે. સંસારીમાણસ તમે માંદા પડશો તો દવાની વ્યવસ્થા કરી શકશો. પણ આરોગ્ય માટે જરૂરી પૂર્ય તો સંતોના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે. કારણ કે સંતનો ઉપદેશ એ તમારા જીવનમાં સારા કાર્યો પ્રત્યેની ઈચ્છા જગાડે છે. અને સત્કાર્ય

દ્વારા જ પુષ્ય બંધાય છે. પુષ્યશાળી વ્યક્તિને રોગ જ થતો નથી. તો દ્વાની જરૂર શું? અને રોગમાં પણ સમાધિ, ઉદ્ઘેગ રહિતતા રાખતા તો સંત જ શીખવાડે છે. માટે સંત પુરુષ અને સામાન્ય જન વચ્ચે ઘણું તારતમ્ય રહેલું છે. તે તારતમ્ય સમજીને જે શ્રેષ્ઠ છે તેની સાથે તે મુજબનો વ્યવહાર કરવો જોઈએ. વિશ્વ આખા'યમાં જ્યારે 'સમાનતા' અને ઉચ્ચા-નીચના ભેદભાવની મનાઈ ફરમાવાનો પવન ઝૂંકાયો છે. ત્યારે યોગ્ય સ્થાને ભેદરેખાઓ પાળવી જ જોઈએ તેવું પવિત્ર હિન્દુ સંસ્કૃતિનું વચન યાદ કરવા જેવું છે. અને આ ગુણને પામેલ માનવ કદાપિ કોઈ વ્યક્તિ સાથે અન્યાય કરી બેસતો નથી માટે વસ્તુના તારતમ્યને જાણી સુખી બનો.



30


કૃતક્ષતા સંપત્તિ રહેવું

‘આભાર’ જેવા શબ્દો આપણું કામ કરી આપનાર ઉપકારી પ્રત્યે ફૂતજ્ઞભાવ વક્ત કરવા વપરાય છે. આજની નવી પેઢી ‘થેંક્યુ’ કે ‘થેંક્સ’ શબ્દો દ્વારા પણ વેસ્ટર્નભાષામાં ભારતીય સંસ્કૃતિની આભારવિધિ જ કરતા હોય છે. અને આ ‘આભાર’ ની ભારદાર વાત સુખી થવાના ૨૮ માં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીર કહે છે કે ‘ફૂતજ્ઞતા સંપત્ત રહેવું’. જગતમાં ગમે તેટલો અહંકાર કરનાર વ્યક્તિ કે ગમે તેટલો પોતાની જાતને મહાન સમજનાર વ્યક્તિ પણ કદી પોતાના ચઘ્યલ જાતે બનાવી શકતો નથી કે કપડા જાતે સીવી શકતો નથી કે પોતાનું ઘર જાતે બનાવી શકતો નથી કે બસ .. બસ આ કે આવી ઢગલાંધ બાબતો જગતના બુદ્ધિમાન પ્રતિષ્ઠિત લોકો પણ પોતાની જાતે કરી શકતા નથી. અર્થાત્ આવા કાર્યો તેમને તેમના સેવકો કે તેમની આસ-પાસના કારીગરો જ કરી આપે છે. જો કે તે બધા પૈસા લઈને જ કામ કરે છે પણ આ કામ બાબતે પૈસા ન લઈને ના પાડત તો તે શું કરત ? શું સામેની વ્યક્તિ આવા કાર્યો જાતે કરી શકત ? ના જરાય નહીં. માટે જ તે દરેકનો આભાર માનવો એ માનવની ફરજ છે. જે વ્યક્તિ આપણા પર ઉપકાર કરે છે તે વ્યક્તિના ઉપકારને યાદ રાખવો એમાં આપણે નવું કશું નથી કરતા આ તો આપણી પવિત્ર ફરજ છે. અને સમય આવે ઉપકારીએ કરેલ ઉપકારનો બદલો તેના પર એક કે બીજી રીતે ઉપકાર કરીને વાળવો એ આપણા સ્વભાવમાં રહેલી સજજનતા છે. જે મા-બાપે આપણને જન્મ આપ્યો તે આપણા ઉપકારી. જે શિક્ષકોએ આપણને ભણાવ્યા તે પણ ઉપકારી. જે મિત્રો આપણને ખોટા માર્ગ જતા અટકાવે કે સારા માર્ગ બેંચી જાય તે પણ ઉપકારી (આનાથી ઉંધા મિત્રો હોય તો અપકારી કહેવાય !) જે વ્યક્તિએ આપણને નોકરી-ધ્યાનમાં સેટ કરી આપ્યા તે પણ ઉપકારી. અરે ! આ ઉપકારીઓની શુંખલા તો

કદીય પૂર્ણ ન થાય તેટલી લાંબી છે. તમે યાદ કરે જ જાવ તમને યાદ આવ્યા જ કરશો. આ તમામને યાદ રાખવા તે મળે ત્યારે તેમનું ઉચિત સન્માન કરવું જોઈએ. અને આપણા પર અન્યોએ ઉપકાર કર્યો તો જ આપણું અસ્તિત્વ ટક્કું. અને આ રીતે જે ઉપકારની પરંપરા ચલાવીશું તો જ આપણી નવી પેઢી આ રીતે બીજાને સુખી કરવાનું શીખશે. અને તો જ તેનામાં સારા સંસ્કાર પડશે. માટે કૃતજ્ઞતાના ગુણને વિકસાવવો એ ખૂબ જરૂરી બાબત છે. એ જ રીતે જે લોકો આપણી સાથે ગંદી રમત રમ્યા હોય અને જેમણે આપણો વિશ્વાસધાત કર્યો હોય, તેવી વ્યક્તિ સાથે સંબંધ ન રાખવો જોઈએ. તેવી વ્યક્તિથી ચેતીને દૂર રહેવું જોઈએ. અને આપણી સલામતી માટે યોગ્ય પગલા જરૂર લેવા જોઈએ પણ કંઈ તેવા દુર્જનલોકો સામે બદલો લેવાની દુર્ભાવના ન રાખવી. કારણ કે આનાથી તો તમે પણ તેના જેવા દુર્જન બનો છો. કોઈને પીડવો, ચૂસવો આવા નિયમ કૃત્ય તમારા જેવા સજજનને ન શોભે. તેમાં આપણો ધરમ લાજે શા માટે આપણે બદલો લેવાની દુર્વૃત્તિ રાખવી જોઈએ ? આ બદલો લેવાથી આપણને શું મળશે ? સામેની વ્યક્તિ કાંઈક ગુમાવશે પણ તમને તો કશું નથી જ મળવાનું તો પછી શા માટે આવું દુષ્કૃત્ય કરવું પડે ? યાદ રાખજો, જે માણસ બદલો લેવાની દુર્વૃત્તિ રાખે છે. તે દુનિયા બદલી શકતો નથી. અને જે વ્યક્તિ દુનિયા બદલી શકે છે. તે બદલો લેવાની નાની-નાની (ક્ષુલ્લક) બાબતોમાં પોતાનો સમય ગુમાવતો નથી. આપણે પણ આ યાદ રાખવું જોઈએ કે આપણી પાસે કોઈને

EGO - KILL IT
LOVE - VALUE IT
SMILE - KEEP IT
GOSSIP - IGNORE IT
SUCCESS - ACHIEVE IT
JEALOUSY - DISTANCE IT
KNOWLEDGE - ACQUIRE IT
CONFIDENCE - TRUST IT

કન્ડવા સિવાય ઘણા સારા કામો કરવાના પડ્યા છે. આ કામો કરવાથી બદલો લેવાની વૃત્તિ ઓસરી જાય છે. શ્રમણ ભગવાન મહાવીરે દુશ્મનને મારવાનો નહીં પણ દુશ્મનાવટ ખતમ કરવાનો સુંદર ઉપદેશ આખ્યો છે. આ સુંદર બોધ અપકારી પર પણ ઉપકાર કરતા શીખવે છે. સ્વયં ભગવાન મહાવીરે પણ પોતાને ઉંખ મારનાર ચંડકૌશિક નામના ભયંકર સર્પને ‘બુજ્જ-બુજ્જ’ કહેવા દ્વારા શાંત કરીને અહિંસાનો પાઠ ભણાવ્યો હતો. નિઃસ્વાર્થ અને નિઃર હૃદયથી બોલાયેલ આ શબ્દોથી સર્પ જેવા કોધી જીવ પણ અહિંસા પ્રેમી થયેલ અને તેને પોતાના જીવન પર મહાવીરે કરેલ ઉપકારને ફૂતજાભાવે યાદ રાખેલ. જો પ્રાણીમાં પણ ફૂતજાતા ગુણ આટલો સુંદર વિકસતો હોય તો માણસમાં તો કેટલો સુંદર વિકસવો જોઈએ ? માટે ફૂતજાતા ગુણ પ્રગટાવી સુખી બનો.



39

લોકપ્રિય થવું

oo

માણસનું સૌથી ભયંકર હુઃખ કર્યું? તમારે મન આર્થિક સંકડામણા, રોગીદેહ, કંકાસવાળી પત્નિ કે દુર્ગુષી પુત્ર એ ભયંકર હુઃખ હશે પણ તમે શાંત ચિંતે વિચારશો તો તમને લાગશે કે લોકમાં અપ્રિય થઈ પડવું એ વધુ હુઃખદાયિ બાબત છે અને માટે જ સુખી થવાના ઓગણતીસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે જણાવ્યું છે કે લોકપ્રિય થવું. જો માણસ લોકપ્રિય હશે તો દુનિયાના તમામ સુખ તેના હાથમાં હશે. લોકપ્રિય એટલે બહુજન માન્ય અર્થાત્ ગામ શહેર કે સમાજની મોટાભાગની વ્યક્તિઓને પ્રિય થયેલ વ્યક્તિ. આવી વ્યક્તિને આર્થિક સંકડામણામાં ટેકો આપનારા પણ મળી રહેશે. આવી વ્યક્તિને રોગમાં સહાનુભૂતિ દર્શાવનારા પણ મળી રહેશે કે ઘરની વિકટ પરિસ્થિતિમાં માર્ગ સૂઝાડનારા કે પડખે ઉભા રહેનારા પણ મળી રહેશે.

કિન્તુ તે વ્યક્તિએ લોકપ્રિય બનવા ઘણું મોટું યોગદાન આપવું પડે છે. જાતને જગત માટે ઘસી નાખવી પડે છે. તેવા લોકો જ લોકપ્રિય બની શકે છે. બાકી, પોતાનું ઘર સંભાળીને બેસી રહેનારા કે પારકા માટે પ પૈસા'ય ન ઘસારો વેઠનારા કદી પ્રિય ન બની શકે. લોકપ્રિય બનવા સૌપ્રથમ નિંદાનો ત્યાગ આવશ્યક છે. કોઈ પણ વ્યક્તિની નિંદા કરવાથી તે વ્યક્તિને તમે અપ્રિય થાઓ છો. સંસારની પ્રત્યેક વ્યક્તિમાં દુર્ગુણ તો રહેવાના જ. તેનામાં દુર્ગુણ છે તો તમારામાં નથી? તમારામાં પણ છે તો તેના દુર્ગુણ તેને જગજાહેર કરવા માટે તમે શા માટે મહેનત કરો છો? આનાથી તમારી લોકપ્રિયતાને હાનિ પહોંચે છે. જે તમને લાંબાગાળે દૃષ્ટિ કરે છે.

લોકપ્રિય બનવા બીજી જરૂરી બાબત છે અન્યોને સહાય કરો. પ્રત્યેક વ્યક્તિ પાપના કારણે દુઃખી થાય જ. અને જ્યારે દુઃખી થાય ત્યારે તે વ્યક્તિ નિરાશામાં ડુલ્ચી

જાય છે. આવા દુઃખના સમયે મદદ કરવી તે લોકપ્રિય બનવાનો રામભાણ ઈલાજ છે. કારણ તે વખતે તેનો હાથ પકડનાર અન્ય કોઈ હોતું નથી. નિઃસ્વાર્થભાવે સહાય કર્યા કરવાથી ફળ અવશ્ય મળે જ છે. કલકત્તામાં આજથી ૧૦-૧૨ વર્ષ પૂર્વે એક ટાંગા (પેંડલરીક્ષા કે જેમાં પાછળ લોકો બેસી શકે) વાળો રહેતો હતો. તે પેંડલરીક્ષામાં અન્ય મુસાફરોને એક સ્થાનથી બીજે સ્થાન પહોંચાડી મહેનતાણું મેળવતો. મેં સગા કાને સાંભળેલી અને સગી આંખે વાંચેલી આ વાત છે કે તે મૃત્યુ પાખ્યો ત્યારે તેની અંતિમ યાત્રામાં ૮ થી ૧૦ હજાર !!! માણસ આવેલ. એક શ્રીમંત કરતાં'ય વધુ જનતા તેની શમશાનયાત્રામાં સ્વયંભૂ રીતે આવેલ. છાપા અને ટી.વી. ચેનલોએ આ ન્યૂઝ સારી રીતે ચમકાવેલા. શા માટે આવા સામાન્ય માણસની શમશાનયાત્રામાં આટલી અધધધ !!! પછ્લીક ? કારણ કે તેનો નિયમ હતો કે કદી ગરીબ મુસાફર પાસેથી પૈસો ન લેવો તે ગરીબોને મહિતમાં એક સ્થાનેથી બીજે પહોંચાડતો અને મહેનતના કમાયેલા પૈસામાંથી બચતની મૂડીને બેંક બેલેન્સ ન કરતો પણ ગરીબ બાળકોને પૌષ્ટિક ખોરાક લાવી આપવા માટે વાપરતો. આમ, તે કલકત્તાની પ્રત્યેક જૂપડપણીમાં સન્માનનું સ્થાન બનેલ અને તેના મૃત્યુની ખબર જૂપડપણીમાં પડી તેની સાથે ત્યાંથી તમામ લોકો તેની અંતિમ યાત્રામાં ઢોડી આવી. આજે તો તેના દ્વારા સહાય પામેલ ગરીબોને મળીને તેના સંબંધી વિગતો પ્રાપ્ત કરી એક લેખકે બંગાળીભાષામાં તેના વિષે પુસ્તક પણ લખ્યાનું સાંભળવા મળે છે. (પારકા માટે ૫ પૈસા'ય ન ઘસાનારા ઉપરની સત્યઘટના ફરી વાંચે !!!)

આ કહેવાનું કારણ એ કે જે વ્યક્તિ લોકપ્રિય હોય તે ઘણા મોટા સન્માન પામી શકે છે. એ વ્યક્તિને દુઃખી બનવાનું, ડિપ્રેશનમાં આવવાનું લગભગ રહેતું નથી. આખર, તમે ધર્મના માર્ગ ચાલો તો જ સાચા અર્થમાં લોકપ્રિય બની શકો. કારણ જ્યાં સુધી

તમે કોઈનો વિશ્વાસધાત કરો છો કે કોઈની સાથે છેતરપિંડી કરો છો ત્યાં સુધી તમે જનતાને પ્રિય ન થઈ શકો. સજજનતા પૂર્વક કોઈને છેતરવા નહીં આ ધર્મનો માર્ગ છે. ધર્મ માત્ર કિયાકંડ કે મૂર્તિપૂજામાં સમાયેલ તત્વ નથી. કિયામાર્ગ અને મૂર્તિપૂજા તો ધર્મનો એક ભાગ છે. તે જ રીતે સદાચાર, વિશ્વાસપ્રતિપાદન, દયા, ક્ષમા આદિ પણ

ધર્મના જ એક ભાગ છે. આવા અનેક વિભાગો (અહીં ન કહેલા પણ) એકત્ર થાય ત્યારે સાચો ધર્મ સિદ્ધ થાય છે.

આ વિભાગોમાંથી એકા'દની પણ ગેરહાજરીએ ધર્મની મૂળભૂત વાસ્તવિકતાથી દૂર રાખનાર છે. માટે આ તમામ માર્ગો પર ચાલવું તે ધર્મના માર્ગ ચાલવા સ્વરૂપ છે. આ વાત જ્ઞાણી-સમજ જીવનમાં ઉતારવી એ સુખી થવાનો માર્ગ છે.

સારી રીતે નિર્દ્દ્દર્શિત ધર્મ આચરનારા લોકો કદિ પણ અપ્રિય હોતા નથી છા !
પૂર્વના પાપોદયના કારણે કયારેક કો'ક ભક્તાત્મા લોકોમાં અપ્રિય થઈ પડે એ વાત અલગ છે. પણ જનરલી કોઈ પણ ધર્મપુરુષ અર્થત્તુ માત્ર મંદિર જનારો નહીં પણ ભગવાનમાં પૂર્ણ આસ્થા રાખવા સાથે ભગવાનની જ આશા સ્વરૂપ સરકળ જીવોને સહાય કરનારો, દુશ્મનને ક્ષમા આપનારો,
પાપાચારોથી દૂર રહેનારો ભક્ત પ્રાયઃ કદિ
અપ્રિય હોતો નથી એ કાયમ તમામને
(જગતના જીવમાત્રને) પ્રિય જ થાય છે. અહીં
લોક પ્રિયતા પ્રાપ્ત કરવા માટે અન્યોને માટે
ઘસાવાનું નથી પણ લોકો માટે નિઃસ્વાર્થ ભાવે
સેવા કરવાથી લોકપ્રિય થવાય છે. એમ
માનવાનું છે.

તો લોકપ્રિયતાના આ ગુણને જ્ઞાણી-
સમજ જીવનમાં ઉતારી સુખી બનો.





ଲଜ୍ଜାରୁ ଥିଲୁ

બિન્દાસ જીંદગી જીવવી એ વેસ્ટર્ન દેશોમાંથી આયાત કરેલી ચીજ છે. આજની જનરેશનની લાઈફ સ્ટાઇલમાં આ કુટેવ વણાઈ ગયેલી છે અને તે દુઃખી કરનાર છે તેવું અનુભવાય પણ છે આથી જ સુખી થવાના ત્રીસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે લજજાળુ થવું. લાજ-શરમ મર્યાદા આપણી અંગત મૂડી છે. સંસ્કારી વ્યક્તિ તરીકેનું સિખ્બોલ છે. મર્યાદા ઓળંગેલ સમુક્ર પણ તારાજ સર્જ છે તો લક્ષ્મણ રેખાની બહાર પગ માત્ર મૂકનાર સીતાજ રામાયણ પ્રણેતા બન્યા હતા. અને માનવી પણ લાજ મૂડીને કૃત્ય કરે ત્યારે તે સભ્ય સમાજમાં ઉપેક્ષારૂપ જ બને છે. માટે લજજા એ માનવને અનેક ખોટા કામમાંથી બચાવનાર સદ્ગુણ છે. એક વ્યક્તિના પૈસા તમે દબાવી દીધા તમારી પાસે હાલ પૈસા હોવા છતાં પાછા આપતા નથી. તે વ્યક્તિની તાકાત તમારાથી ઓછી છે તેનો ગેરલાભ તમે ઉઠાવો છો અને તમને ખબર પડે કે આ વાત બજારમાં વાયુવેગે પ્રસરે છે ત્યારે તમારામાં થોડી-ઘણી લાજ-શરમ હશે તો'ય તમને એમ થશે કે શા માટે આમ આબરૂ ગુમાવવી ? મારે પૈસા આપી દેવા જોઈએ અને અણહક્કના રૂપિયા પ્રત્યેનું મમત્વ તમને લજજા નામનો સદ્ગુણ છોડાવશે. આખર, અણહક્કના કોઈને રીબાવીને કમાયેલ પૈસા તમને રીબાવી-રીબાવીને મારે છે એ પૈસા તો રોગની સારવાર આદિમાં ડોક્ટરના ખીસા ભરવા જ વપરાઈ જાય છે. તમે માનો કે ભલે બે નંબરના હતા પણ પૈસા હતા તો દવા કરાવવા કામ લાગ્યા. અરે મૂરખ ! આ ખોટા રૂપિયા હતા એટલે જ તને રોગ આવેલ અને તમે જ વિચારો કે કોઈની 'હાય' લાગેલા રૂપિયા તમારા જીવનમાં 'હાય' ન લગાડે ? આ લોભવૃત્તિ પર સ્વયં કંન્ટ્રોલ કરવો જોઈએ, કદાચ એ ન કરી શકો તો'ય તમારે લાજ-શરમ તો રાખવી જોઈએ. પૂર્વે

કષ્યુ તેમ લજજાળુ વ્યક્તિ ઘણા પાપકાર્યોથી અટકી જાય છે. આજનો જમાનો બેકાબૂ બન્યો છે. અભદ્ર દશ્યોની શુંખલા આપણી નજર સામે આપણી અનિયા હોય તો'ય આવ્યા કરે છે. આ વ્યાનિચારના જાલિમ પાપો લજજા વિહિન વ્યક્તિ જ કરી શકે. પૂર્વના કાળમાં હુર્જનોને જે કૃત્યો કરવા માટે કાળા અંધારાની રાહ જોવી પડતી, તેવા અત્યંત નિંદા કૃત્યો આજે ભરબજરે, અજવાળાના વાતાવરણમાંય સહેજે થયા કરે છે અને તેને મનોરંજનના બહાના હેઠળ સ્વીકૃતિ પણ અપાય છે. આ પતન કયાં સુધી થતુ રહેશે ?

નારીમાં તો લજજા વિશેષરૂપે હોવી જોઈએ. પુરુષની સાથે ખબે-ખભા મિલાવીને નારી કામ કરી શકે તેવી સુવિધા પૂરી પાડવાનો દાવો કરનારા ભીત ભૂલે છે. હીરાના દાગીના તો તિજોરીમાં જ શોભે. હા ! તેનો ઉપયોગ કરાય પણ રોજ-રોજ નહી અને અસલામત સ્થળે તો બિલકુલ નહી. ભારતીય પરંપરા નારીને હીરાના દાગીનાથી'યે મૂલ્યવાન ગણે છે માટે જ ઘરની બહાર ન નીકળવાની વાત તાં કરી છે. આ બળજબરીથી લાદેલી બેરી ન હતી પણ સ્ત્રીની સુરક્ષા માટે વપરાયેલા તાળુ-ચાવી હતા. પૂર્વના કાળમાં બળાત્કાર કે નારી ત્રાસના બનાવો કરતા આજે વધ્યા જ છે. પૂર્વના કાળમાં ઘરમાં ગોંધાયેલી (ના !!! સુરક્ષિત રખાયેલી) નારી પર ત્રાસ ગુજરાતા હતા ની વાતો કરનારાઓ ખુલ્લેઆમ જાહેરમાં નારી પર ત્રાસ ગુજરાતા નથી ? ઘરમાં નારીનું સ્થાન વહુ તરીકેનું હોય ત્યારે ઘરની રસોઈ, વડિલોને સાચવવા, બાળકોને તૈયાર કરવા, ઘર સાફ રાખવું, મહેમાનગતિ આવા બધા કૃત્યો તો કરવા જ પડે ને ? દરેક વયે અમુક ચોક્કસ પ્રકારની જવાબદારી તો નીભાવવી જ પડે. બાળપણમાં ભણવું પડે, યૌવનમાં કમાવું પડે, વૃધ્ધત્વમાં સમાજ સેવા, બાળસંસ્કરણ કરવું પડે. (અહી 'કરવું પડે' એમ લખ્યું છે કા.કે. તમે આ બધાને કડાકૂટ સમજો છો !!!)

સંસારમાં રહ્યા તો આ બધુ તો હોય જ ને ? એમાં વળી "કામ કરવું પડે છે !" એમ વિચારીને દુઃખી શા માટે થવાનું ? આ બધાની જેમ ઘરમાં સ્ત્રીને પણ સ્વયોગ્ય કાર્યો કરવા જ પડે. રાજ-રાણી જેવી પૂર્ણવાન સ્ત્રીઓને જ આ બધુ ન હોય. અને એક વાત સમજો કે કામનો બોજો સ્ત્રીના માથે નહી મૂકો તો તેની મનોવૃત્તિઓ અવળે માર્ગ નહી જાય ? આજે પ્રત્યક્ષ દેખાય છે કે જે નારીઓ સ્વતંત્ર ફ્લેટ્સ ધરાવે છે અને તેમના

મતે કુટુંબની કડાકૂટો તેમને નથી તેવી સ્ત્રીઓ પર-પુરુષની સાથે પાપાચરણો સ્વેચ્છાએ કરે છે. આ તેમને ખરાબ પણ લાગતું નથી. આનું મૂળ કારણ છે. ‘લજજાનો અભાવ’

આંખમાં શરમના બિંદુઓ પણ હોય તો સાસુ-સસરા સાથે જગીરીને અલગ થવાનો વિચાર ન આવે. દુઃખ વેઠીને’ય સંયુક્ત રહેવા મન મનાવી લેવાય. આમે’ય સંસારમાં રહો એટલે દુઃખ તો આવે જ. દુઃખ વિનાનો સંસાર કઢી હોય જ નહીં. પણ મન મનાવીને અન્યોની મર્યાદા જાળવીને લાજ-શરમ રાખીને જીવો તો તમને સહારો આપનારા મળી શકે. કોઈનું કમને પણ માન રાખો તો સામેની વ્યક્તિ ક્યારેક તમારું સન્માન જાળવે. તમે સામેનાની વાતને નિર્લજજ બનીને તોડી પાડો તો સામેની વ્યક્તિ તમારું ન જ સાંભળે. કદિ તમારા માટે તેના મનમાં આદરભર્યું સ્થાન ન જળવાય. એટલે કે નિર્લજજ બનીને સામે પડવાથી સામેનાના હદ્યમાં તમારા માટેનું માન ઘટે છે. આ દુઃખનો માર્ગ છે. નિર્લજજ બનીને કોઈપણ ખોટા કામો ન કરવા અને અન્યોને માન આપવું એ સુખી થવાની માસ્ટર-કી છે. આ લજજા નામનો શુભ સદ્ગુણ એકાએક કે રાતો-રાત પ્રગટો નથી. પહેલા તો મનમાં સંકલ્પ કરવો પડે કે મારે લજજાળું થવું છે. પછી જ્યારે એવો પ્રસંગ આવીને ઉભો રહે ત્યારે બેઝામ બોલવાને બદલે ગાળ ને ગળી જતા શીખવું પડે અને આવી રીતે વારંવાર કરવાથી આ ટેવ અસ્થિ-મજજાવત્ સ્થિર થઈ જાય ત્યારે સમજવું કે લજજા નામનો ગુણ પ્રગટી ગયો. અને આ રીતે મહેનત કરીને ગુણ-પ્રગટાવ્યો હશે તો તમને’ય તેની કિંમત સમજશે. મજૂરીના પૈસાની કિંમત મજૂરને કેટલી હોય છે? બસ, એ જ રીતે આ મહેનતથી પ્રગટાયેલ સદ્ગુણ પણ મૂલ્યવાન લાગે છે. આ મનુષ્ય જીવનમાં મળેલા — ૬૦-૭૦ વર્ષની જિંદગીમાં આવા ગુણો પ્રગટાવા માટેનો બોધ મળે છે. માટે માત્ર પૈસો કે જલસામાં જંગળી વેડફી નાખવાના બદલે સદ્ગુણના પ્રગટીકરણ માટે સમયનો સહૃપયોગ કરશો તો સુખી થશો.

ચાલો, સદૈવ સુખ આપનારા આ લજજાના ગુણને પ્રગટ કરી સુખી બનો.

33

દ્યાળુપણું પરાટાવવું

A decorative horizontal border made of a repeating pattern of small, thin-lined circles.

માણસ માત્રને સુખી થવાની ઈચ્છા છે અને વિપુલ માત્રામાં ભોગ-સામૃગ્રીના સાધનો આજના કાળમાં હોવા છતાં'ય સુખી માણસોનો ભયંકર દુકાણ દેખવા મળે છે. માટે જ સુખી બનવાના એકત્રીસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે જણાવ્યુ છે દયાળુપણું પ્રગટાવવું.

દ્વારા થવાથી સુખ અવશ્ય મળે જ. દ્વા એ એવો ગુણ છે કે જે તમને સંસારની સમગ્ર સુખ સામગ્રી ન હોવા છતાં'ય તમને સુખી કરે. અરે ! તમે દ્વા કરવાના કારણે તમારી ભૌતિક સુખ-સામગ્રી ગુમાવો તો'ય તમને સુખ જ મળે. આ વાત એક દણ્ઠાંતથી સમજો.

તમે કયાંક બહાર મહત્વના કામ પર જઈ રહ્યા છો. તમે સારા વસ્ત્રો પહેર્યો છે અને રસ્તા પર બાઈક લઈને નીકળ્યા છો. હવે રસ્તાની બાજુમાં કોઈ ફૂતરું ગટરમાં પડી ગયેલું તમે જુઓ તો શું કરો? બિચારું બહાર આવવા મહેનત કરી રહ્યું હોય જો ઝડપથી બહાર ન નીકળે તો ગટરના પ્રવાહમાં તણાઈને મૃત્યુ પણ પામવાની પૂરી શક્યતા દેખાય છે ત્યારે સજજનવ્યક્તિ તરીકે તમારું કર્તવ્ય શું? (જો તમે સજજન હોવ તો !!!) સ્વાભાવિક છે દિલમાં દ્યા જેવું હોય તો તમે તેને બચાવવા પ્રયત્ન તો કરો જ. પણ તમારો પ્રયત્ન કરવાથી એ બચશે જ એવી કોઈ ગેરન્ટી નથી વળી તમારા કપડા તો ગટરના પાણીથી થોડા ગંદા થશે જ અને કપડા બદલવા ઘરે જતાં તમારે નિશ્ચિત સ્થળે પહોંચતા મોડું પણ થશે. તો તમે શું કરો! અરે! આ પૂછવાનું ન હોય સામાન્ય સજજનતા હોય તો'ય બચાવવાનો યત્ન કરીએ! અને આ મહેનત ૧૫-૨૦ મિનિટ કરવાથી પેલો ફૂતરો બહાર નીકળી ગયો. એનો જીવ બચી ગયો ત્યારે સમય ગુમાવવા છતાં કે કપડા બગડવા છતાં'ય તમને આનંદ થાય કે ન થાય? સ્વાભાવિક છે કે

આપણને આનંદ થાય જ. તો બોલો, તમને હાલ જે આનંદ થયો તે શેનો છે? શું સારી ટેસ્ટી વાનગી ખાધાનો આનંદ છે? ના, કાંઈ ખાધુ તો નથી. તો શું સુંદર કુલની સુગંધ માજ્યાનો આનંદ છે? ના, અહીં તો ગટર હતી. તો શું સારુ પીકચર જોયાનો કે કુદરતી દશ્ય જોયાનો આનંદ છે? ના એવું'ય નથી. તો શું સરસ મજાનું ગીત-સંગીત સાંભળ્યાનો આનંદ છે? ના કાંઈ સાંભળ્યુ નથી. તો આનંદ છે શેનો? કહેવું જ પડશે કે આ મસ્તી આ આનંદ એ તો જીવ બચાવ્યો એનો છે અર્થાત્ 'દયા' નામના સદ્ગુણનો છે.

આ આનંદ સંસારની કોઈ ચીજવસ્તુ કે ઈન્દ્રિયો દ્વારા પ્રાપ્ત નથી પણ આત્મામાંથી જ 'દયા' નામના સદ્ગુણ દ્વારા ઉત્પન્ન થયો છે. બોલો, એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વિના કોઈ મોટી મહેનત કર્યા વિના, કોઈ પણ જતનો સંસારનો ઘસારો ન પહોંચે તે રીતે પણ તમે આનંદપ્રાપ્તિ કરી શકોને? અને તમારે સુખી પણ થવું જ છે ને? જો આ બન્ને પ્રશ્નનો પ્રત્યુત્તર 'હા' જ છે તો તમે સુખી થવા 'દયા' નામનો ગુણ કેમ પ્રગટાવતા નથી? આ 'દયા' એ બીજાને તો સુખી કરશે. તમને ખુદને સુખી કરનારી મૂલ્યવાન ચીજ છે. આ 'દયા' નામનો ગુણ પ્રગટી જાય તો સંસારના કોઈ પણ આનંદ કરતા ચિયાતો આનંદ પ્રાપ્ત થઈ શકે છે.

આજે હિંસાનું તાંડવ ચોમેર ફાટી નીકળ્યું છે. માણસની જાત માનવતા મૂકીને પશુઓ પર છારિ ફેરવી રહી છે. જીવતા મરધા-બકરી, ગાય, ભેંસ, પાડા આદિ જીવો પર કુર કલેઆમ થઈ રહી છે આવા ભીષણ વાતાવરણમાં દયા નામના ગુણનું સ્મરણ પણ થવું દુર્લભ છે. દયાળું વ્યક્તિ કદી કોઈને મારી નાખવાનું તો વિચારી પણ ન શકે. અરે! કોઈને દુઃખી કરવાનું પણ ન વિચારી શકે. અને આવી દયાળુતાથી જ નિરોગી દેહ અને દીર્ଘાયુષ્ય પ્રાપ્ત થાય છે. એક મહાન જૈનાચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા આજથી પઊ વર્ષ પૂર્વ ૧૦૫ વર્ષનું નિરોગી આયુષ્ય પૂર્ણ કરી સમાધિ મૃત્યુને વરેલ તેમને કોઈકે પૂછેલ કે તમે આટલી જૈફ વયે આટલા નિરોગી શી રીતે રહ્યા છો? તેમને કહ્યું કે 'મેં જીવનમાં કદી નાની કીરીને પણ મારી નથી, કદી કોઈનું બૂરુ વિચાર્યુ નથી કદી કોઈ માણસને દુઃખી કર્યો નથી. જો મેં કોઈને દુઃખ ન આપ્યુ હોય તો કર્મસત્તા મને દુઃખ કેવી રીતે આપે?' ખરેખર ખૂબ માર્મિક જવાબ છે. આપણી જુંદગીમાં આપણે

દુઃખી થઈએ છીએ. કા.કે. આપણે કો'કને (ના, ઘણાને !!!) દુઃખી કરીએ છીએ. અને જો આપણે બીજાને સુખી કરતા નથી તો આપણાને સુખ મળે જ શી રીતે ?

દ્યાળુપણુ પરાકાષાએ પહોંચે ત્યારે પોતે દુઃખી થઈને'ય અન્યને સુખી કરવાનો વિચાર આવે છે અને તેનો અમલ થાય છે. એ વખતે પોતે દુઃખી થવા છતાં માણસ મનથી આનંદમાં-મસ્તીમાં રહી શકતો હોય છે. આપણે આપણા પરિવાર, પાડોશી સ્વજન-મિત્રો કે સૃષ્ટિના કોઈપણ જીવને પરેશાન નહીં કરીએ તો કુદરતનું તંત્ર સહજ રીતે સુચારુ ચાલ્યા કરશે.

દ્યાળુપણુ એ સર્વાશે સુખી કરનાર છે. શ્રમણ ભગવાન મહાવીરે અહિંસા પરમો ધર્મ : તું સૂત્ર આચ્યું તેનો તાત્પર્યાર્થી દ્યાળુ થવું તે જ છે. કારણ કે દ્યાળું થયા વિના અહિંસા શક્ય જ છે. કોઈ પણ જીવને મારવા કે સતાવવા તે હિંસાત્મક કિયા છે. અને દ્યાળુ વ્યક્તિ આવી હિંસાત્મક કોઈ પણ કિયા ન કરી શકે. આ હિંસક કિયા ન કરવા માટે તેને સતત સજાગ રહેવું પડે નહીં. સહજ રીતે દ્યાળુ વ્યક્તિ હિંસક કિયા ન કરી શકે તેવું જીવદળ ધરાવતો હોય છે. જો આવી દ્યાળુના જીવનમાં વણાઈ જાય તો સમજો કે તમે સાચા અર્થમાં સુખી થઈ શકો તેમ છો અને જેટલી અંશે હદ્યમાં કુરતાનો પરિણામ છે તેટલું હજુ દુઃખી થવું પડશે. માટે સુખની ઈચ્છા કરનારી પ્રત્યેક વ્યક્તિ 'દ્યાળુપણા' ના ગુણને જીવનમાં ઉતારે.



oo

કાયમ હસમુખા રહેતા માણસો દરેકને ગમતા હોય છે. રોયલ સ્વભાવ, મિલનસાર વ્યક્તિત્વ એ આંતર ઉભતિ માટે પણ જરૂરી બાબત છે માટે જ સુખી થવાના બગ્રીસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે જણાવ્યું છે કે સૌભ્ય પ્રકૃતિવાળા થવું. માણસનો ગુસ્સાવાળો સ્વભાવ એ તેના ભાવિ માટે હાનિકારક છે.

વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે, ગમે તેટલી દોડધામ કરે કે ગમે તેટલો પૈસો ખર્ચે પણ માત્ર સામેની વ્યક્તિને શાંત ચિત્તે હસતુ મોહુ રાખીને આવકાર આપે તો વધુ જલ્દી સામેનાનું દિલ જીતી શકે. સામેની વ્યક્તિ ગમે તેટલો ગુસ્સો લઈને આવી હોય કે ગમે તેટલો ઉકળાટ ઠાલવવા આવી હોય તો પણ તમે સૌભ્ય પ્રકૃતિ ધરાવતા હો તો તમારી પાસે આવીને તે બેફામ બોલી નહીં જ શકે. તમને અનુભવ હશે કે અમુક વ્યક્તિ સામે ઉભી હોય તો આપણે ગાળા-ગાળી-મારામારી ન જ કરી શકીએ. આવી વ્યક્તિઓ મુખ્યત્વે શાંત અને સરળ સ્વભાવની જ હોય છે. આ સૌભ્ય પ્રકૃતિવાળી વ્યક્તિઓ ઘણા-બધા પ્રકારના પાપોથી બચી જાય છે. દા.ત. સૌભ્ય વ્યક્તિ કોઈની સાથે ગમે તેટલી તકરાર થાય તો'ય ખૂન, મારામારી જેવા ભયંકર અનાચાર ન જ સેવે. આના કારણે થતું દુર્ધાન, સામેની વ્યક્તિ પર ખરાબ ઈભ્રેશન, ભવિષ્યમાં દુઃખોત્પાદક પાપકર્મ આદિ આવતા જ અટકી જાય. આપણે હંમેશા નફો વિચારીએ છીએ પણ અમુક બાબતોના સેવનથી ખોટ અટકે છે એ પણ લાભદાયિ છે. સૌભ્ય પ્રકૃતિ એ ઘણા બધા (ઉપર કહેલા) ખોટના રસ્તા બંધ કરનાર છે. કોઈ પણ માણસને કલહ, કંકાસ, કકળાટ આદિ ન જ ગમે. કોઈ કલહપ્રિય વ્યક્તિ પણ લાંબો સમય કંકાસ ન રાખી શકે. માટે સૌભ્ય પ્રકૃતિ એ આપણામાં ધરબાઈને પડેલી જ છે પણ આપણે બાધ્ય નિમિત્તોના કારણે

કોધમાં ખેંચાઈ જઈએ છીએ. આ બાધનિમિત્તો મળવા છતા'ય જો આપણે મનને કાબૂમાં રાખીએ તો આપણી સૌભ્યપ્રકૃતિ સહજરૂપે અભિવ્યક્ત થતી જ રહે. કોઈ આપણને ગાળ આપે, કોઈ આપણા પર ગુસ્સો કરે, કોઈ આપણા પૈસા દબાવી ટે કે આપણા કામમાં વિધન નાંબે આ બધા બાધ નિમિત્તો કોધ ઉપજાવનારા છે અર્થાત્ આપણી સૌભ્ય પ્રકૃતિને હણનારા છે. આ બાધ નિમિત્તો આવવા છતા'ય જો આપણે કાદવમાં કમળ રહે પણ લેપાય નહીં તેવી રીતે નિર્દેખ રહીએ તો કાદવથી કમળ બગડતું નથી તેમ આપણે'ય સામેનાના કોધ રૂપી દુર્ગુણથી બગડીએ નહીં.

પૂર્વે કહ્યું તેમ આ સૌભ્ય પ્રકૃતિ આપણને જન્મજાત મળેલી ભેટ છે પણ માનવીય દુર્ગુણ કોધને ગ્રહણ કરીને આપણે તે ગુમાવી રહ્યા છીએ.

એક સંત હતા. તે કાયમ કો'ક નાના ગામડાઓમાં જ રહેતા અને ધર્મનો ઉપદેશ આપતા. સાછુ અને સારુ તેમનું મસ્ત જીવન. બીજી ભાષામાં કહીએ તો ભગવાનના માણસ. તે સંત એક વખત એક ગામમાં ગયા. ત્યાં ઘણા લોકો તેમનું પ્રવચન સાંભળવા આવ્યા અને સંતે સરળ ભાષામાં કોધ ન કરવાનો ઉપદેશ આપ્યો. કોધની ભયાનકતા, ક્ષમાની મૂલ્યતા સમજાવી. સૌ ભાવિકોએ પણ આ સાંભળી કોધ ન કરવાનો સંકલ્પ કર્યો. પણ કો'ક તો મગમાં કોયડા મગ જેવો હોય ને? એવો એક ભાઈ આગળ આવ્યો અને સંતને કહે મારા'જ! તમે મારી વાત સાંભળો, આ બધા કોધ ન કરવાની પ્રતિજ્ઞા લે છે તો મને'ય થાય છે કે હું'યે પ્રતિજ્ઞા લઈ લઉં. મહારાજ કહે 'તો ભાઈ! લઈ લે એમાં વાર કેમ કરે છે?

પેલો કહે ના મા'રાજ! મારો તો સ્વભાવ જ ગુસ્સો કરવાનો છે. મારો આખો દા'ડો કોધમાં જાય છે. તો હું મારો કોઢી સ્વભાવ કેવી રીતે છોડું?

મારા'જ કહે 'ભાઈ! તુ ભૂલે છે. કોઈ માણસનો સ્વભાવ કોધી હોય જ નહીં. દરેક વ્યક્તિનો સ્વભાવ તો શાંતિનો જ હોય. કોધ તો વિભાવ છે. પે'લો કહે 'ના મારા'જ! મારો તો સ્વભાવ જ કોધનો છે.

અને મારા'જને થયુ આ આમ નહીં માને એટલે તેમણે બીજી રીતે સમજાવવાનો યત્ન કર્યો.

જો ભાઈ ! તારો સ્વભાવ જ કોધનો છે એમ તારું કહેવું છે ને ??? તો એક કામ કર હા'લને હા'લ અહી બેઠા-બેઠા મારી સામે જોરદાર કોધ કર.


પેલો કહે ‘અરે ! પણ એમને એમ કોધ કેવી રીતે થાય ? તમે કોઈ કાંઈ અડપણુ કરો તો જ ગુસ્સો આવે.

મારા’જ કહે : એટલે જ હું કહુ છું કોધ એ તારો સ્વભાવ નથી. જો ભાઈ ! મારો સ્વભાવ શાંત રહેવાનો છે તો હું કોઈ પણ નિમિત્ત વિના શાંત રહુ છુ કે નહીં ?

બસ, તેમ કોઈ પણ નિમિત્ત વગર આપણે જેવા હોઈએ તે જ આપણો સ્વભાવ છે. તળાવમાં પાણી તો એમ જ હોય છે પણ પથ્થર નાખો તો જ વમળ થાય તેમ તારો સ્વભાવ શાંત જ છે. કોઈ નિમિત્ત મળો તો જ ગુસ્સો આવે.

છતાં’ય હવેથી આમ, નિમિત્તોને ગ્રહણ કર્યા કરવા નહીં તો ગુસ્સો નહીં આવે. સંતની વાત સાંભળી તે માણસ પણ સુધરી ગયો.

અસ્તુ. હવે તમારે શું કરવું છે ? સુધરવું છે ? તો ગુસ્સો છોડી સૌભ્યપ્રકૃતિવાળા બનો. શાંત સ્વભાવ અનેકોના દિલમાં તમારું સ્થાન જમાવશે. અને આ સૌભ્ય પ્રકૃતિ તમને ખુદને માનસિક રોગોની બિમારીથી બચાવશે માટે સૌભ્યપ્રકૃતિ નામના ગુણને ધારણા કરી સુખી બનો.





પરોપકાર પરાયણ થવું

માણસ દિનપ્રતિદિન સ્વાર્થી બનતો જાય છે માટે જ વધુ ને વધુ હુંખી થાય છે. બીજાના માટે ઘસાઈ છૂટવાની ભાવના ધરાવતો જીવ હંમેશા સુખી થતો હોય છે. માટે જ સુખી થવાના તેંત્રીસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે ફરમાવ્યું છે કે પરોપકાર પરાયણ થવું. તમે માત્ર એટલું વિચારો કે પૃથ્વી પર તમે એકલા જ રહેતા હોત તો તમારું શું થાત ? તમે કેટલું ટકત ? કોઈ પણ માણસ એકલો નિરાધાર રહી ન શકે. પોતાને મહાન ગણાવતી વ્યક્તિઓ પણ બીજાના સહારા વિના જીવી શકતી નથી. જો આપણે બીજાના સહારે જીવીએ છીએ તો બીજાને સહારો આપવો એ આપણી ફરજ નથી ??? બીજાને સહારો આપવો, બીજા માટે ઘસાઈ છૂટવું, પરોપકાર કરવો આ બધા જ શર્જદો પર્યાયવાચી છે. આવું કરવામાં આપણે કોઈ મોટો ઉપકાર નથી કરતા પણ જેમણે આપણા પર આજ સુધી ઉપકાર કર્યો છે તેમાંથી થોડા-ધણા અંશે ઋણમુક્ત થઈએ છીએ. આ સમગ્ર સૂચિની વ્યવસ્થા આ જ રીતે ટકેલી છે કે દરેક નાની વ્યક્તિ પર તેનાથી મોટી વ્યક્તિ ઉપકાર કરે તે મોટી વ્યક્તિ પોતાનાથી મોટાના સહારે પોતાની જુંદગી જીવે અને એ વિશિષ્ટ મોટી વ્યક્તિ પણ પોતાનાથીય ચિયાતાના સહારે વધુ ઉંચકાવાનો યત્ન કરતી હોય છે. જો આપણે કોઈના સહારે ઉંચકાઈ જવા ઈચ્છીએ છીએ તો આપણી માનવીય ફરજ છે કે આપણાથી નીચેનાને સહારો આપવો. તેને ઘર, ધંધો, અભ્યાસ, મૂંજવણ આદિ કોઈપણ બાબતે યોગ્ય ઉકેલ આપવો. જો આ રીતે દરેક વ્યક્તિ બીજાને માટે ઘસાઈ છૂટે તો સ્વર્ગ અને ધરતીમાં ભેદ જ ન રહે.

આજે ભારતને આજાદ થયે હૃપ વર્ષ થયા એક પીઠ પરિપક્વ દેશ કહી શકાય તેટલી ઉંમર આ દેશની થઈ છે. આધુનિકરણ, વિકાસ, યંત્રવાદ પણ ભારતમાં પૂરબહારમાં ખીલ્યો છે. પણ ત્યારે અહીના માનવોનો આંતરિક વિકાસનો રેશ્યો કેટલો ઉંચો આવ્યો છે તે પણ જોવા જેવું છે. આજથી હૃપ-૭૦ વર્ષ પૂર્વે જ્યારે આપણને

આજાઈ નહોતી મળી ત્યારે ભારતીય વ્યક્તિ પરાયા માણસ માટે પણ નિઃસ્વાર્થભાવે ઘસાઈ છુટતો હતો અને આજે વિકસીત (!) ભારતનો માનવ પોતાના સ્વાર્થ ખાતર સગાભાઈને'ય ઘરી નાખે છે. શું માટે જ ભારતમાં સમૃદ્ધિ વધવા છતાં શાંતિ નથી? શા કારણે ભારતમાં વિશાળ જનસંખ્યા હોવા છતાં'ય દુઃખ છે? તેનો જવાબ આ જ છે કે આપણે બીજાના માટે ઘસાઈ છુટવાનું જાણે બંધ જ કરી દીધું છે. જો પરોપકાર પરાયણતાની પાવન જ્યોત પ્રગટી જાય તો ભારત ચપટીમાં બેહુ થઈ જાય. તમને પરોપકાર શા માટે અનીચ્છનીય ચીજ લાગે છે? બીજાના માટે ઘસાઈ છુટવાથી તો આપણને અન્યોની પ્રેમ, લાગણી, દુવા મળે છે. આજે વિશ્વમાં ઢગલાબંધ વ્યક્તિઓ પ્રસિદ્ધ છે પણ તમે માર્ક કરજો કે જેમની પ્રસિદ્ધ પરોપકારના કારણે થઈ છે તે વધુ લાંબાકાળ સુધી જીવંત રહે છે. આ દેશને આજાદ કરવા માટે પોતાની જાત ઘરી નાખનારા દેશ નેતાઓએ નિઃસ્વાર્થ ભાવે, દેશની પ્રજાના ઉદ્ધાર અર્થે આ ભગીરથ કાર્ય ઉપાડેલ અને માટે જ જુઓ ગાંધીજી કે સુભાષ ચન્દ્રભોજને આજેય લોકો અશ્વુભીની આંખે શ્રદ્ધાંજલી અર્પે છે. તે વખતના ફિલ્મી કલાકારોના નામ પણ આજે આપણને ખબર નથી. બસ, એ જ રીતે આજાના કાળમાં પણ જેઓ નિઃસ્વાર્થભાવે સમાજના લોકોની સેવા અને પશુ-પંખી આદિ સમગ્ર જીવસૂષણીની સંભાળ રાખનારા થશે તે જ આવતીકાલે લાંબા કાળ સુધી પ્રસિધ્ય થશે. જીવદ્યાના પાલન માટે સિંહફાળો નોંધાવનારા શ્રી હેમચન્દ્રચાર્ય અને કુમારપાળ રાજા આજે પણ ગુજરાતમાં ગવાય છે. કારણ તે પરોપકારનો જ એક પ્રકાર હતો. જ્યારે માત્ર રાજ્ય પ્રાપ્તિ ખાતર લડનારા રાજીવીઓના નામ પણ કાળની થાપટોમાં ભૂસાઈ ગયા છે. વળી, પરોપકાર કરવાથી આપણો અહંકાર ઓગળે છે અને નમ્રતા પ્રગટે છે. આ સુંદર ગુણની પ્રાપ્તિ એ કરોડોની સંપત્તિથી પણ મૂલ્યવાન ચીજ છે. કોઈના દિલને સાંત્વન આપવું, કોઈના દુઃખના ગાડા સાંભળીને તેને હલકો થવા દેવો, કોઈને આપણાથી બનતી સહાય કરવી આ બધા જ પરોપકારના કાર્યો છે પણ કોઈ માણસને પરમાત્મા કે સંતોના સત્સંગમાં જોડી દેવો તે આ તમામથી ઉત્કૃષ્ટ પરોપકાર છે. કારણ કે ધર્મમાં જોડાવવાથી એ વ્યક્તિ પાપ કરતો જ અટકી જશે અને જો પાપ કરતો અટકશે તો તેના દુઃખો પણ ઘટવા લાગશે તે સ્વયં અન્ય પર ઉપકાર કરી શકે, અન્યોને માટે ઘસાઈ છૂટે તેવો બની જશે. આ સુકૃત તે સામેની

વયક્તિને સક્ષમ, સમર્થ બનાવવા જેવું મહત્વનું છે. માટે સભ્ય સમાજમાં જેને જેને પરોપકાર કહેવાતો હોય તેવા પ્રકારનો પરોપકાર સદૈવ કરતા રહેવું જોઈએ. કારણ કે સુખી થવા માટે પરોપકાર પરાયણતા જરૂરી છે. પરોપકાર પરાયણતાનો અર્થ એ થાય કે તમારા લોહીના બુંદ-બુંદમાં શરીરના રોમ-રોમમાં પરોપકારકરણની વૃત્તિ વણાઈ જાય. કોઈ જરૂરિયાતમંદને જોઈને તમારે પરોપકાર કરવો ન પડે. તમારાથી સહજભાવે પરોપકાર થઈ જાય. આવી પરોપકાર પરાયણતા જીવનમાં ઉતારી સુખી બનો.

આપણું બોલેલું કદાચ સાકું કામ ન કરી શકે
પણ, આપણું સાકું કામ હમેશા સાકું બોલી જશો.

Gujarat Ni Rashdhara

Gujarat Ni Rashdhara

get free callisme at WWW.AMULYAM.IN

35

૬ અંતરંગ શત્રુને તજવામાં તત્પ્રતા રાખવી

oo

દુશ્મનની ફોજ એ આપણાને આગળ વધવા માટે નડતરરૂપ છે. અને આ માટે જ નિતિશાસ્ત્રોમાં દુશ્મનને ઉગતો જ ડામી દેવાનું કહ્યું છે. પણ દુશ્મનો ઉગી જ ગયા હોય તો તેમની નજીક તો ન જ રહેવું જોઈએ એ સુખી રહેવાનો માર્ગ છે માટે જ સુખી થવાના ચોત્રીસમાં ગુણમાં શ્રમણ ભગવાન મહાવીરે કહ્યું છે કે છ અંતરંગ શત્રુને તજવામાં તત્પરતા રાખવી. આત્માને પીડનારા છ મહાશત્રુઓ છે જે શત્રુઓ સદા'ય તમારા પર આકમણ કરે છે અને તમને પરેશાન કરે છે. અરે ! પાછા આ શત્રુઓ તો તમને દુઃખી કરીને પણ તમે દુઃખી થયા છો તેવી જરા'ય ગંધ આવવા નથી હે'તા ઉલટાના તમે સુખી થયા હો તેવું તમને લાગે છે. જો કે આ સુખાનુભૂતિ તમારો માત્ર બ્રમ છે. વાસ્તવિકતા નથી. આ હ આત્મશત્રુઓમાં પ્રથમ છે (૧) કામ - પરસ્તી, કુમારિકા આદિ કોઈ પણ જે સ્વપત્નીરૂપે જગતમાં સ્વીકાર્ય નથી તેની સાથે અયોગ્ય ચેષ્ટા કરવી દુઃખનું કારણ છે. વિકારોના કારણો આવી દુર્વૃત્તિઓ પેદા થાય તો પણ તેને માનસિક રીતે શાંત બની વૃત્તિઓને ઉર્ધ્વગામી બનાવી દુર્વૃત્તિઓની નાભૂદી કરવી જોઈએ. બાકી તેને વશ થઈને અફ્ક્યુ કરવાનું તો અદ્યાવધિ દુનિયાના



લોકો કરતા જ રવ્યા છે પણ કોઈને'ય કદી તૃપ્તિ થઈ નથી. માટે 'કામ' નામના આંતરશત્રુને તજવા તત્પર રહેવું જોઈએ.

(२) આપણો બીજો આંતર શરૂ છે કોષ. બીજાના હુખનો વિચાર કર્યા વિના કોપ કરવો એ કોષ કહેવાય. (બાકી સામેની વ્યક્તિના સુખમય ભાવિ માટે માધ્યસ્થ્ય ભાવે ગુસ્સો કરવો

પડે એ તમે જવાબદારી ભર્યા સ્થાને હો ત્યારે કોધરૂપ ન કહેવાય.) કોધ કરવાથી આપણા પ્રત્યે સામેવાળી વક્તિને અપ્રિતિ થાય છે. આપણે અન્ય વક્તિઓમાં અળખામણા થઈ જઈએ છીએ અને આપણી દુઃખિયારી પરિસ્થિતિમાં આપણો કોધી હોઈએ તો આપણી સાથે ઉભા રહેનારા મળી રહે નહીં. માટે કોધ તો પ્રત્યક્ષ જ દુઃખી કરનાર છે. વળી અનેક માનસિક અને હૃદય સંબંધી ભયંકર રોગો જે માણસને કયાં તો મૃત્યુ સુધી પહોંચાડે છે. કયાં તો રીબાવી રીબાવીને જીવાડે છે તેનું ઉત્પાદન કોધ જ કરે છે માટે તે તજવો જોઈએ.



(૩) ત્રીજો આંતરશત્રુ છે લોભ.

માણસને હંમેશા પૈસાની લાલચ રહે જ છે અને પૈસાથી આગળ વધીને જમીન, પત્ની, ઘર, ગાડી, ફાર્મહાઉસ આદિ તમામ ચીજો પર મમત્વ થવાથી લોભ જાગે છે. ત્યારબાદ જો કોઈ જગ્યાએ પોતાના ધન આદિનું દાન કરવાનું આવે તો આ મમત્વ દાન કરવા બાબતે અરૂપિ ઉપજાવે છે અર્થાત્ દાન કરવું જ ન પડે તેવા બહાના શોધતા લોકો લોભી છે તેમ માની શકાય. લોભની આ ગ્રબળતાના કારણે જ માણસને મૃત્યુ વખતે જ્યારે એક સાથે પૈસો, પત્ની, પરિવાર, ગાડી, બંગલો, દુકાન આદિ છોડવાનો વખત આવે છે ત્યારે તિત્ર દુઃખાનુભૂતિ થાય છે. આને બદલે આ બધું અહીં છોડીને ચાલ્યા જવાનું છે એમ વિચારી દાન કરતા રહેવું અર્થાત્ મમત્વનો ત્યાગ કરવા પૂર્વક પોતાની માલિકીનું અન્યોને માટે આપતા રહેવું કે ધર્મદા કરવું જોઈએ. વળી, દાન પણ ત્યારે જ શોભે જો તમારો પૈસો નિતિમાર્ગેથી આવેલ હોય અન્યાયના રસ્તે પૈસો કમાઈને ધર્મમાં વાપરવો એ સારી બાબત નથી. અજાણતા કે અણસમજમાં જે ધન અન્યાયથી કમાઈ લીધું હોય, પારકાને પેટે પાટુ મારીને ભેગુ કર્યું હોય તેનો ત્યાગ કરી ફરી કદી આવી રીતે ધનપ્રાપ્તિ ન કરવાનો સત્રસંકલ્પ કરી લોભને વશ કરવો જોઈએ.

(૪) આપણો ચોથો આંતર શત્રુ છે માન અર્થાત્ અહંકાર. મનુષ્યને કોઈ પણ કાર્ય કર્યાનો ધમંડ તરત જ આવી જતો હોય છે અને તેના દ્વારા તે અન્યોને તુચ્છ કે હલકા ગણી નાખતો હોય છે. આવા અહંકારી માણસો (શું તમે ખરા !!!) પોતાની વાતને જડતાપૂર્વક પકડી રાખે છે. (પછી તે ખોટી હોય તો પણ !) ખોટી વાત તમે કરો

“ego”

is the only requirement
to destroy any relationship

So, be a bigger person
skip the “e” and let it “go” !

જ નહી પણ કદાચ થઈ ગઈ તો તેને પક્કામાં લેવાની મૂર્ખમાં તો ન જ કરતા કારણ કે એક તો ખોટુ કામ અને તેમાં પણ તમે જડતા રાખો તો પછી હુનિયા તમને કેવી માને ? આવા ખરાબ દેખાવાનું (અરે ! ખરાબ બનવાનું !) શું યોગ્ય છે ? ના જરા’ય નહી માટે માનનો પણ જીવનમાંથી નિકાલ કરવો જોઈએ.

(૫) પાંચમાં આંતરશત્રુ છે મદ. આમ

તો મદ અને માન બને સમાન જેવા લાગે છે પણ ફરક છે માન માત્ર કદાચાદ રૂપ જ છે અને મદ પોતાની જાતિ, કુળ, રૂપ, સંપત્તિ, જ્ઞાન આદિના અહંકાર રૂપ છે.

STATUS



ધર્મશાસ્ત્રોમાં આવા અહંકારીઓ માટે સ્પષ્ટ જણાવ્યુ છે કે ‘જે મદ કરે તે રદ થાય.’ અર્થાત્ તમે અહંકાર કરો તો મોટા કામો કરનારા મહાનુભાવોમાંથી તમારી બાદબાકી થઈ જાય તમે ફરીથી તેવા મોટા કામો ન કરી શકો. આપણે કંઈ આપણને મળેલ શક્તિઓનો અહંકાર ન કરવો જોઈએ. અન્યથા એ

શક્તિ ફરીથી પ્રાપ્ત થતી નથી. એ જ રીતે જે લોકો પાસે આવી શક્તિ ન હોય તેમનો તિરસ્કાર પણ ન કરવો.

(૬) આપણો છઢ્યો આંતરશત્રુ છે હર્ષ. હા ! હર્ષ અર્થાત્ આનંદ પણ આપણો શત્રુ છે. પણ બીજાને પીડવા દ્વારા ઉત્પન્ન થતો આનંદ એ જ આપણો શત્રુ છે બીજો આત્મિક આનંદ નહીં. ઘોડા દોડાવવા કે ફાસ્ટ બાઈક ચલાવવું બસે બીજા અનેક નાના (જમીન પર ફરતા) જંતુઓનો ધાત કરનાર છે. તેવી જ રીતે વિજણીના ઉત્પાદનમાં ચિકાર જીવ હિંસા થાય છે. માટે ઇલેક્ટ્રીક સાધનોના ઉપભોગથી ઉત્પન્ન આનંદ-હર્ષ પણ પરપીડાથી જ ઉત્પન્ન થાય છે જે આપણા માટે નુકશાન કારક છે. કોઈને દુઃખી કરીને સુખી થવાથી ભવિષ્યમાં દુઃખી જ થવું પડે છે.

આ ઇ પ્રકારના શત્રુઓ આપણાને આ જન્મમાં કે પરભવમાં સર્વત્ર દુઃખી કરનાર બનનાર છે. તેમનાથી દૂર રહેવું એમાં જ શાશપણ છે.

આ ષડ્ધાંતર શત્રુને તજીને સુખી બનો.




૩૭

જિતેન્દ્રિય બનવું



સુખ-પ્રાપ્તિની દોડમાં માનવ સાચા સુખનું સરનામું જ ભૂલીને આડા માર્ગે ચઢી ગયો છે અને માટે જ સાચા સુખના એર્સેસ રૂપે શ્રમજા ભગવાન મહાવીરે સુખી થવાના ઉપ માં અને અંતિમ ગુણમાં ફરમાવ્યુ કે જિતેન્દ્રિય બનવું.

મનુષ્યને ચામડી, જીબ,
નાક, આંખ અને કાન આ પાંચ
ઈન્ડ્રિય જન્મથી જ મળેલ છે અને
તે ઈન્ડ્રિયોનો માલિક આપણો
આત્મા છે. ઈન્ડ્રિયો તો આપણને
પૂર્ણયના કારણે સુખ ભોગવવા
મળેલ સાધન માત્ર જ છે. આ
ઈન્ડ્રિયો પર આપણો અર્થાત્
આપણા જ આત્માનો કંન્ટ્રોલ
હોવો જોઈએ આજે તેના બદલે



આપણે ઈન્ડ્રિયના ગુલામ થઈ ગયા છીએ. જીબ ચટાકેદાર ભોજન માંગે અને તમે હોટલ તરફ પ્રયાણ આદરો. આંખ કાંઈક મનોરંજક દશ્યો જોવા જંખે અને ટી.વી. સામું બેસી જાઓ. કાન મધુર સંગીત માંગે અને તમે MP3 સ્ટાર્ટ કરો આ આપણો ઈન્ડ્રિયોના ગુલામ છીએ તેની જ નિશાની છે. તમે વિચારો કે તમારો નોકર તમને કહે 'એ 'ય ! આમ કર.' તો તમે કરો ખરા ? ના ન કરીએ. કારણ નોકર આપણને કહી જાય એ યોગ્ય ન જ કહેવાય તો ઈન્ડ્રિયો તમને નચાવી જાય તે શી રીતે ચાલે ?

ઇન્દ્રિયો જે માંગે તે આપી દેવામાં જરા'ય બહાદુરી નથી. આ તો નામદારનગરીની નિશાની છે. કોઈ નબળી વ્યક્તિ પાસેથી કોઈ ગુંડો બળજબરીથી પૈસા પડાવી જાય તેવી જ આ ઘટના છે. કે ઇન્દ્રિયો બળજબરીથી તમારી પાસેથી પોતાની ઇચ્છિત ચીજો માટે ખર્ચ કરાવે છે. તમને થશે કે ઇન્દ્રિયો જે માંગે તે આપવાથી અમને સુખ જ થાય છે ને ? દા.ત. જ્ઞાને કેરી માંગી અને અમે ખાધી તો મીઠાશની મજા અમને જ મળી ને ??? આ તમારો નહી આખી હુનિયાનો પ્રશ્ન છે. પણ આ બાબતે તમારે હજુ ઘણી જાણકારી જરૂરી છે. તમે આ બાબતે અજ્ઞાન છો !!!

તમારા દ્વારા ખવાતી કેરીનું સુખ એ તમારું શરીર જ ભોગવે છે. પણ તમારો આત્મા નહી. અને આ કેરી ખાવાથી તમને જે મજા પડી તેનાથી પાપ લાગ્યું કારણકે શાસ્ત્રોમાં કહ્યું છે કે રાગ, દ્વેષ અને અજ્ઞાન આ ત્રણના કારણે પાપકર્મ બંધાય છે. કેરી ભાવવી એ રાગ છે. તો તેમાં પાપ લાગે જ ને ? અને આ પાપના ઉદ્ય વખતે તમને દુઃખ જ મળશે ને ? તો એનો અર્થ એ થયો કે કેરી ખાવાના સુખને માણવાથી તમારે દુઃખ પણ પામવાનો વારો આવ્યો. તો આના કરતા જ્ઞાને કેરીનું સુખ ન આપ્યું હોત તો શું વાંધો હતો ? ના આમ ઇન્દ્રિયોને ગમે તેવું આપવાનું બંધ કરી દેવાથી જીવનમાં મજા જ ન પડે તેવું માનવાની ભૂલ ન કરવી, કારણ કે ત્યાગ, વૈરાગ્ય જ સાચો આનંદ આપનારી ચીજ છે. તમે ૫-૫૦ ગરીબોને મીઠાઈ ખવડાવીને પણ મજા માણી શકો છો. આ તમે અનુભવી શકો તેવી વાત છે તમારી મહેનતની સંપત્તિથી તમે કાંઈક મેળવ્ય અને તે ગરીબોને વહેંચી દીધું તે ખાઈને રાજી થતા ગરીબોના ખુશ મોઢા તમને મીઠાઈ ખાવાના આનંદ કરતા પણ વધુ આનંદ આપી શકે. બસ, એ જ રીતે ઘરમાં શીરો, જલેબી કે દૂધપાક બનાવ્યો. તે જમતી વખતે તમારી થાળીમાં પીરસાય છે. દરેક વ્યક્તિએ એ ભાવતી ચીજ લીધી તમે તે વખતે સંકલ્પ કરો કે ના, આ મીઠાઈ ખાવાથી મને રાગ થઈ જાય તો મને દુર્ગતિમાં દુઃખ પડશે. આમે'ય રોટલી ખાઉં કે મીઠાઈ કાલે સવારે તો પેટમાંથી વિષા થઈને જ બહાર નીકળવાનું છે. તો શા માટે રાગનું પાપ કરવું ? આવું વિચારીને તમે મીઠાઈ છોડી દો અને રોટલી-શાક જ ખાઓ તો પણ તે વખતે તમને મનને જીત્યાનો એટલો આનંદ આવશે કે મીઠાઈ ખાધાનો આનંદ તો તેની સામે ઝીકડો લાગે. માટે વસ્તુને ભોગવીને જ સુખી થવાય તેવું આજ સુધી જે માનેલું છે તે મનમાંથી

કાઢી નાંખો. અને હવે આ શ્રમણ ભગવાન મહાવીર કથિત આપણી હિન્દુ પરંપરાની સાચી વાત મગજમાં બેસાડી દો કે સાચુ સુખ તો ત્યાગવામાં જ રહેલુ છે. આમે'ય તમે ભોગવી-ભોગવીને કેટલુ ભોગવી શકો ૫-૨૫ મીઠાઈ, ૨-૪ પિકચર, ૧૦-૨૦ મસ્ત ગીતો, ૦॥ -૧ કલાક બગીચાની સુગંધ આટલુ તો તમારી ભોગવાની ક્ષમતાની ટોચની મર્યાદા છે. મતલબ વિશ્વમાં ભોગવવાના જે દ્રગલાબંધ સાધનો છે તેમાંથી એક સાથે તમે વધુમાં વધુ આટલું જ ભોગવી શકો એક સાથે આનાથી વધુ ભોગવવાની કોઈની તાકાત નહી ! જ્યારે વિશ્વના તમામ પ્રકારની ભૌતિક સુખની ચીજો એક સાથે ત્યાગવાનું તો આજે પણ શક્ય છે ! હા !!! આ આશ્ર્ય પામવા જેવી વાત નથી. સાવ સાચી વાત છે.

જૈન સાધુ દીક્ષા

લેતાની સાથે જ
સમગ્ર સંસારની
ભૌતિક ચીજો
ત્યાગવાનો
અખૂટઆનંદ
મેળવી શકે છે.
માટે જ સૌથી
ઉત્કૃષ્ટ સુખી
તરીકેનો દાવો
તેઓ કરી શકે
છે. આ ત્યાગ
જીતન્દ્રિય
વ્યક્તિ જ કરી
શકે જેઓ
ઈન્દ્રિયોની



ગુલામીમાં જ તુબેલ છે તે કદી ત્યાગ કરવાનો વિચાર પણ ન કરી શકે. અને તો પછી ત્યાગના સુખને માણવાની કલ્પના તો કેવી રીતે કરી શકે ? પણ તમારો વૈરાગ્ય કાચો

હોય તો તમને આ બધું ત્યાગ્યા પછી કયારેક એમ વિચાર આવે કે મને આટલું બધું ભોગવવા મળતું હતું અને કયાં ત્યાગ્યું ? ત્યારે ત્યાગનો સાત્વિક આનંદ પણ ઉડી જાય. પણ આવા સમયે આધ્યાત્મિક ઉર્જવાનું સંતો ગુરુભગંગતો તમને સમજાવે કે ત્યાગનું મહત્વ શું ? ત્યાગ કરતી વખતે તેંબે કેટલો આનંદ પ્રાપ્ત કરેલ ? અને આ બધું સાંભળીને તમારા હદ્યમાં પુનઃ વૈરાગ્યની જ્યોત પ્રજવલિત થઈ જાય અને પાછા તમારી આનંદધારા પ્રાપ્ત કરી લેવાય માટે ભવિષ્યમાં વૈરાગ્ય નબળો પડશે તો શું કરશું એમ વિચારી ત્યાગ જ ન કરવો એ મૂખ્યાઈ છે. અને બદલે ઈન્દ્રિયો વશમાં આવે ત્યારે જે – તે ભૌતિક સાધનોનો ત્યાગ કરી ત્યાગની સાત્વિક મસ્તી માણી લેવામાં જ ઉહાપણ છે અને પછીથી કયારેક ઈન્દ્રિયો કાબુ બહાર જાય તો સંસારત્યાગી ગુલાઓના સત્તસંગ દ્વારા પુનઃ તેને વશમાં લાવી દેવાય.

માટે જ શ્રમજ્ઞ ભગવાન મહાવીરે કહ્યું છે કે જિતેન્દ્રિય થવું એ સાચા સુખનું સરનામું છે.

આ સુખી થવાના ઉપ ગુણો ધર્મગ્રંથોમાં માગિનુસારિતાના અર્થાત્ આત્મધર્મની પ્રાથમિક યોગ્યતાના ઉપ ગુણ તરીકે દર્શાવેલ છે. આ તમામની પ્રાપ્તિ તમારી જીંદગીને ખૂબ જ (તમે પણ ન કલ્પી શકો તેવી) રળીયામણી બનાવી શકે છે. માટે આવી સમુજ્જ્વળ જીંદગીની પ્રાપ્તિ માટે આ ગુણો જીવનમાં ઉતારો એ જ શુભેચ્છા. શ્રમજ્ઞ ભગવાન મહાવીરની આજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો.

મિશ્રામિ હુક્કડમ્ય

